

ડીનશ્રીની કચેરી  
સરકારી મેડિકલ કોલેજ,  
એસ. ટી. સ્ટેન્ડની બાજુમાં, જેલ રોડ  
ભાવનગર.

ટેલીફોન નંબર : - (૦૨૭૮) ૨૫૧૧૫૧૧/૨૪૩૦૮૦૮

ફેક્સ નંબર :- (૦૨૭૮) ૨૪૨૨૦૧૧

ઇ-મેલ :- [dean.health.bhavnagar@gmail.com](mailto:dean.health.bhavnagar@gmail.com)

-----

વર્ષ:- ૨૦૧૮-૨૦૧૯

માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૪  
અંતર્ગત તૈયાર પુસ્તિકા

તારીખ- ૦૧/૦૫/૨૦૧૯ ની સ્થિતી

# અનુક્રમણિકા

ક્રમ	વિગત	પાના નંબર
૧	પ્રસ્તાવના	૩ થી ૬
૨	નિયમ સંગ્રહ-૧	૭ થી ૮
૩	નિયમ સંગ્રહ-૨	૮ થી ૨૫
૪	નિયમ સંગ્રહ-૩	૨૬
૫	નિયમ સંગ્રહ-૪	૨૭
૬	નિયમ સંગ્રહ-૫	૨૮
૭	નિયમ સંગ્રહ-૬	૨૯
૮	નિયમ સંગ્રહ-૭	૩૦
૯	નિયમ સંગ્રહ-૮	૩૧ થી ૪૪
૧૦	નિયમ સંગ્રહ-૯	૪૫ થી ૫૩
૧૧	નિયમ સંગ્રહ-૧૦	૫૪ થી ૬૧
૧૨	નિયમ સંગ્રહ-૧૧	૬૨
૧૩	નિયમ સંગ્રહ-૧૨	૬૩ થી ૬૪
૧૪	નિયમ સંગ્રહ-૧૩	૬૫
૧૫	નિયમ સંગ્રહ-૧૪	૬૬
૧૬	નિયમ સંગ્રહ-૧૫	૬૭
૧૭	નિયમ સંગ્રહ-૧૬	૬૮ થી ૬૯
૧૮	નિયમ સંગ્રહ-૧૭	૭૦ થી ૭૩
૧૯	આર. ટી. આઈ ફોર્મ- નમુનો-“ક”	૭૪ થી ૭૫
૨૦	પ્રથમ અપીલ દાખલ કરવા માટેનું ફોર્મ- નમુનો- “ચ”	૭૬
૨૧	આર. ટી. આઈ. એન્યુઅલ રીપોર્ટ વર્ષ- ૨૦૦૬-૦૭ થી વર્ષ-૨૦૧૮-૧૯	૭૭ થી ૮૯

## પ્રકરણ-૧

### પ્રસ્તાવના

૧.૧	<p>આ પુસ્તિકા (માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫) ની પશ્ચાદ ભૂમિકા અંગે જારાકારી</p> <p>પ્રત્યેક જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારું તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચોની રચના અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુસંગિક બાબતો માટેની જોગવાઈ કરવા બાબતનો અધિનિયમ.</p> <p>ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીની અતિઆવશ્યક કામગીરી માટે નાગરિકોને માહિતગાર રાખવા અને માહિતીની પારદર્શિતા માટે મહત્વની જરૂરી છે, અને ભૂષાચારને નિયંત્રણમાં રાખવા અને સરકારો અને તેના માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે પણ જરૂરી છે. ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારનાં કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાણાંકીય સાધનોનો મહત્વમાં ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જગતવણી સહીતનાં બીજા હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે અને લોકશાહી આદર્શની સર્વોપરીતા જગતવતી વખતે આ સંઘર્ષસહીત હિતો વચ્ચે સંવાદીતા સાધવી પણ જરૂરી છે.</p>
૧.૨	આ પુસ્તિકાનો ઉદેશ - હેતુ :-
	આ સંસ્થા ખાતેની સંલગ્ન માહિતી જાહેર હિતાર્થે આપવા.
૧.૩	આ પુસ્તિકા કઈ વ્યક્તિઓ/સંસ્થા/સંગઠનો વગેરેને ઉપયોગી છે
	જાહેર જનતા માટે
૧.૪	આ પુસ્તિકામાં આપેલી માહિતીનું માળખું :-
	<p>ક. અધિનિયમના અમલ પહેલા પુરાં કરવાનાં કાર્યો :</p> <p>નિયમસંગ્રહ</p> <p>૧. નિયમસંગ્રહ તૈયારી</p> <p>માહિતીના અધિકારના ખરડાના ખંડ (૪) (અ) માં જોગવાઈ છે કે દરેક જાહેર સત્તાતંત્રે આ અધિનિયમના અમલથી ૧૨૦ દિવસમાં નીચેના ૧૭ નિયમસંગ્રહ (મેન્યુઅલ) નું સંપાદન અને પ્રકાશન કરવાનું રહેશે.</p> <p>૧. તેમની સંસ્થા, કાર્યો અને ફરજોની વિગતો</p> <p>૨. તેમના અધિકારો અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો</p> <p>૩. દેખ-રેખ અને જવાબદારીઓ ચેનલો સહિત નિર્ણય-પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય-પદ્ધતિ.</p> <p>૪. તેમના કાર્યો કરવા માટેના તેમણે નિયત કરેલા ધોરણો</p> <p>૫. તેમના કાર્યો કરવા માટે તેમણે અથવા તેમના તાબા હેઠળ અથવા તેમના કર્મચારીઓ દ્વારા જગતવેલા નિયમો વિનિયમો, સુચનાઓ, નિયમ-સંગ્રહો અને રેકર્ડ.</p> <p>૬. તેમના અથવા તેમના નિયંત્રણ હેઠળ રહેલા દસ્તાવેજોના પ્રકારોનું પત્રક</p> <p>૭. તેમની નીતિ ઘડવા અંગેના અથવા તેમના વહીવટ અંગેના જાહેર જનતા સાથેના પરામર્શ અથવા પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગતો</p> <p>૮. બોર્ડ, પરિષદો, સમિતિઓ અને તેમના ભાગ તરીકે અથવા તેની સલાહના ઉકેલથી, બે થી વધુ સહ્યોનાં બનેલાં અને આ બોર્ડ, પરિષદો, સમિતિઓ અને મંડળોની બેઠકો જાહેર જનતા માટે ખુલ્લી છે કે કેમ ? અને આવી બેઠકોની કાર્યવાહીની નોંધ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે કે કેમ, તે અંગેનું પત્રક.</p> <p>૯. તેમના અધિકારીઓ અને કર્મચારીઓની નિર્દેશિકા.</p>

	<p>૧૦. તેમના વિનિયમોમાં કરેલી જોગવાઈ મુજબના વળતરની પદ્ધતિ સહિત, તેમના દરેક અધિકારી અને કર્મચારીને મળતુ માસિક મહેનતાણુ.</p> <p>૧૧. તેમના વિનિયમોમાં કરેલી જોગવાઈ મુજબના વળતરની પદ્ધતિ સહિત, તેમના દરેક અધિકારી અને કર્મચારીને દર્શાવતું ફાળવેલું બજેટ.</p> <p>૧૨. ફાળવેલી સહાયકી અને સહાયકી કાર્યક્રમોના લાભાર્થીઓની વિગત સહિત આવા કાર્યક્રમોના અમલની પદ્ધતિ.</p> <p>૧૩. છુટછાટ, પરવાનગીઓ અથવા અધિકારપત્ર મેળવનાર અંગેની વિગતો.</p> <p>૧૪. તેમની પાસે ઉપલબ્ધ અથવા તેમની પાસે રહેતી વીજાણું માધ્યમમાં રૂપાંતરિત (ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ) માહિતીની વિગતો.</p> <p>૧૫. તેમની સંસ્થામાં જાહેર ઉપયોગમાં રાખેલી પુસ્તકાલય અથવા વાંચનામંડળની સવલતો માટેના સમય સહિત, નાગરિકોને માહિતી મેળવવા માટેની પ્રાપ્ત સગવડોની વિગતો.</p> <p>૧૬. સરકારી માહિતી અધિકારીઓનાં નામ, હોદાઓ અને અન્ય વિગતો.</p> <p>૧૭. નિયત કર્યા પ્રમાણેની આવી અન્ય માહિતી</p>
૧.૫	વ્યાખ્યાઓ:-
	<p>૨ આ અધિનિયમમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિ ન હોય તો,-</p> <p>(ક) "સમુચ્ચિત સરકાર" એટલે -</p> <p>(૧) કેન્દ્ર સરકાર અથવા સંઘરાજ્ય ક્ષેત્ર વહિવટ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા, અથવા ફંડ રૂપે મોટા પાયે ઘિરાણ મેળવેલ જાહેર સત્તામંડળ સંબંધમા, કેન્દ્ર સરકાર.</p> <p>(૨) રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ઘિરાણ મેળવેલ જાહેર સત્તામંડળના સંબંધમા રાજ્ય સરકાર</p> <p>(૫) "કેન્દ્રીય માહિતી પંચ" એટલે કલમ- ૧૨ ની પેટા કલમ (૧) હેઠળ રચાયેલ કેન્દ્રીય માહિતી પંચ</p> <p>(૬) "કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી" એટલે કલમ (૫) ની પેટા કલમ (૧) હેઠળ મુકદર કરેલ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અને તેમાં પેટા- કલમ (૨) હેઠળ મુકદર કરેલ કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારીનો સમાવેશ થાય છે.</p> <p>(૮) "મુખ્ય માહિતી કમિશનર" અને "માહિતી કમિશનર" એટલે કલમ (૧૨) ની પેટા-કલમ (૩) હેઠળ નીમાયેલ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર</p> <p>(૮) "સક્ષમ સત્તાધિકારી" એટલે-</p> <p>(૧) લોકસભાના અથવા રાજ્ય વિધાનસભાના અથવા એવી વિધાનસભાના ધરાવતા સંઘરાજ્ય ક્ષેત્ર ના કિસ્સામાં અધ્યક્ષ અને રાજ્યસભાના અથવા રાજ્ય વિધાન પરિષદના કિસ્સામાં અધ્યક્ષ</p> <p>(૨) ઉચ્ચતર ન્યાયાલયના કિસ્સામાં, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ</p> <p>(૩) ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ</p> <p>(૪) સંવિધાનથી અથવા તે હેઠળ સ્થપાયેલા અથવા રચાયેલા બીજા સત્તામંડળોના કિસ્સામાં રાજ્યપતિ અથવા રાજ્યપાલ</p> <p>(૫) સંવિધાનની કલમ - ૨૩૯ હેઠળ નીમાયેલા વહિવટદાર</p> <p>(૮) " માહિતી " એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ- મેઈલ, અભિપ્રાયો, સલાહ, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમુના, મોડલ્સ, કોઈ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી- સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી,</p>

- (જ) "દરાવેલુ" એટલે સમુચ્ચિત સરકારે અથવા યથાપ્રસંગ સક્ષમ સત્તામંડળે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી દરાવેલુ ;
- (ઝ) "જાહેર સત્તામંડળ" એટલે-
- (ક) સંવિધાનથી અથવા તે હેઠળ
  - (બ) સંસદે કરેલા કોઈ બીજા કાયદાથી
  - (ગ) રાજ્ય વિધાનમંડળે કરેલા કોઈ બીજા કાયદાથી
  - (ધ) સમુચ્ચિત સરકારે બહાર પાડેલા કોઈ જાહેર નામાથી અથવા કરેલા કોઈ હુકમથી, સ્થાપેલ અથવા રચેલ કોઈ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજ્યની સંસ્થા, અને તેમાં સમુચ્ચિત સરકારે પુરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે
  - (૧) માલિકીના નિયંત્રણ અથવા મોટા પાયે ઘિરાણ મેળવેલ મંડળ
  - (૨) મોટા પાયે ઘિરાણ મેળવતા બિન-સરકારી સંગઠનો, પણ સમાવેશ થાય છે.
- (૨) " રેકર્ડ" માં નિયેનાનો સમાવેશ થાય છે :-
- (ક) કોઈ દસ્તાવેજ હસ્તપ્રત અથવા ફાઈલ
  - (ખ) કોઈ દસ્તાવેજની માઈકોફિલ્મ, માઈકોફિશ, અથવા ફેસીમાઈલ નકલ
  - (ગ) આવી માઈકોફિલ્મમાં સમાવિષ્ટ પ્રતિકૃતિ અથવા પ્રતિકૃતિઓની (મોટી કરેલી હોય કે ન હોય તો પણ) કોઈ નકલ અને
  - (ધ) કોમ્પ્યુટર અથવા બીજા કોઈ સાધનથી રજુ કરાયેલી બીજી કોઈ સામગ્રી
- (૩) " માહિતીનો અધિકાર " એટલે અધિનિયમ હેઠળ કોઈ બીજા સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં-
- (૧) કામકાજ, દસ્તાવેજો રેકર્ડની તપાસ કરવાના
  - (૨) દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના
  - (૩) સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના
  - (૪) ફ્લોપી, ટેપ વિડિયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજા કોઈ ઇલક્ટ્રોનિક પદ્ધતિ અથવા માહિતી કોઈ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઈ સાધનમાં સંગૃહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે.
- (૪) " રાજ્યના માહિતી પંચ " એટલે કલમ-૫ની પેટા-કલમ(૧)હેઠળ રચાયેલું રાજ્ય માહિતી પંચ
- (૫) " રાજ્યના મુખ્ય માહિતી કમિશનર " અને " રાજ્યના માહિતી કમિશનર " એટલે એટલે કલમ ૧૫ની પેટા-કલમ (૩) હેઠળ નીમાયેલા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને રાજ્યના માહિતી કમિશનર
- (૬) " રાજ્યના જાહેર માહિતી અધિકારી " એટલે કલમ પની પેટા-કલમ(૧) હેઠળ મૂકરર કરેલ રાજ્યના જાહેર માહિતી અધિકારી અને તેમાં પેટા કલમ (૨) હેઠળ એવા રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારીનો પણ સમાવેશ થાય છે.
- (૭) "ત્રાહિત પક્ષકાર" એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઈ વ્યક્તિ અને તેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.

૧.૬	કોઈ વ્યક્તિ આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માંગે તો તે માટેની સંપર્ક વ્યક્તિ.
	અધિક ડીન અને જાહેર માહિતી અધિકારી, વહીવટી અધિકારી તેમજ મદદનીશ જાહેર માહિતી અધિકારી સરકારી મેડિકલ કોલેજ ભાવનગર.
૧.૭	આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્યપદ્ધતી અને ફી માહિતી મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે ?

- (૧) જે બાબત માટે માહિતી મેળવવાની હોય તેની વિગતો દર્શાવતી અરજી સરકારી માહિતી અધિકારીને લેખિતમાં અથવા વિજાપુર માધ્યમો દ્વારા અંગેજુમાં અથવા હિન્દીમાં રાજભાષામાં કરવી.
- (૨) કઈ બાબત અંગે માહિતી મેળવવાની છે તે અંગેના કારણો દર્શાવવાની જરૂર નથી
- (૩) નિયત કરવામાં આવે તેટલી ફી ચુકવો (જો ગરીબી રેખા હેઠળની કક્ષામાં ન આવતાં હોય તો)
- (૪) માહિતી મેળવવા માટેની સમય મર્યાદા કેટલી છે ?
- (૧) અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસ સુધીમાં
  - (૨) વ્યક્તિની જીંદગી અને સ્વતંત્રતા સંબંધી માહિતી મેળવવા માટે ૪૮ કલાક
  - (૩) જો આમાં પ્રજા પક્ષકારનાં હિત સમાયેલા હશે તો સમય મર્યાદા ૪૦ દિવસ સુધીની રહેશે (મહત્વમાં મુદા પક્ષકારને રજુઆત કરવા માટેનો આપેલો સમય )
- (૫) નિર્દિષ્ટ સમય મર્યાદામાં માહિતી આપવામાં નિષ્ણળ જવું એ માની લીધેલો અસ્વીકાર છે ?
- (૧) અરજી કરવાની નિયત ફી વ્યાજબી હોવી જોઈએ.
  - (૨) જો વારે ફી ની જરૂર હોય તો એટલી, રકમ કેવી રીતે થાય તેની ગણતરીની વિગતો લેખિતમાં જણાવવી જોઈએ.
  - (૩) યોગ્ય અપીલ અધિકારીને અરજી કરીને સરકારી માહિતી અધિકારીએ લીધેલી ફી અંગેના નિર્ણયની તપાસ કરવા અરજદાર પુછી શકે છે.
  - (૪) ગરીબી રેખા હેઠળ જીવતા લોકો પાસેથી કોઈ જ ફી લેવામાં આવશે નહીં.
  - (૫) સરકારી માહિતી અધિકારી નિયત કરેલી સમય મર્યાદાનું પાલન ન કરી શકે તો અરજદારને માહિતી વિના મૂલ્યે પુરી પાડવી.

## નિયમ સંગ્રહ - ૧ સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

૨.૧	જાહેર તંત્રનો ઉદેશ - હેતુ:- વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ પુડુ પાડવું તેમજ તબીબી સંશોધન કાર્ય કરવું
૨.૨	જાહેર તંત્રનું મિશન/દુરંદેશીપણું :- (વિન) તબીબી, નર્સિંગ, લેબ-ટેકનીશયન ના વિદ્યાર્થીઓને સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટેની સુવિધા પુરી પાડવી તેમજ અભ્યાસ કરાવવો.
૨.૩	જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ:-  ગુજરાત સરકારશીનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર હસ્તકની આ સંસ્થા છે. જેનું નામાકરણ “સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર” તરીકે કરવામાં આવે છે. આ કોલેજની સ્થાપના સને ૧૯૯૫ ના વર્ષમાં થયેલ છે. આ સંસ્થા શરૂઆતમાં સર ટી. હોસ્પિટલ કેમ્પસ ભાવનગર ખાતે શરૂ કરવામાં આવેલ ત્યારબાદ નવી બિલ્ડિંગનું બાંધકામ પુરું થતાં આ સંસ્થા સને ૨૦૦૦ ની સાલથી મેડિકલ કોલેજના નવા બીલ્ડિંગમાં કાર્યરત છે. આ સંસ્થા ખાતે ૧૫૦ ચુ. જી. ની સીટો, ૧૦૮ પી. જી. ની સીટો અને ૧૫૦ ડી.એમ.એલ.ટી. અભ્યાસક્રમની સીટો છે. <u>૧૫૦ ડી.એમ.એલ.ટી. અભ્યાસક્રમની સીટો નીચે પ્રમાણે ભરવામાં આવે છે.</u> લેબોરેટરી ટેકનીશયન                          એક્સરે ટેકનીશયન                          કુલ ડી.એમ.એલ.ટી. ની સીટો કુલ ૧૧૦ સીટો                                  કુલ ૫૦ સીટો                                  કુલ ૧૫૦ સીટો ૫૫ સીટો ખાતા મારફત                          ૨૫ સીટો ખાતા મારફત ૫૫ સીટો સીધે સીધી                                  ૨૫ સીટો સીધે સીધી
૨.૪	જાહેર તંત્રની ફરજો આ સંસ્થાની ફરજોમાં મુખ્યત્વે પ્રાધ્યાપકો તરફથી તબીબી વિદ્યાર્થીઓને શિક્ષણ તથા હોસ્પિટલનાં દર્દીઓને સારવાર આપવી તથા તબીબી શિક્ષણ અને સંશોધન કરવાનું કાર્ય છે.
૨.૫	જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ - કાર્યો તબીબી, નર્સિંગ, લેબ-ટેકનીશયન ના વિદ્યાર્થીઓને સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમ માટેની સુવિધા પુરી પાડવી તેમજ અભ્યાસ કરાવવો. તથા વિદ્યાર્થીઓના વિકાસ માટે કોન્ફરન્સ, પરિસંવાદો, વર્કશોપ યોજવા.
૨.૬	જાહેરતંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ  આ સંસ્થા ૧. એનાટોમી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન સ્વીકારવામાં આવે છે. ૨. સંસ્થાના શૈક્ષણિક સ્ટાફ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ શૈક્ષણિક કાર્ય કરે છે. ૩. સંસ્થાના કલિનિકલ વિભાગના ડોક્ટરો હોસ્પિટલમાં તબીબી સેવાઓ આપે છે. ૪. સંસ્થાના પેથોલોજી, માઇકોબાયોલોજી અને બાયોકેમીસ્ટ્રી વિભાગ લેબોરેટરી નિદાન પ્રક્રિયામાં સહભાગી થાય છે. ૫. સંસ્થાનું ફોરેન્સિક મેડિસીન વિભાગ મેડિકોલીગિલ, પોસ્ટમોર્ટમમાં તજજ સેવા પુરી પાડે છે. તથા કોઈમાં વિટનેસ તરીકે સેવાઓ આપી કાઇમ ઇન્વેસ્ટિગેશન્સમાં મદદરૂપ થાય છે. ૬. સંસ્થાનો પ્રિવેન્ટીવ અને સોશયલ મેડિસીન વિભાગ જનરલ મેડિસીન તથા માઇકોબાયોલોજી વિભાગના સહયોગથી એપીડોમીક સમયે સેવાઓ આપે છે. ૭. સંસ્થાના ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ વી.આઇ.પી. ડયુટી, મેડિકલ કેમ્પ, સ્કુલ હેલ્થ જીવાં પ્રોગ્રામમાં સહભાગી થાય છે. ૮. સંસ્થાના પી.એસ.એમ. તથા કલિનિકલ વિભાગના તજજો રાષ્ટ્રીય આરોગ્ય પ્રોગ્રામ માં નિષ્ણાંત

	<p>તરીકે સેવા બજાવે છે, તેમજ તાલીમ પુરી પાડે છે.</p> <p>૬. સંસ્થાના તજજો અન્ય યુનિવર્સિટીમાં પરીક્ષક તરીકે, એમ.સી.આઇ. ના એસેસર તરીકે, ક્વોલીટી પોગ્રામના એસેસર તરીકે તથા રાજ્ય દ્વારા ખરીદાતાં મેડિકલના સાધનોમાં તજજા તરીકે તથા રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના પરિસંવદોમાં ફેકલ્ટી તરીકે સેવાઓ બજાવે છે.</p> <p>૧૦. સંસ્થાનો ફાર્મેકોલોજી વિભાગ રેશનલ પ્રિસ્કીપ્શાન, એન્ટીબાયોટીક પોલીસી તથા ફાર્મેકોવીજીલન્સ જેવી સેવાઓ આપે છે.</p>
૨.૭	જાહેર તંત્રના રાજ્ય નિયામક કચેરી, પ્રદેશ, જીલ્લો, બ્લોક વગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ (જ્યાં લાગુ પડતો હોય ત્યા)
	આ સંસ્થા સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કમિશનર શ્રી, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધન, ના માર્ગદર્શન હેઠળ અધિક નિયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન ની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરે છે.
૨.૮	જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વાપરવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ
	<p>૧. સંસ્થાની કાર્યવાહીમાં સફાઈ તથા શિસ્ત રાખી તેમજ સંસ્થાના પરિસરમાં તમાકુ કે નિષિદ્ધ પીણાઓ નો ઉપયોગ ન કરે તે હિતાવહ છે.</p> <p>૨. આરોગ્ય સેવાઓ ના ઉપયોગ સમયે ઇમરજન્સીમાં આવેલા દર્દીઓને પ્રાધાન્ય આપે.</p> <p>૩. સંસ્થાની મિલકત ને નુકસાન ન થાય તે કાળજી લે.</p> <p>૪. પોતાના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરી એમ્બ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાતાં વાહનો માટે માર્ગ ખુલ્લો રાખે.</p> <p>૫. હોસ્પિટલની સેવાઓના ઉપયોગ વખતે તેમની અગાઉની માંદગી કે સારવારના તમામ કાગળો તથા હકીકતથી ડોક્ટરને વાકેફ કરે.</p>
૨.૯	લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિઓ
	લોકો પાસે રાખવામાં આવતી અપેક્ષાઓ ને નિર્દેખિત કરતાં ડીસ્પ્લે બોર્ડ ગોઠવવામાં આવેલ છે.
૨.૧૦	સેવા આપવાના, દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદો નિવારવા માટે ઉપલબ્ધ તંત્ર
	સંસ્થાના કાર્ય સંદર્ભે ફરિયાદોના નિવારણ માટે કોઇપણ વ્યક્તિ જે - તે વિભાગ/યુનિટ ના વડાનો સીધો સંપર્ક કરી શકે છે. તેમ છતાં નિવારણ ન આવે તો સંસ્થાના વડાનો સંપર્ક કરી શકે છે. સંસ્થાના વડાની તેમજ વિવિધ વિભાગના વડાની ઓફીસમાં સજેશન/ફરિયાદ બોક્સ ઉપલબ્ધ છે.
૨.૧૧	મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓનાં સરનામા (વપરાશ કારને સમજવામાં સરળ પડે તે માટે જીલ્લાવાર વગ્નિકરણો કરો)
	ડીનશ્રીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ, જેલ રોડ, એસ. ટી. સ્ટેન્ડ પાસે, ભાવનગર. અધિક નિયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન, જી - બ્લોક, બીજો માળ, ગાંધીનગર. કમિશનર શ્રી, આરોગ્ય તબીબી શિક્ષણ અને સંશોધન, ગાંધીનગર. સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર.
૨.૧૨	કચેરી શરૂ થવાનો સમય :-
	વહીવટી સંવર્ગ (બિન શૈક્ષણિક) :- સવારના ૧૦:૩૦ કલાકે
	શૈક્ષણિક સંવર્ગ :- સવારના ૮:૦૦ કલાકે
૨.૧૩	કચેરી બંધ થવાનો સમય
	વહીવટી સંવર્ગ (બિન શૈક્ષણિક) :- સાંજના ૫:૧૦ કલાકે (રીસેષ ટાઇમ:- ૨:૦૦ થી ૨:૩૦)
	શૈક્ષણિક સંવર્ગ :- સાંજના ૫:૦૦ કલાકે (રીસેષ ટાઇમ:- ૧:૦૦ થી ૨:૦૦)

(નિયમ સંગ્રહ- ૨)

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

તબીબી શિક્ષણ વિભાગનાં સંસ્થાગત માળખાનો આલેખ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય  
માનનીય મંત્રીશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,  
સચિવાલય ગાંધીનગર



આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર  
સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,  
બ્લોક નંબર- ૭, ગાંધીનગર



કમિશનર શ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ. વિ.) ની કચેરી  
બ્લોક નંબર- ૫, ડૉ. જીવરાજ મહેતા ભવન જુના સચિવાલય, ગાંધીનગર



અધિક નિયામકશ્રી, (તબીબી શિક્ષણ )

કમિશનર શ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (ત. શિ.) ની કચેરી,  
બ્લોક નંબર- ૪, ડૉ. જીવરાજ મહેતા ભવન જુના સચિવાલય, ગાંધીનગર



ડીનશ્રી (એસ. ટી. સ્ટેન્ડની બાજુમાં, જેલ રોડ  
સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર)




અધિક ડીન



વહીવટી અધિકારી	દરેક વિભાગના વડા	હિસાબી અધિકારી
કચેરી અધિક્ષક (તમામ શાખા)	સહપ્રાધ્યાપક	કચેરી અધિક્ષક (તમામ શાખા)
હેડ કલાર્ક (તમામ શાખા)	મદદનીશ પ્રાધ્યાપક	હેડ કલાર્ક (તમામ શાખા)
સી. કલાર્ક /જી. કલાર્ક (તમામ શાખા)	ટેકન્નિશન	સી. કલાર્ક /જી. કલાર્ક (તમામ શાખા)
વર્ગ - ૪	કલાર્ક	વર્ગ - ૪
	વર્ગ - ૪	

- ૨.૧ તબીબી શિક્ષણ વિભાગ હેઠળની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ તબીબી કોલેજની કાર્યક્રમતામાં વધારો થાય તે બાબતે વિધાર્થીઓ કોલેજની સાફ સફાઈ રહે તે માટે સહકાર આપે, ગમે ત્યાં ગંદકી ન કરે, સ્વૈચ્છીક રીતે વ્યસન મુક્તિ અભિયાનમાં સહકાર આપે, તેમજ સરકારશ્રી/ આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં મુક્લે આરોગ્ય વિષયક કાર્યક્રમમાં જોડાય તો આરોગ્ય વિષયક સેવાઓ આપના સહકારથી અસરકારક બનાવી શકાય.
- ૨.૨ તબીબી કોલેજ, ભાવનગાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક પ્રશ્નોના નિવારણ તેમજ લોક જાગૃતિ અંગે વિવિધ કેમ્પો, તબીબી સારવાર સુવિધા જાગૃતિ અભિયાન, પ્રદર્શનો, સરધસ, તબીબી કોલેજો દ્વારા વ્યસનમુક્તિ સેમીનાર, સંવાદ જેવા કાર્યક્રમોનું આયોજન જે તે તબીબી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે તેમજ તે માટે તેઓને આ કચેરી તેમજ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે.
- ૨.૩ તબીબી કોલેજની કચેરી ખાતે સેવા આપવા તેમજ દેખરેખ નિયંત્રણ અને કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે દરેક શાખાના અધિકારીઓનો સંપર્ક કરી જે તે વ્યક્તિ અથવા કોઈ કર્મચારી પોતાની ફરિયાદનું નિવારણ પ્રાપ્ત કરી શકે છે અને ઉપરોક્ત તમામ વહીવટી અધિકારી ઉપર ડીનશ્રી અને અધિક ડીનશ્રી, તબીબી શિક્ષણનું નિયંત્રણ હોય છે.
- ૨.૪ મુખ્ય કચેરીના તાબા હેઠળ ભાવનગાર મેડિકલ કોલેજ ભાવનગારની કચેરી આવેલી છે.  
સરકારી મેડિકલ કોલેજ, એસ. ટી. સ્ટેન્ડની પાસે, ભાવનગાર. ડીનશ્રી, (૦૨૭૮) ૨૪૩૦૮૦૮
- ૨.૫ તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરીનું વહીવટી વ્યવસ્થા તંત્ર



અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

ક્રમ	હોક્કો	અધિકારી/કર્મચારીઓના નામ સત્તાઓ અને ફરજો								
૧	ડીનશ્રી	<p align="center"><b>શ્રી ડૉ. એચ. બી. મહેતા (ઇન્યાર્જ)</b></p>								
		<table border="1"> <tr> <td>સત્તાઓ</td><td>સ્થાનિક કક્ષાએ સરકારશ્રીના નિયમોનુસાર મર્યાદા અને આધિન કચેરીના વડા તરીકે ની વહીવટી તથા નાણાંકીય સત્તાઓ.</td></tr> <tr> <td>વહીવટી</td><td>વર્ગ- ૩ અને વર્ગ- ૪ ની ફરજ ફાળવવી. વર્ગ- ૧, ૨ ના ખાનગી અહેવાલ, બદલી, બઢતીની દરખાસ્તો, એલ. ટી. સી. ની રજાઓ મંજુર કરવી (૫૪૦ દિવસ સુધીની), ઇન્કીમેન્ટ, પેન્શન, ફરિયાદ/કોર્ટ કેસ/ આર. ટી. આઇ. કેસોની અપીલની કામગીરી,</td></tr> <tr> <td>નાણાંકીય</td><td>નાણાં વિભાગના તા:- ૬/૬/૮૮ ના ઠરાવથી નિયત થયેલી કચેરીના વડા તરીકેની સત્તાઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં તા:- ૧૦/૦૮/૨૦૦૪ ના ઠરાવથી આપવામાં આવેલ ખરીદીને લગતી સત્તાઓ.</td></tr> <tr> <td>ફરજો</td><td> <ol style="list-style-type: none"> <li>તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગનું નિયંત્રણ, તમામ શાખાઓની વહીવટી કામગીરીની દેખરેખ, ખાતાના વડાને રજુ કરવાની ફાઈલો, નિર્ણય, અમલ,</li> <li>સરકારશ્રીને રજુ કરવાની ફાઈલો, નિર્ણય, અમલ,</li> <li>મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો વહીવટ અને નિયંત્રણ. મેડિકલ કોલેજમાં આવતા તમામ વિભાગોનું નિયંત્રણ, વિધાથીઓને ઉચ્ચ કોટીનું તબીબી શિક્ષણ મળે તેની કાળજી રાખવી, વહીવટી કામગીરીની દેખરેખ રાખવી,</li> <li>વિભાગીય વડાની રજુઆતોને ધ્યાને લઈને નિર્ણય તથા અમલ કરવો અને તબીબી શૈક્ષણિક કાર્ય યોગ્ય મળે તેવા પ્રયત્ન કરવા.</li> </ol> </td></tr> </table>	સત્તાઓ	સ્થાનિક કક્ષાએ સરકારશ્રીના નિયમોનુસાર મર્યાદા અને આધિન કચેરીના વડા તરીકે ની વહીવટી તથા નાણાંકીય સત્તાઓ.	વહીવટી	વર્ગ- ૩ અને વર્ગ- ૪ ની ફરજ ફાળવવી. વર્ગ- ૧, ૨ ના ખાનગી અહેવાલ, બદલી, બઢતીની દરખાસ્તો, એલ. ટી. સી. ની રજાઓ મંજુર કરવી (૫૪૦ દિવસ સુધીની), ઇન્કીમેન્ટ, પેન્શન, ફરિયાદ/કોર્ટ કેસ/ આર. ટી. આઇ. કેસોની અપીલની કામગીરી,	નાણાંકીય	નાણાં વિભાગના તા:- ૬/૬/૮૮ ના ઠરાવથી નિયત થયેલી કચેરીના વડા તરીકેની સત્તાઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં તા:- ૧૦/૦૮/૨૦૦૪ ના ઠરાવથી આપવામાં આવેલ ખરીદીને લગતી સત્તાઓ.	ફરજો	<ol style="list-style-type: none"> <li>તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગનું નિયંત્રણ, તમામ શાખાઓની વહીવટી કામગીરીની દેખરેખ, ખાતાના વડાને રજુ કરવાની ફાઈલો, નિર્ણય, અમલ,</li> <li>સરકારશ્રીને રજુ કરવાની ફાઈલો, નિર્ણય, અમલ,</li> <li>મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો વહીવટ અને નિયંત્રણ. મેડિકલ કોલેજમાં આવતા તમામ વિભાગોનું નિયંત્રણ, વિધાથીઓને ઉચ્ચ કોટીનું તબીબી શિક્ષણ મળે તેની કાળજી રાખવી, વહીવટી કામગીરીની દેખરેખ રાખવી,</li> <li>વિભાગીય વડાની રજુઆતોને ધ્યાને લઈને નિર્ણય તથા અમલ કરવો અને તબીબી શૈક્ષણિક કાર્ય યોગ્ય મળે તેવા પ્રયત્ન કરવા.</li> </ol>
સત્તાઓ	સ્થાનિક કક્ષાએ સરકારશ્રીના નિયમોનુસાર મર્યાદા અને આધિન કચેરીના વડા તરીકે ની વહીવટી તથા નાણાંકીય સત્તાઓ.									
વહીવટી	વર્ગ- ૩ અને વર્ગ- ૪ ની ફરજ ફાળવવી. વર્ગ- ૧, ૨ ના ખાનગી અહેવાલ, બદલી, બઢતીની દરખાસ્તો, એલ. ટી. સી. ની રજાઓ મંજુર કરવી (૫૪૦ દિવસ સુધીની), ઇન્કીમેન્ટ, પેન્શન, ફરિયાદ/કોર્ટ કેસ/ આર. ટી. આઇ. કેસોની અપીલની કામગીરી,									
નાણાંકીય	નાણાં વિભાગના તા:- ૬/૬/૮૮ ના ઠરાવથી નિયત થયેલી કચેરીના વડા તરીકેની સત્તાઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં તા:- ૧૦/૦૮/૨૦૦૪ ના ઠરાવથી આપવામાં આવેલ ખરીદીને લગતી સત્તાઓ.									
ફરજો	<ol style="list-style-type: none"> <li>તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગનું નિયંત્રણ, તમામ શાખાઓની વહીવટી કામગીરીની દેખરેખ, ખાતાના વડાને રજુ કરવાની ફાઈલો, નિર્ણય, અમલ,</li> <li>સરકારશ્રીને રજુ કરવાની ફાઈલો, નિર્ણય, અમલ,</li> <li>મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો વહીવટ અને નિયંત્રણ. મેડિકલ કોલેજમાં આવતા તમામ વિભાગોનું નિયંત્રણ, વિધાથીઓને ઉચ્ચ કોટીનું તબીબી શિક્ષણ મળે તેની કાળજી રાખવી, વહીવટી કામગીરીની દેખરેખ રાખવી,</li> <li>વિભાગીય વડાની રજુઆતોને ધ્યાને લઈને નિર્ણય તથા અમલ કરવો અને તબીબી શૈક્ષણિક કાર્ય યોગ્ય મળે તેવા પ્રયત્ન કરવા.</li> </ol>									
૨	અધિક ડીન	<b>શ્રી ડૉ. એચ. બી. મહેતા</b>								
		<table border="1"> <tr> <td>સત્તાઓ</td><td>અધિક ડીન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ</td></tr> <tr> <td>વહીવટી</td><td>ડીનશ્રી અને અધિક નિયામકશ્રી તરફથી એનાયત થયેલ સત્તાઓ.</td></tr> <tr> <td>નાણાંકીય</td><td>-</td></tr> <tr> <td>ફરજો</td><td>માન. કમિશનર શ્રી તરફથી સોંપાયેલ ફરજો, કચેરીના નિયંત્રણમાં અને ડીનશ્રીની ફરજોમાં મદદ</td></tr> </table>	સત્તાઓ	અધિક ડીન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ	વહીવટી	ડીનશ્રી અને અધિક નિયામકશ્રી તરફથી એનાયત થયેલ સત્તાઓ.	નાણાંકીય	-	ફરજો	માન. કમિશનર શ્રી તરફથી સોંપાયેલ ફરજો, કચેરીના નિયંત્રણમાં અને ડીનશ્રીની ફરજોમાં મદદ
સત્તાઓ	અધિક ડીન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ									
વહીવટી	ડીનશ્રી અને અધિક નિયામકશ્રી તરફથી એનાયત થયેલ સત્તાઓ.									
નાણાંકીય	-									
ફરજો	માન. કમિશનર શ્રી તરફથી સોંપાયેલ ફરજો, કચેરીના નિયંત્રણમાં અને ડીનશ્રીની ફરજોમાં મદદ									
૩	ચીફ વોર્ડન	<b>શ્રી ડૉ. નીલેષ વી. પારેખ (Hod- Prof. Ophthalmology)</b>								
		<table border="1"> <tr> <td>સત્તાઓ</td><td>ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ</td></tr> <tr> <td>વહીવટી</td><td>ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી</td></tr> <tr> <td>નાણાંકીય</td><td>-</td></tr> <tr> <td>ફરજો</td><td> <ol style="list-style-type: none"> <li>વોર્ડન દ્વારા રજુ કરવામાં આવતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</li> <li>રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</li> </ol> </td></tr> </table>	સત્તાઓ	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ	વહીવટી	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી	નાણાંકીય	-	ફરજો	<ol style="list-style-type: none"> <li>વોર્ડન દ્વારા રજુ કરવામાં આવતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</li> <li>રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</li> </ol>
સત્તાઓ	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ									
વહીવટી	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી									
નાણાંકીય	-									
ફરજો	<ol style="list-style-type: none"> <li>વોર્ડન દ્વારા રજુ કરવામાં આવતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</li> <li>રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</li> </ol>									

		<p>3. પી.આઇ.યુ. દ્વારા કરવામાં આવેલ કામગીરી સંતોષકારક છે કે નહિ તેની ખાત્રી કરવી. તથા કામગીરી સંતોષકારક ન જણાય તો તેની જાણ ડીનશ્રીને કરવી. તથા યોગ્ય કાર્યવાહી કરવા માટે પગલાં લેવાં.</p> <p>4. જટીલ સમસ્યાઓ તરફ ડીનશ્રીનું ધ્યાન દોરવું. અને તેના ઉકેલ માટે ડીનશ્રી સાથે પરામર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવવો.</p> <p>5. વોર્ડન તથા હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટને વહીવટી કામગીરી માં સલાહ સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p> <p>6. ડીનશ્રી, અધિક ડીનશ્રી દ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી કરવી.</p>								
૪	વોર્ડન - બોયાજ	<b>શ્રી ડૉ. અમિત પરમાર (Hod- Prof. Forensic Medicine)</b>								
		<table border="1"> <tr> <td>સત્તાઓ</td><td>વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ</td></tr> <tr> <td>વહીવટી</td><td>વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી</td></tr> <tr> <td>નાણાંકીય</td><td>-</td></tr> <tr> <td>ફરજો</td><td> <p>૧. હોસ્પિટ સુપ્રિ. દ્વારા રજુ થતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</p> <p>૨. રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</p> <p>૩. પી.આઇ.યુ. દ્વારા કરવામાં આવેલ કામગીરી સંતોષકારક છે કે નહિ તેની ખાત્રી કરવી. તથા કામગીરી સંતોષકારક ન જણાય તો તેની જાણ ચીફ વોર્ડન મારફત ડીનશ્રીને કરવી. તથા યોગ્ય કાર્યવાહી કરવા માટે પગલાં લેવાંની કામગીરી કરવી</p> <p>૪. જટીલ સમસ્યાઓ તરફ ચીફ વોર્ડનનું તથા ડીનશ્રીનું ધ્યાન દોરવું. અને તેના ઉકેલ માટે ચીફ વોર્ડન તથા ડીનશ્રી સાથે પરામર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવવો.</p> <p>૫. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ તથા સ્ટાફને વહીવટી કામગીરી માં સલાહ સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p> <p>૬. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિભાવવામાં આવતાં હોસ્પિટના નિયત રજુસ્ટરો /પત્રકોની ચકાસણી કરવી.</p> <p>૭. એન્ટી રેગિંગ કમીટીનું અપડેશન રાખવું તથા તમામ હોસ્પિટમાં તેના નિયત બોર્ડ લગાવેલા છે કે નહિ તેની ખાત્રી રાખવી, તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનો મુજબના નિયત પ્રકારના બોર્ડ દરેક હોસ્પિટમાં રાખવામાં આવે છે કે નહિ તેની ખાત્રી રાખવી.</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી તથા ચીફ વોર્ડન દ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી કરવી.</p> </td></tr> </table>	સત્તાઓ	વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ	વહીવટી	વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી	નાણાંકીય	-	ફરજો	<p>૧. હોસ્પિટ સુપ્રિ. દ્વારા રજુ થતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</p> <p>૨. રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</p> <p>૩. પી.આઇ.યુ. દ્વારા કરવામાં આવેલ કામગીરી સંતોષકારક છે કે નહિ તેની ખાત્રી કરવી. તથા કામગીરી સંતોષકારક ન જણાય તો તેની જાણ ચીફ વોર્ડન મારફત ડીનશ્રીને કરવી. તથા યોગ્ય કાર્યવાહી કરવા માટે પગલાં લેવાંની કામગીરી કરવી</p> <p>૪. જટીલ સમસ્યાઓ તરફ ચીફ વોર્ડનનું તથા ડીનશ્રીનું ધ્યાન દોરવું. અને તેના ઉકેલ માટે ચીફ વોર્ડન તથા ડીનશ્રી સાથે પરામર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવવો.</p> <p>૫. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ તથા સ્ટાફને વહીવટી કામગીરી માં સલાહ સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p> <p>૬. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિભાવવામાં આવતાં હોસ્પિટના નિયત રજુસ્ટરો /પત્રકોની ચકાસણી કરવી.</p> <p>૭. એન્ટી રેગિંગ કમીટીનું અપડેશન રાખવું તથા તમામ હોસ્પિટમાં તેના નિયત બોર્ડ લગાવેલા છે કે નહિ તેની ખાત્રી રાખવી, તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનો મુજબના નિયત પ્રકારના બોર્ડ દરેક હોસ્પિટમાં રાખવામાં આવે છે કે નહિ તેની ખાત્રી રાખવી.</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી તથા ચીફ વોર્ડન દ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી કરવી.</p>
સત્તાઓ	વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ									
વહીવટી	વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી									
નાણાંકીય	-									
ફરજો	<p>૧. હોસ્પિટ સુપ્રિ. દ્વારા રજુ થતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</p> <p>૨. રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</p> <p>૩. પી.આઇ.યુ. દ્વારા કરવામાં આવેલ કામગીરી સંતોષકારક છે કે નહિ તેની ખાત્રી કરવી. તથા કામગીરી સંતોષકારક ન જણાય તો તેની જાણ ચીફ વોર્ડન મારફત ડીનશ્રીને કરવી. તથા યોગ્ય કાર્યવાહી કરવા માટે પગલાં લેવાંની કામગીરી કરવી</p> <p>૪. જટીલ સમસ્યાઓ તરફ ચીફ વોર્ડનનું તથા ડીનશ્રીનું ધ્યાન દોરવું. અને તેના ઉકેલ માટે ચીફ વોર્ડન તથા ડીનશ્રી સાથે પરામર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવવો.</p> <p>૫. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ તથા સ્ટાફને વહીવટી કામગીરી માં સલાહ સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p> <p>૬. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિભાવવામાં આવતાં હોસ્પિટના નિયત રજુસ્ટરો /પત્રકોની ચકાસણી કરવી.</p> <p>૭. એન્ટી રેગિંગ કમીટીનું અપડેશન રાખવું તથા તમામ હોસ્પિટમાં તેના નિયત બોર્ડ લગાવેલા છે કે નહિ તેની ખાત્રી રાખવી, તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનો મુજબના નિયત પ્રકારના બોર્ડ દરેક હોસ્પિટમાં રાખવામાં આવે છે કે નહિ તેની ખાત્રી રાખવી.</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી તથા ચીફ વોર્ડન દ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી કરવી.</p>									
૫	ચીફ વોર્ડન-ગલ્સ	<b>શ્રી ડૉ. મંજુલા જામલીયા (Asst. Prof. Physiology)</b>								
		<table border="1"> <tr> <td>સત્તાઓ</td><td>ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ</td></tr> <tr> <td>વહીવટી</td><td>ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી</td></tr> <tr> <td>નાણાંકીય</td><td>-</td></tr> </table>	સત્તાઓ	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ	વહીવટી	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી	નાણાંકીય	-		
સત્તાઓ	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ									
વહીવટી	ચીફ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી									
નાણાંકીય	-									

		ક્રમો	<p>૧. હોસ્પિટ સુપ્રિ. તથા મદદનીશ વોર્ડન દ્વારા રજુ થતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</p> <p>૨. રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</p> <p>૩. પી.આઇ.યુ. દ્વારા કરવામાં આવેલ કામગીરી સંતોષકારક છે કે નહિ તેની આસીસ્ટન્ટ વોર્ડન પાસે ખાત્રી કરાવવી. તથા કામગીરી સંતોષકારક ન જણાય તો તેની જાણ ડીનશ્રીને કરવા માટે આસીસ્ટન્ટ વોર્ડનને સુચન કરવું. તથા યોગ્ય કાર્યવાહી કરવા માટે પગલાં લેવાં આસીસ્ટન્ટ વોર્ડનને સુચન કરવું</p> <p>૪. જટીલ સમસ્યાઓ તરફ કાળજી રાખવા આસીસ્ટન્ટ વોર્ડનને તાકીદ કરવા તથા તે સમસ્યાઓ બાબતે ડીનશ્રીનું ધ્યાન દોરવું. અને તેના ઉકેલ માટે આસીસ્ટન્ટ વોર્ડન ને સલાહ/માર્ગદર્શન આપવા.</p> <p>૫. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ તથા સ્ટાફને વહીવટી કામગીરી માં સલાહ સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p> <p>૬. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિભાવવામાં આવતાં હોસ્પિટના નિયત રજુસ્ટરો /પત્રકોની ચકાસણી કરવી.</p> <p>૭. એન્ટી રેગીંગ કમીટીનું અપડેશન રાખવું તથા તમામ હોસ્પિટમાં તેના નિયત બોર્ડ લગાવેલા છે કે નહિ તેની ખાત્રી રાખવી, તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનો મુજબના નિયત પ્રકારના બોર્ડ દરેક હોસ્પિટમાં રાખવામાં આવે છે કે નહિ તેની ખાત્રી રાખવી.</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી વોર્ડન દ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી કરવી.</p>
૬	મદદનીશ વોર્ડન-ગાર્ટ્સ	શ્રી ડૉ. ભારતી કોરીયા (Asst. Prof. P.S.M.) /	
		સત્તાઓ	આસીસ્ટન્ટ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ તમામ સત્તાઓ
		વહીવટી	આસીસ્ટન્ટ વોર્ડન તરીકેની સોંપવામાં આવેલ કામગીરી
		નાણાંકીય	-
		ક્રમો	<p>૧. હોસ્પિટ સુપ્રિ. દ્વારા રજુ થતી વિદ્યાર્થીઓની હોસ્પિટને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવું</p> <p>૨. રીપેરીંગ કરાવવા જેવા કામો માટે ના. કાર્યપાલક ઇજનેરશ્રી પી.આઇ.યુ.ને કામગીરી કરવા જાણ કરવી.</p> <p>૩. પી.આઇ.યુ. દ્વારા કરવામાં આવેલ કામગીરી સંતોષકારક છે કે નહિ તેની ખાત્રી કરવી. તથા કામગીરી સંતોષકારક ન જણાય તો તેની જાણ ચીફ વોર્ડ દરેક ડીનશ્રીને કરવી. તથા યોગ્ય કાર્યવાહી કરવા માટે પગલાં લેવાંની કામગીરી કરવી</p> <p>૪. જટીલ સમસ્યાઓ તરફ ચીફ વોર્ડનનું તથા ડીનશ્રીનું ધ્યાન દોરવું. અને તેના ઉકેલ માટે ચીફ વોર્ડ ને તથા ડીનશ્રી સાથે પરામર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવવો.</p> <p>૫. હોસ્પિટ સુપ્રિન્ટેન્ડન્ટ તથા સ્ટાફને વહીવટી કામગીરી માં સલાહ સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p>

		<p>સુચનો/માર્ગદર્શન પુરા પાડવા</p> <p>૬. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિભાવવામાં આવતાં હોસ્પિટલના નિયત રજીસ્ટરો / પત્રકોની ચકાસણી કરવી.</p> <p>૭. એન્ટી રેગીંગ કમીટીનું અપડેશન રાખવું તથા તમામ હોસ્પિટલમાં તેના નિયત બોર્ડ લગાવેલા છે કે નહિ તેની ખાત્રી રાખવી, તથા સરકારશી દ્વારા આપવામાં આવેલ સુચનો મુજબના નિયત પ્રકારના બોર્ડ દરેક હોસ્પિટલમાં રાખવામાં આવે છે કે નહિ તેની ખાત્રી રાખવી.</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી તથા ચીફ વોર્કન દ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી કરવી.</p>	
૭	વહીવટી અધિકારી	શ્રી જે. બી. કલીવડા (ઇન્યાર્જ)	
		<p>વહીવટી સત્તાઓ</p> <p>ફરજો</p>	<p>એસ્ટાબ્લીશમેન્ટ તથા કચેરીને લગતાં કામકાજનું સુપરવિઝન કરવું, કર્મચારીઓને સુચનો કરવા કામગીરીની વહેચણી કરવી, સબોડીનેટ સ્ટાફની આક્સિમિક રજા મંજુર કરવાની સત્તા. અન્ય રજાઓ ડીનશ્રીને ભલામણ કરવાની સત્તા.</p> <p>૧. આર. ટી. આઈ/ કોર્ટકેસ સેલ તથા ફરજિયાદ શાખા/ વર્ગ- ૧, ૨, ૩, ૪ મહેકમ શાખા, વિદ્યાર્થી શાખા, સ્ટોર શાખા ને લગતી વહીવટી કામગીરી.</p> <p>૨. કોર્ટકેસોની મુદ્તમાં હાજરી આપવી, તથા આર. ટી.આઈ. ને લગતાં કેસોમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો બજાવવી.</p>
૮	હિસાબી અધિકારી	શ્રી જે. ડી. ગોહેલ - (ઇન્યાર્જ)	
		<p>વહીવટી</p> <p>નાણાંકીય</p> <p>ફરજો</p>	<p>૧. તમામ નાણાંકીય હિસાબો અને ઓડીટ તથા સંસ્થાના તમામ બીલો અને કન્દીજન્સી ખર્ચ તથા અન્ય હિસાબો,</p> <p>૨. તમામ ઉપાડ અને વહેચણી કરનાર અધિકારીની જવાબદારી તથા સબોડીનેટ કર્મચારીઓને સુચનો કરવા હિસાબી શાખાને લગતી કામગીરીની વહેચણી કરવી</p> <p>૩. પોતાની કચેરીને લગતાં કામકાજનું સુપરવિઝન કરવું, સબોડીનેટ સ્ટાફની આક્સિમિક રજા મંજુર કરવાની સત્તા. અન્ય રજાઓ ડીનશ્રીને ભલામણ કરવાની સત્તા.</p> <p>૪. બજેટ તૈયાર કરાવવું, પગાર બીલો, ખરીદીના બીલો તૈયાર કરાવવા. બજેટની ગ્રાન્ટ અનુસાર તથા નિયત હેડ મુજબ જ ખર્ચ મંજુર કરવા.</p> <p>૫. ઇન્કમટેક્ષન લગતી જોગવાઇઓની અમલવારી કરાવવી.</p> <p>નાણાંકીય જવાબદારી છે.</p> <p>હિસાબી શાખાનું સંચાલન તથા સંસ્થાના વડાશ્રીના સુચનો મુજબ કામગીરી કરવી.</p>
૯	પી એ ટુ ડીન	જગ્યા ખાલી	
		વહીવટી સત્તાઓ	

		<table border="1"> <tr> <td>નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.</td></tr> </table>	નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.		
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.					
	ફરજો	<ul style="list-style-type: none"> <li>* વર્ગ - ૧,૨,૩ ના અધિકારી/ કર્મચારીઓના ખાનગી અહેવાલો, ડીનશ્રી દ્વારા આપવામાં આવેલ ડીક્ટેશનના ખાનગી પ્રકરણો તેમજ ડીનશ્રી દ્વારા આપવામાં આવતું ડીક્ટેશન તેમજ ડીનશ્રી દ્વારા વડી કચેરીમાં કે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ટેલીફોનીક વાત કરવાની કામગીરી</li> <li>* ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી સોપે તે કામગીરી કરવી.</li> </ul>				
૧૦	હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ	<b>શ્રી નરેશભાઈ એન. સોલંકી - કચેરી અધિક્ષક (ઇન્યાર્જ)</b>				
	<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td> <td></td> </tr> <tr> <td>નાણાંકીય</td> <td>જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.</td> </tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.	<ul style="list-style-type: none"> <li>(૧) વિધાર્થીઓને હોસ્ટેલમાં રૂમની ફાળવણી કરવી, તેમની હોસ્ટેલને લગતી ફરીયાદોનો નિકાલ કરવો.</li> <li>(૨) વિધાર્થીઓના હોસ્ટેલને લગતા અજુસ્ટરો તૈયાર કરવા.</li> <li>(૩) હોસ્ટેલ માટે એડમીશન ફોર્મ રાખવા</li> <li>(૪) હોસ્ટેલમાં મેસ તથા અન્ય સાધન સામગ્રી માટેની કામગીરી કરવી.</li> <li>(૫) રીપેરીંગ અંગેની કામગીરી તાત્કાલીક કરાવવી</li> <li>(૬) ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી સોપે તે કામગીરી કરવી.</li> </ul>
વહીવટી સત્તાઓ						
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.					
૧૧	સેનેટરી ઇન્સ્પેક્ટર	<b>શ્રી. એચ. એન. મકવાણા</b>				
	<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td> <td></td> </tr> <tr> <td>નાણાંકીય</td> <td>જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.</td> </tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.	<ul style="list-style-type: none"> <li>૧. સમગ્ર મેડિકલ કોલેજમાં સફાઈ, સ્વરચ્છતા અને સેનીટેશનને લગતી કામગીરીનું નિરીક્ષણ કરવું તથા વર્ગ-૪ ના કર્મચારીઓના કામગીરીની વહેચણી કરવી.</li> <li>૨. કોઇ પણ મેડિકલ કોલેજના પ્રોગ્રામો દરમયાન વ્યવસ્થા ગોઠવવાની કામગીરી.</li> <li>૩. તમામ વર્ગ-૪ ના કર્મચારીઓની હાજરી પુરવી તેમજ તેમની કામગીરીનું નિરીક્ષણ કરવું. તથા હોસ્ટેલના વર્ગ-૪ ના કર્મચારીઓ બરાબર સફાઈ કરે છે કે નહીં તેની ચકાસણી કરવી.</li> <li>૪. સમયાંતરે મેડિકલ કોલેજ તેમજ હોસ્ટેલ તેમજ આવાસના પાણીના ટાંકાની સફાઈ કરાવવી.</li> <li>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોપે તે કામગીરી કરવી.</li> </ul>
વહીવટી સત્તાઓ						
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.					

૧૨	કચેરી અધિક્ષક	<b>શ્રી એન. એન. સોલંકી</b> <b>(આર.ટી.આઈ/કોર્ટસેલ શાખા/ફરિયાદ શાખા)</b>						
		<table border="1"> <tr> <td style="text-align: center;">વહીવટી સત્તાઓ</td><td style="text-align: center;">-</td></tr> <tr> <td style="text-align: center;">નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.</td></tr> <tr> <td style="text-align: center;">કર્ઝો</td><td> <p>૧. મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવી.</p> <p>૨. આર.ટી.આઈ. ને લગતા રજુસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતી તૈયાર કરવી.</p> <p>૩. ઇન્ડેન્ટ બનાવવા તથા તેનો હિસાબ રાખવો.</p> <p>૪. આર.ટી.આઈ.ને લગતી કામગીરી કરવી.</p> <p>૫. સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા લેબર કોર્ટને લગતાં કેસોની કામગીરી કરવી. તથા દરેક કેસોની મુદતમાં હાજર રહેવું. તથા કેસોની કા અંગે વખતો વખત વડી કચેરીને માહિતગાર કરવા</p> <p>૬. સંસ્થા ખાતેની તમામ ફરિયાદોની ફાઇલો સંભાળવી તથા સરકારશ્રીને સમયસર માહિતી મોકલવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી વહીવટી અધિકારી સોંપે તે કામગીરી કરવી.</p> <p>૮. માસિક/ત્રિમાસિક પત્રકો સમયસર તૈયાર કરી સરકારશ્રીને માહિતી મોકલવી.</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ	-	નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.	કર્ઝો	<p>૧. મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવી.</p> <p>૨. આર.ટી.આઈ. ને લગતા રજુસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતી તૈયાર કરવી.</p> <p>૩. ઇન્ડેન્ટ બનાવવા તથા તેનો હિસાબ રાખવો.</p> <p>૪. આર.ટી.આઈ.ને લગતી કામગીરી કરવી.</p> <p>૫. સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા લેબર કોર્ટને લગતાં કેસોની કામગીરી કરવી. તથા દરેક કેસોની મુદતમાં હાજર રહેવું. તથા કેસોની કા અંગે વખતો વખત વડી કચેરીને માહિતગાર કરવા</p> <p>૬. સંસ્થા ખાતેની તમામ ફરિયાદોની ફાઇલો સંભાળવી તથા સરકારશ્રીને સમયસર માહિતી મોકલવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી વહીવટી અધિકારી સોંપે તે કામગીરી કરવી.</p> <p>૮. માસિક/ત્રિમાસિક પત્રકો સમયસર તૈયાર કરી સરકારશ્રીને માહિતી મોકલવી.</p>
વહીવટી સત્તાઓ	-							
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.							
કર્ઝો	<p>૧. મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવી.</p> <p>૨. આર.ટી.આઈ. ને લગતા રજુસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતી તૈયાર કરવી.</p> <p>૩. ઇન્ડેન્ટ બનાવવા તથા તેનો હિસાબ રાખવો.</p> <p>૪. આર.ટી.આઈ.ને લગતી કામગીરી કરવી.</p> <p>૫. સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા લેબર કોર્ટને લગતાં કેસોની કામગીરી કરવી. તથા દરેક કેસોની મુદતમાં હાજર રહેવું. તથા કેસોની કા અંગે વખતો વખત વડી કચેરીને માહિતગાર કરવા</p> <p>૬. સંસ્થા ખાતેની તમામ ફરિયાદોની ફાઇલો સંભાળવી તથા સરકારશ્રીને સમયસર માહિતી મોકલવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી વહીવટી અધિકારી સોંપે તે કામગીરી કરવી.</p> <p>૮. માસિક/ત્રિમાસિક પત્રકો સમયસર તૈયાર કરી સરકારશ્રીને માહિતી મોકલવી.</p>							
૧૩	કચેરી અધિક્ષક	<b>શ્રીમતી એન. એ. ભટ (વર્ગ- ૧, ૨ મહેકમ શાખા)</b>						
		<table border="1"> <tr> <td style="text-align: center;">વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td style="text-align: center;">નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.</td></tr> <tr> <td style="text-align: center;">કર્ઝો</td><td> <p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપૂર્ણ કામગીરી.</p> <p><u>(સહ પ્રાધ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</p> <p>૨. નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હીસ્ટી સીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</p> <p>૩. નિમણુંક નિયમિત કરવાની કામગીરી.</p> <p>૪. સેવાઓ સર્વાંગ કરવાની કામગીરી.</p> <p>૫. સહ પ્રાધ્યાપકમાંથી પ્રાધ્યાપકમાં બઢતી બાબતે ડી.પી.સી.ની વધારાની કામગીરી</p> <p>૬. સીનીયોરીટી લીસ્ટ, કામચલાઉની દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીને મોકલવા અંગેની કામગીરી.</p> <p>૭. કામચલાઉ સીનીયોરીટી લીસ્ટના વાંધા સુચનો મળતા ચકાસણી કરી સરકારશ્રીને દરખાસ્તો કરવી.</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.	કર્ઝો	<p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપૂર્ણ કામગીરી.</p> <p><u>(સહ પ્રાધ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</p> <p>૨. નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હીસ્ટી સીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</p> <p>૩. નિમણુંક નિયમિત કરવાની કામગીરી.</p> <p>૪. સેવાઓ સર્વાંગ કરવાની કામગીરી.</p> <p>૫. સહ પ્રાધ્યાપકમાંથી પ્રાધ્યાપકમાં બઢતી બાબતે ડી.પી.સી.ની વધારાની કામગીરી</p> <p>૬. સીનીયોરીટી લીસ્ટ, કામચલાઉની દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીને મોકલવા અંગેની કામગીરી.</p> <p>૭. કામચલાઉ સીનીયોરીટી લીસ્ટના વાંધા સુચનો મળતા ચકાસણી કરી સરકારશ્રીને દરખાસ્તો કરવી.</p>
વહીવટી સત્તાઓ								
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.							
કર્ઝો	<p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપૂર્ણ કામગીરી.</p> <p><u>(સહ પ્રાધ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</p> <p>૨. નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હીસ્ટી સીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</p> <p>૩. નિમણુંક નિયમિત કરવાની કામગીરી.</p> <p>૪. સેવાઓ સર્વાંગ કરવાની કામગીરી.</p> <p>૫. સહ પ્રાધ્યાપકમાંથી પ્રાધ્યાપકમાં બઢતી બાબતે ડી.પી.સી.ની વધારાની કામગીરી</p> <p>૬. સીનીયોરીટી લીસ્ટ, કામચલાઉની દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીને મોકલવા અંગેની કામગીરી.</p> <p>૭. કામચલાઉ સીનીયોરીટી લીસ્ટના વાંધા સુચનો મળતા ચકાસણી કરી સરકારશ્રીને દરખાસ્તો કરવી.</p>							

		<p>૮. કાયમી સીનીયોરીટી લીસ્ટ બહાર પાડતા દરેકને મોકલવા.</p> <p>૯. સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી.</p> <p>૧૦. મીટિંગની માહિતીઓ/હંગામી જગ્યાઓના કન્ટીન્યુએશન ની કામગીરી</p> <p>૧૧. એલ. એ. કયુ. ની માહિતીઓની કામગીરી.</p> <p>૧૨. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>						
૧૪	સીનીયર કલાર્ક	શ્રી એસ. આર. વીરાણી (હિસાબી શાખા)						
		<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.</td></tr> <tr> <td>ફરજો</td><td> <p>૧. પગાર બીલ બનાવવા, સ્ટાઇપેન્ડ બીલ બનાવવા, એરીયર્સ બીલ,</p> <p>૨. એલ.પી.સી બનાવવા, એન.એ.સી., સર્ટીફીકેટ બનાવવા</p> <p>૩. ઓડીટની કામગીરી કરવી</p> <p>૪ હિસાબી શાખાનું સુપરવીઝન</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.	ફરજો	<p>૧. પગાર બીલ બનાવવા, સ્ટાઇપેન્ડ બીલ બનાવવા, એરીયર્સ બીલ,</p> <p>૨. એલ.પી.સી બનાવવા, એન.એ.સી., સર્ટીફીકેટ બનાવવા</p> <p>૩. ઓડીટની કામગીરી કરવી</p> <p>૪ હિસાબી શાખાનું સુપરવીઝન</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
વહીવટી સત્તાઓ								
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.							
ફરજો	<p>૧. પગાર બીલ બનાવવા, સ્ટાઇપેન્ડ બીલ બનાવવા, એરીયર્સ બીલ,</p> <p>૨. એલ.પી.સી બનાવવા, એન.એ.સી., સર્ટીફીકેટ બનાવવા</p> <p>૩. ઓડીટની કામગીરી કરવી</p> <p>૪ હિસાબી શાખાનું સુપરવીઝન</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>							
૧૫	જનીયર કલાર્ક	શ્રી ડી. ડી. પંડ્યા (વર્ગ- ૧, ૨ મહેકમ શાખા)						
		<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td><td>-</td></tr> <tr> <td>નાણાંકીય</td><td>નાણાંકીય જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.</td></tr> <tr> <td>ફરજો</td><td> <p>વર્ગ -૧ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી.</p> <p><u>(પ્રાદ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓના આરોપી-૦૮ હેઠળ પગાર બાંધણીના હુકમો કરવા અંગેની કામગીરી.</p> <p>૨. સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી.</p> <p>૩. અધિકારીઓના વાર્ષિક ઇજાફા અંગેની કામગીરી</p> <p>૪. વર્કશીટ માહિતી.</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ	-	નાણાંકીય	નાણાંકીય જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.	ફરજો	<p>વર્ગ -૧ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી.</p> <p><u>(પ્રાદ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓના આરોપી-૦૮ હેઠળ પગાર બાંધણીના હુકમો કરવા અંગેની કામગીરી.</p> <p>૨. સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી.</p> <p>૩. અધિકારીઓના વાર્ષિક ઇજાફા અંગેની કામગીરી</p> <p>૪. વર્કશીટ માહિતી.</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી</p>
વહીવટી સત્તાઓ	-							
નાણાંકીય	નાણાંકીય જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.							
ફરજો	<p>વર્ગ -૧ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી.</p> <p><u>(પ્રાદ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓના આરોપી-૦૮ હેઠળ પગાર બાંધણીના હુકમો કરવા અંગેની કામગીરી.</p> <p>૨. સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી.</p> <p>૩. અધિકારીઓના વાર્ષિક ઇજાફા અંગેની કામગીરી</p> <p>૪. વર્કશીટ માહિતી.</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી</p>							
૧૬	જનીયર કલાર્ક	શ્રી મહાવીરસિંહ વી. ગોહિલ (વર્ગ- ૧, ૨ મહેકમ શાખા)						
		<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.</td></tr> <tr> <td>ફરજો</td><td> <p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી.</p> <p><u>(મદદનીશ પ્રાદ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</p> <p>૨. નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હિસ્ટીસીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.	ફરજો	<p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી.</p> <p><u>(મદદનીશ પ્રાદ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</p> <p>૨. નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હિસ્ટીસીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</p>
વહીવટી સત્તાઓ								
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.							
ફરજો	<p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી.</p> <p><u>(મદદનીશ પ્રાદ્યાપક સંવર્ગ)</u></p> <p>૧. અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</p> <p>૨. નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હિસ્ટીસીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</p>							

		<p>૩. નિમણુંક નિયમિત કરવાની કામગીરી.</p> <p>૪. સેવાઓ સળંગ કરવાની કામગીરી</p> <p>૫. મદદનીશ પ્રાધ્યાપકમાંથી સહ પ્રાધ્યાપકમાં બઢતી બાબતે ડી.પી.સી.ની વધારાની કામગીરી</p> <p>૬. સીનીયોરીટી લીસ્ટ, કામચલાઉની દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીને મોકલવા અંગેની કામગીરી.</p> <p>૭. કામચલાઉ સીનીયોરીટી લીસ્ટના વાંધા સુચનો મળતા ચકાસણી કરી સરકારશ્રીને દરખાસ્તો કરવી.</p> <p>૮. કાયમી સીનીયોરીટી લીસ્ટ બહાર પાડતા દરેકને મોકલવા.</p> <p>૯. સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી.</p> <p>૧૦. મીટિંગની માહિતીઓ./હંગામી જગ્યાઓના કન્ટીન્યુએશન ની કામગીરી</p> <p>૧૧. એલ. એ. કયુ. ની માહિતીઓની કામગીરી.</p> <p>૧૨. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
--	--	--

૧૭ જુનીયર કલાર્ક શ્રી. એસ. બી. ગોસ્વામી (વિદ્યાર્થી શાખા)

	વહીવટી સત્તાઓ	
	નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.
	ફરજો	<p>૧. પ્રવેશ નિયમો - મેડિકલ/ડેન્ટલ/ફિઝીયોથેરાપી/નર્સિંગ કોલેજો.</p> <p>૨. સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવા.</p> <p>૩. પી.જી./યુ.જી. ની માન્યતા માટે ઇન્સ્પેક્શન અને ઇન્સ્પેક્શન ફી અંગે.</p> <p>૪. પ્રવેશ સીટોમાં વધારો કરવા બાબત.</p> <p>૫. એમ.સી.આઇ. ની જરૂરીયાત મુજબ મેડિકલ કોલેજોમાં સ્ટાફ મંજૂર કરવા બાબત.</p> <p>૬. સ્ટાઇપેન્ડમાં વધારો કરવા બાબત./ યુ.જી./પી.જી. પ્રવેશની ગેરરીતી રજુઆત અંગે.</p> <p>૭. ટયુશન ફી/હોસ્પેટલ ફી બાબત.</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>

૧૮ જુનીયર કલાર્ક કુ. ધરાબેન એમ. બારૈયા (હિસાબી શાખા)

	વહીવટી સત્તાઓ	
	નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.
	ફરજો	<p>૧. અધિકારી/ કર્મચારીઓના પગાર બીલો બનાવવા અંગેની કામગીરી.</p> <p>૨. સ્ટાઇપેન્ડ બીલ બનાવવા, એરીયર્સ બીલ,</p> <p>૩. એલ.પી.સી બનાવવા, એન.ઓ.સી., સર્ટીફીકેટ બનાવવા</p> <p>૪. કાર્યાલય આંદેશની ફાઇલીંગ કામગીરી કરવી.</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>

૧૯	<b>જુનીયર કલાર્ક</b>	<b>શ્રી બી. ડી. કોગતિયા (સ્ટોર શાખા)</b>				
	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="width: 25%;">વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.</td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.	
વહીવટી સત્તાઓ						
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.					
	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="width: 25%;">ફરજો</td><td> <p>૧. સરકારશ્રીના નિયમો પ્રમાણે, સ્ટેશનરી/લેખન સામગ્રી ભંડાર અમદાવાદ તથા સરકારી પ્રેસ વડોદરા ખાતેથી, કચેરીની સ્ટેશનરી મંજુર કરાવવી, રૂબરૂ જઇને મેળવવી તથા તે સ્ટેશનરી અત્રેની કચેરીના બ્રાન્ચ/અધિકારી વર્ગની જરૂરીયાત પ્રમાણે ઇન્ડેન્ડ આપવું, ઇન્ડેન્ડ આપવાની કામગીરી કરવી તથા તેને સંલગ્ન, સ્ટોર રજુસ્ટર નિભાવવા, સરકારી પ્રેસે રાજકોટ/વડોદરાથી મેજ ડાયરી કેલેન્ડરનું ઇન્ડેન્ડ મોકલી મંજુર કરાવી તે મેળવીને કચેરીમાં કર્મચારી/અધિકારીને વહેંચવાની કામગીરી.</p> <p>૨. અત્રેની કચેરીના સાધન/મશીનો રીપેરિંગ, મેઇન્ટેનાન્સ કોન્ટ્રાક્ટની કામગીરી નિયમોનુસાર કરવામાં આવે તેની કાળજી રાખવી, ઉક્ત મશીનો માટે કન્યુમેબલ આઇટમની ખરીદી નિયમોનુસાર કરવામાં આવે, અને સ્ટોક રજુસ્ટર નિભાવવામાં આવે તેની કાળજી રાખવી.</p> <p>૩. સરકારી કર્મચારી/અધિકારીને મળવાપાત્ર પેન/રીફીલની ખરીદી વર્ગ-૪ માટે પોલી વસ્ત્ર ગણવેશ તથા ગરમ ગણવેશ તથા બુટ / ચંપલની ખરીદી, ડ્રાયવર માટે પોલી વસ્ત્ર તથા ગરમ ગણવેશ તથા વોચમેન માટે પોલી વસ્ત્ર તથા આર્ટીકલ નિયમોનુસાર ખરીદ કરવામાં આવે છે.</p> <p>૪. જાહેર બાંધકામ વિભાગની નીચે તમામ કામગીરી, રીપેરિંગ, દરમાસ્ત વિગેરે.</p> <p>૫. ડેડસ્ટોક રજુસ્ટર નિભાવવા</p> <p>૬. કવાર્ટર ફાળવણી/સરકારી વાહનો તથા ટેન્ડરો અંગેની કામગીરી</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોઓપે તે કામગીરી કરવી.</p> </td></tr> </table>	ફરજો	<p>૧. સરકારશ્રીના નિયમો પ્રમાણે, સ્ટેશનરી/લેખન સામગ્રી ભંડાર અમદાવાદ તથા સરકારી પ્રેસ વડોદરા ખાતેથી, કચેરીની સ્ટેશનરી મંજુર કરાવવી, રૂબરૂ જઇને મેળવવી તથા તે સ્ટેશનરી અત્રેની કચેરીના બ્રાન્ચ/અધિકારી વર્ગની જરૂરીયાત પ્રમાણે ઇન્ડેન્ડ આપવું, ઇન્ડેન્ડ આપવાની કામગીરી કરવી તથા તેને સંલગ્ન, સ્ટોર રજુસ્ટર નિભાવવા, સરકારી પ્રેસે રાજકોટ/વડોદરાથી મેજ ડાયરી કેલેન્ડરનું ઇન્ડેન્ડ મોકલી મંજુર કરાવી તે મેળવીને કચેરીમાં કર્મચારી/અધિકારીને વહેંચવાની કામગીરી.</p> <p>૨. અત્રેની કચેરીના સાધન/મશીનો રીપેરિંગ, મેઇન્ટેનાન્સ કોન્ટ્રાક્ટની કામગીરી નિયમોનુસાર કરવામાં આવે તેની કાળજી રાખવી, ઉક્ત મશીનો માટે કન્યુમેબલ આઇટમની ખરીદી નિયમોનુસાર કરવામાં આવે, અને સ્ટોક રજુસ્ટર નિભાવવામાં આવે તેની કાળજી રાખવી.</p> <p>૩. સરકારી કર્મચારી/અધિકારીને મળવાપાત્ર પેન/રીફીલની ખરીદી વર્ગ-૪ માટે પોલી વસ્ત્ર ગણવેશ તથા ગરમ ગણવેશ તથા બુટ / ચંપલની ખરીદી, ડ્રાયવર માટે પોલી વસ્ત્ર તથા ગરમ ગણવેશ તથા વોચમેન માટે પોલી વસ્ત્ર તથા આર્ટીકલ નિયમોનુસાર ખરીદ કરવામાં આવે છે.</p> <p>૪. જાહેર બાંધકામ વિભાગની નીચે તમામ કામગીરી, રીપેરિંગ, દરમાસ્ત વિગેરે.</p> <p>૫. ડેડસ્ટોક રજુસ્ટર નિભાવવા</p> <p>૬. કવાર્ટર ફાળવણી/સરકારી વાહનો તથા ટેન્ડરો અંગેની કામગીરી</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોઓપે તે કામગીરી કરવી.</p>			
ફરજો	<p>૧. સરકારશ્રીના નિયમો પ્રમાણે, સ્ટેશનરી/લેખન સામગ્રી ભંડાર અમદાવાદ તથા સરકારી પ્રેસ વડોદરા ખાતેથી, કચેરીની સ્ટેશનરી મંજુર કરાવવી, રૂબરૂ જઇને મેળવવી તથા તે સ્ટેશનરી અત્રેની કચેરીના બ્રાન્ચ/અધિકારી વર્ગની જરૂરીયાત પ્રમાણે ઇન્ડેન્ડ આપવું, ઇન્ડેન્ડ આપવાની કામગીરી કરવી તથા તેને સંલગ્ન, સ્ટોર રજુસ્ટર નિભાવવા, સરકારી પ્રેસે રાજકોટ/વડોદરાથી મેજ ડાયરી કેલેન્ડરનું ઇન્ડેન્ડ મોકલી મંજુર કરાવી તે મેળવીને કચેરીમાં કર્મચારી/અધિકારીને વહેંચવાની કામગીરી.</p> <p>૨. અત્રેની કચેરીના સાધન/મશીનો રીપેરિંગ, મેઇન્ટેનાન્સ કોન્ટ્રાક્ટની કામગીરી નિયમોનુસાર કરવામાં આવે તેની કાળજી રાખવી, ઉક્ત મશીનો માટે કન્યુમેબલ આઇટમની ખરીદી નિયમોનુસાર કરવામાં આવે, અને સ્ટોક રજુસ્ટર નિભાવવામાં આવે તેની કાળજી રાખવી.</p> <p>૩. સરકારી કર્મચારી/અધિકારીને મળવાપાત્ર પેન/રીફીલની ખરીદી વર્ગ-૪ માટે પોલી વસ્ત્ર ગણવેશ તથા ગરમ ગણવેશ તથા બુટ / ચંપલની ખરીદી, ડ્રાયવર માટે પોલી વસ્ત્ર તથા ગરમ ગણવેશ તથા વોચમેન માટે પોલી વસ્ત્ર તથા આર્ટીકલ નિયમોનુસાર ખરીદ કરવામાં આવે છે.</p> <p>૪. જાહેર બાંધકામ વિભાગની નીચે તમામ કામગીરી, રીપેરિંગ, દરમાસ્ત વિગેરે.</p> <p>૫. ડેડસ્ટોક રજુસ્ટર નિભાવવા</p> <p>૬. કવાર્ટર ફાળવણી/સરકારી વાહનો તથા ટેન્ડરો અંગેની કામગીરી</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોઓપે તે કામગીરી કરવી.</p>					
૨૦	<b>જુનીયર કલાર્ક</b>	<b>કુ. અસ્મિતા બારૈયા (વર્ગ- ૩, ૪ મહેકમ શાખા)</b>				
	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="width: 25%;">વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.</td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.	
વહીવટી સત્તાઓ						
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઈ સત્તા નથી.					
	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="width: 25%;">ફરજો</td><td> <p>૧. સીનીયોરીટી લિસ્ટ</p> <p>૨. વહીવટી સંવર્ગની ભરતી નિયમોની કામગીરી.</p> <p>૩. માસિક ખાલી જગ્યા પત્રકની કામગીરી.</p> <p>૪. હંગામી જગ્યા કન્ટીન્યુએશન (ડીએમઇઆર)</p> <p>૫. પ્રતિનિયુક્તિ કામગીરી.</p> <p>૬. કર્મયોગી તાતીમ અંગેની કામગીરી.</p> </td></tr> </table>	ફરજો	<p>૧. સીનીયોરીટી લિસ્ટ</p> <p>૨. વહીવટી સંવર્ગની ભરતી નિયમોની કામગીરી.</p> <p>૩. માસિક ખાલી જગ્યા પત્રકની કામગીરી.</p> <p>૪. હંગામી જગ્યા કન્ટીન્યુએશન (ડીએમઇઆર)</p> <p>૫. પ્રતિનિયુક્તિ કામગીરી.</p> <p>૬. કર્મયોગી તાતીમ અંગેની કામગીરી.</p>			
ફરજો	<p>૧. સીનીયોરીટી લિસ્ટ</p> <p>૨. વહીવટી સંવર્ગની ભરતી નિયમોની કામગીરી.</p> <p>૩. માસિક ખાલી જગ્યા પત્રકની કામગીરી.</p> <p>૪. હંગામી જગ્યા કન્ટીન્યુએશન (ડીએમઇઆર)</p> <p>૫. પ્રતિનિયુક્તિ કામગીરી.</p> <p>૬. કર્મયોગી તાતીમ અંગેની કામગીરી.</p>					

		<p>૭. ગુજરાતી, હિન્ડી ભાષા મુક્તિ અંગેની કામગીરી.</p> <p>૮. ડીમ ડેઇટને લગતી કામગીરી.</p> <p>૯. અન્ય સંકલન માહિતી કામગીરી.</p> <p>૧૦. વર્ક્શીટની કામગીરી.</p> <p>૧૧. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>						
૨૧	જુનીયર કલાર્ક	શ્રી બી. એસ. અસારી (આર.ટી.આઈ/કોર્ટસેલ શાખા)						
		<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td>જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.</td></tr> <tr> <td>ફરજો</td><td> <p>૧. જાહેર માહિતી અધિકારી /મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવી.</p> <p>૨. ઇન્ડેન્ટ બનાવવા તથા તેનો હિસાબ રાખવો.</p> <p>૩. આર.ટી.આઈ.ને લગતી કામગીરી કરવી.</p> <p>૪. આર.ટી.આઈ. ને લગતા રજુસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતીના પત્રકો તૈયાર કરવા.</p> <p>૫. હાઇકોર્ટને લગતાં તમામ કેસોની ફાઇલો સંભાળવી.</p> <p>૬. સંસ્થા ખાતેની તમામ ફરજાદોને લગતી ફાઇલો સંભાળવી તથા સરકારશ્રીને સમયસર માહિતી મોકલવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.	ફરજો	<p>૧. જાહેર માહિતી અધિકારી /મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવી.</p> <p>૨. ઇન્ડેન્ટ બનાવવા તથા તેનો હિસાબ રાખવો.</p> <p>૩. આર.ટી.આઈ.ને લગતી કામગીરી કરવી.</p> <p>૪. આર.ટી.આઈ. ને લગતા રજુસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતીના પત્રકો તૈયાર કરવા.</p> <p>૫. હાઇકોર્ટને લગતાં તમામ કેસોની ફાઇલો સંભાળવી.</p> <p>૬. સંસ્થા ખાતેની તમામ ફરજાદોને લગતી ફાઇલો સંભાળવી તથા સરકારશ્રીને સમયસર માહિતી મોકલવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
વહીવટી સત્તાઓ								
નાણાંકીય	જવાબદારી છે. પણ કોઇ સત્તા નથી.							
ફરજો	<p>૧. જાહેર માહિતી અધિકારી /મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવી.</p> <p>૨. ઇન્ડેન્ટ બનાવવા તથા તેનો હિસાબ રાખવો.</p> <p>૩. આર.ટી.આઈ.ને લગતી કામગીરી કરવી.</p> <p>૪. આર.ટી.આઈ. ને લગતા રજુસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતીના પત્રકો તૈયાર કરવા.</p> <p>૫. હાઇકોર્ટને લગતાં તમામ કેસોની ફાઇલો સંભાળવી.</p> <p>૬. સંસ્થા ખાતેની તમામ ફરજાદોને લગતી ફાઇલો સંભાળવી તથા સરકારશ્રીને સમયસર માહિતી મોકલવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>							
૨૨	જુનીયર કલાર્ક	કુ. દિપીકાબેન મહેશભાઈ ચાવડા (હિસાબી શાખા)						
		<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td></td></tr> <tr> <td>ફરજો</td><td> <p>૧. શાખામાં આવતી ટપાલ ઇનવર્ક-આઉટવર્ક</p> <p>૨. દફતરી ફાઇલીંગની કામગીરી.</p> <p>૩. ટી.એ.ડી.એ. બીલ, એમ.આર. બીલ, એ.બી.સી. રજુસ્ટરની કામગીરી.</p> <p>૪. જી.પી.એફ., જુથ વિમા ના બીલો બનાવવાની કામગીરી</p> <p>૫. એલ.ટી.સી. બીલ બનાવવા,</p> <p>૬. કાર્યાલય આંદેશની ફાઇલીંગ કામગીરી કરવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p> </td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય		ફરજો	<p>૧. શાખામાં આવતી ટપાલ ઇનવર્ક-આઉટવર્ક</p> <p>૨. દફતરી ફાઇલીંગની કામગીરી.</p> <p>૩. ટી.એ.ડી.એ. બીલ, એમ.આર. બીલ, એ.બી.સી. રજુસ્ટરની કામગીરી.</p> <p>૪. જી.પી.એફ., જુથ વિમા ના બીલો બનાવવાની કામગીરી</p> <p>૫. એલ.ટી.સી. બીલ બનાવવા,</p> <p>૬. કાર્યાલય આંદેશની ફાઇલીંગ કામગીરી કરવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
વહીવટી સત્તાઓ								
નાણાંકીય								
ફરજો	<p>૧. શાખામાં આવતી ટપાલ ઇનવર્ક-આઉટવર્ક</p> <p>૨. દફતરી ફાઇલીંગની કામગીરી.</p> <p>૩. ટી.એ.ડી.એ. બીલ, એમ.આર. બીલ, એ.બી.સી. રજુસ્ટરની કામગીરી.</p> <p>૪. જી.પી.એફ., જુથ વિમા ના બીલો બનાવવાની કામગીરી</p> <p>૫. એલ.ટી.સી. બીલ બનાવવા,</p> <p>૬. કાર્યાલય આંદેશની ફાઇલીંગ કામગીરી કરવી.</p> <p>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>							
૨૩	જુનીયર કલાર્ક	શ્રી અશ્વિનકુમાર ઘુસાભાઈ ચાવડા (વર્ગ- ૧, ૨ મહેકમ શાખા)						
		<table border="1"> <tr> <td>વહીવટી સત્તાઓ</td><td></td></tr> <tr> <td>નાણાંકીય</td><td></td></tr> </table>	વહીવટી સત્તાઓ		નાણાંકીય			
વહીવટી સત્તાઓ								
નાણાંકીય								

		<p>ક્રમો</p> <p>વર્ગ -૧ અને ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપૂર્ણ કામગીરી.</p> <p>(સહ પ્રાધ્યાપક સંવર્ગ)</p> <ol style="list-style-type: none"> <li>અધિકારીઓની બદલી અંગેની દરખાસ્તો સરકારશ્રીમાં મોકલવા અંગેની કામગીરી.</li> <li>નિમણુંક પામેલ ડોક્ટરોની હાજર રીપોર્ટ, હીસ્ટીસીટો, વતન એકરાર તેમજ તેને લગતી અન્ય બાબતો અંગેની કામગીરી.</li> <li>નિમણુંક નિયમિત કરવાની કામગીરી.</li> <li>સેવાઓ સર્વાંગ કરવાની કામગીરી</li> <li>મદદનીશ પ્રાધ્યાપકમાંથી સહ પ્રાધ્યાપકમાં બઢતી બાબતે ડી.પી.સી.ની વધારાની કામગીરી</li> <li>સીનીયોરીટી લીસ્ટ, કામચલાઉની દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીને મોકલવા અંગેની કામગીરી.</li> <li>કામચલાઉ સીનીયોરીટી લીસ્ટના વાંધા સુચનો મળતા ચકાસણી કરી સરકારશ્રીને દરખાસ્તો કરવી.</li> <li>કાયમી સીનીયોરીટી લીસ્ટ બહાર પાડતા દરેકને મોકલવા.</li> <li>સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી.</li> <li>મીટિંગની માહિતીઓ./હંગામી જગ્યાઓના કન્ટીન્યુએશન ની કામગીરી</li> <li>એલ. એ. કયુ. ની માહિતીઓની કામગીરી.</li> <li>ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</li> </ol>
--	--	--

૨૪ જુનીયર કલાર્ક શ્રી નિખીલભાઈ નરેશભાઈ વાધેલા (વિદ્યાર્થી શાખા)

	વહીવટી સત્તાઓ	
	નાણાંકીય	
	ક્રમો	<ol style="list-style-type: none"> <li>પ્રવેશ નિયમો - મેડિકલ/ડેન્ટલ/ફિઝીયોથેરાપી/નર્સિંગ કોલેજો.</li> <li>સરકારી મેડિકલ કોલેજોમાં અનુસનાતક અભ્યાસક્રમ શરૂ કરવા.</li> <li>પી.જી./યુ.જી. ની માન્યતા માટે ઇન્સ્પેક્શન અને ઇન્સ્પેક્શન ફી અંગે.</li> <li>પ્રવેશ સીટોમાં વધારો કરવા બાબત.</li> <li>એમ.સી.આઇ. ની જરૂરીયાત મુજબ મેડિકલ કોલેજોમાં સ્ટાફ મંજૂર કરવા બાબત.</li> <li>સ્ટાઇપેન્ડમાં વધારો કરવા બાબત./ યુ.જી./પી.જી. પ્રવેશની ગેરરીતી રજુઆત અંગે.</li> <li>ટયુશન ફી/હોસ્પિટલ ફી બાબત.</li> <li>ડીનશ્રી, અધિક ડીનશ્રી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</li> </ol>

૨૫ જુનીયર કલાર્ક શ્રી વીરભદ્રસિંહ પરેશકુમાર ચુડાસમા (વર્ગ- ૧, ૨ મહેકમ શાખા)

	વહીવટી સત્તાઓ	
	નાણાંકીય	

		કૃજો	વર્ગ - ૨ ના અધિકારીશ્રીનું મહેકમ સંપુર્ણ કામગીરી. (ટ્યુટર સંવર્ગ) ૧. મહેકમ શાખામાં આવતી ટપાલો ઇન્વર્ડ રજીસ્ટરમાં નોંધવી. ૨. મહેકમ શાખામાં ફાઇલિંગ અંગેની કામગીરી. ૩. સરકારશ્રી દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી. ૪. મહેકમ શાખાની બંધ થયેલ ફાઇલો ના દફુતર વર્ગીકરણની કામગીરી. ૫. વર્કશીટ માહિતી. ૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.
૨૬	જુનીયર કલાર્ક	શ્રી જ્યદિપકુમાર લવજીભાઈ ધાંધલ્યા (ફરિયાદ શાખા)	
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કૃજો	૧. ઇન્ડન્ડ બનાવવા તથા તેનો હિસાબ રાખવો. ૨. ફરિયાદની તપાસ કમીટી નીમી હકીકતલક્ષી પ્રાથમિક તપાસ અહેવાલ મંગાવવા તથા તમામ ફરિયાદોને લગતી ફાઇલો સંભાળવી ૩. તપાસ કમીટીના તપાસ અહેવાલ તથા માહિતી સમયસર વડી કચેરીને મોકલવી. ૪. ફરિયાદને લગતા રજીસ્ટર નિભાવવા, સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતીના પત્રકો તૈયાર કરવા . ૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.
૨૭	જુનીયર કલાર્ક	શ્રી સંજયકુમાર રત્નિલાલ જાની (હિસાબી શાખા- કેશીયર)	
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કૃજો	૧. તમામ હિસાબી કામગીરી. ૨. કેશની જાળવણી તેના હિસાબો અને કેશબુક નિભાવવી. ૩. બેકમાંથી કેશ લાવવી. ૪. એ.બી.સી. બીલ, ગ્રાન્ટ, મેસેન્જર, ચેક, કાયમી પેશાગી, એબ્સ્ટ્રેક, અનપેઇડ વગેરે રજીસ્ટર નિભાવવા. ૫. પી.એ.એ. સાથે હિસાબો મેળવવા, સરકારી ચલણો ભરવા. ૬. કિંમતી દસ્તાવેજો જાળવવા દા.ત., બેંક ગેરેન્ટી વિગેરે. ૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.
૨૮	જુનીયર કલાર્ક	કુ. કોમલબા ધનશ્યામસિંહ વાઘેલા (સ્ટોર શાખા)	
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	

		કર્ણો	<ol style="list-style-type: none"> <li>૧. કચેરીના બ્રાન્ચ/અધિકારી વર્ગની જરૂરીયાત પ્રમાણે સ્ટેશનરી ઇન્ડન્ટ આપવું, તથા તેને સંલગ્ન, સ્ટોર રજીસ્ટર નિભાવવા,</li> <li>૨. સ્ટોક રજીસ્ટર નિભાવવા અંગેની કામગીરી કરવી</li> <li>૩. સરકારી કર્મચારી/અધિકારીને મળવાપાત્ર પેન/રીફીલની ખરીદી વર્ગ-૪ માટે પોલી વસ્ત્ર ગણવેશ તથા ગરમ ગણવેશ તથા બુટ / ચંપલની ખરીદી, ડાયવર માટે પોલી વસ્ત્ર તથા ગરમ ગણવેશ તથા વોયમેન માટે પોલી વસ્ત્ર તથા આટીકલ નિયમોનુસાર ખરીદ કરવા માટેના હુકમો કરવા</li> <li>૪. જાહેર બાંધકામ વિભાગની નીચે તમામ કામગીરી, રીપેરીંગ, દરખાસ્ત વિગેરે પત્ર વ્યવહાર કરવા</li> <li>૫. ડેડસ્ટોક રજીસ્ટર નિભાવવા</li> <li>૬. કવાર્ટર ફાળવણી/સરકારી વાહનો તથા ટેન્કરો અંગેની કામગીરી</li> <li>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોપે તે કામગીરી કરવી.</li> </ol>
૨૯	જુનીયર કલાર્ક		કુ. રીધલબેન વેલજુલાઈ ઈટાળીયા (વિદ્યાર્થી શાખા)
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કર્ણો	<ol style="list-style-type: none"> <li>૧. પ્રવેશ નિયમો - મેડિકલ/ડેન્ટલ/ફીઝીયોથેરાપી/નસ્ટીંગ કોલેજો.</li> <li>૨. સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવા.</li> <li>૩. પી.જી./યુ.જી. ની માન્યતા માટે ઇન્સ્પેક્શન અને ઇન્સ્પેક્શન ફી અંગે.</li> <li>૪. પ્રવેશ સીટોમાં વધારો કરવા બાબત.</li> <li>૫. એમ.સી.આઇ. ની જરૂરીયાત મુજબ મેડિકલ કોલેજોમાં સ્ટાફ મંજૂર કરવા બાબત.</li> <li>૬. સ્ટાઇપેન્ડમાં વધારો કરવા બાબત./ યુ.જી./પી.જી. પ્રવેશની ગેરરીતી રજુઆત અંગે.</li> <li>૭. ટ્યુશન ફી/હોસ્પેટલ ફી બાબત.</li> <li>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોપે તે કામગીરી કરવી.</li> </ol>
૩૦	જુનીયર કલાર્ક		શ્રી જયદિપભાઈ રણછોડભાઈ પરમાર (વર્ગ- ૧, ૨ મહેકમ શાખા)
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કર્ણો	<ol style="list-style-type: none"> <li>૧. અધિકારીઓના વાસ્તિક ખાનગી અહેવાલની કામગીરી</li> <li>૨. વી. વી. આઇ. પી. પ્રોગ્રામ/ધારાસભ્ય, મંત્રીશ્રી સંદર્ભની કામગીરી.</li> <li>૩. તમામ પ્રકારના મેડિકલ કેમ્પ તથા તેમને આનુષ્ઠાંગિક કામગીરી</li> <li>૪. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોપે તે કામગીરી કરવી.</li> </ol>

૩૧	<b>જુનીયર કલાર્ક</b>	<b>કુ. દર્શનાબેન કનૈયાલાલ જાની (વિધાર્થી શાખા)</b>	
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કૃજો	<p>૧. બોન્ડ વસુલાત અને મુક્તિ બાબત.</p> <p>૨. ટ્રેનીંગ/વર્કશૉપ/કોન્ફરન્સ/સેમીનાર/પ્રતિનિયુક્તિ અંગે.</p> <p>૩. મેડિકલ/ડેન્ટલ/ફિઝિયોથેરાપી ઇન્ફર્નશીપની પરવાનગી અને એન.ઓ.સી. બાબત.</p> <p>૪. ઓલ ઇન્ડીયા ૧૫% અને ૨૫% બાબત.</p> <p>૫. એમ.સી.આઇ./ડી.સી.આઇ. સાથે પત્ર વ્યવહાર.</p> <p>૬. ચુનિવર્સિટીને લગતી કામગીરી</p> <p>૭. જાહેરાત પ્રેસનોટને લગતી બાબત.</p> <p>૮. રેસીડન્ટ ડોક્ટરોની રજાઓ બાબત.</p> <p>૯. રેસીડન્ટ ડોક્ટરોની વીમા બાબત.</p> <p>૧૦. વિધાર્થીઓ/ઇન્ફર્ન વિધાર્થીઓ/રેસીડન્ટ ડોક્ટરોની હડતાળ બાબત.</p> <p>૧૧. વિધાર્થીઓના રેગીંગ બાબત.</p> <p>૧૨. યુ.જી./પી.જી. ના પ્રવેશમાં રોસ્ટર બાબત.</p> <p>૧૩. ડીનશ્રી, અધિક ડીનશ્રી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
૩૨	<b>જુનીયર કલાર્ક</b>	<b>કુ. રેખાબેન બાલુભાઈ રામાણી (હિસાબી શાખા)</b>	
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કૃજો	<p>૧. આઉટસોર્સ કર્મચારીઓના બીલો બનાવવા અંગેની કામગીરી.</p> <p>૨. દફતરી ફાઇલીંગની કામગીરી.</p> <p>૩. કન્ટીન્જસી બીલો, જુથ વીમા બીલ બનાવવા અંગેની કામગીરી કરવી.</p> <p>૪. ઓ.ઇ., એમ.એસ., એમ.વી., એમ.ઇ. ને લગતાં તમામ બીલ તથા તેને લગતાં રજુસ્ટર નિભાવવા</p> <p>૫. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહીવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
૩૩	<b>જુનીયર કલાર્ક</b>	<b>કુ. આશાબેન જાની (વર્ગ- ૩, ૪ મહેકમ શાખા)</b>	
		વહીવટી સત્તાઓ	
		નાણાંકીય	
		કૃજો	<p>૧. સ્વેરિષ્ટ નિવૃત્તિ અંગેના કેસો.</p> <p>૨. પેન્શન કેસ અંગેની કામગીરી.</p> <p>૩. સ્ટેપીંગ અપ મંજુર કરવા અંગેની કામગીરી.</p> <p>૪. વિદેશ જવા અંગે એન. ઓ. સી. આપવા બાબતની કામગીરી.</p> <p>૫. રોસ્ટર રજુસ્ટર અંગેની કામગીરી.</p>

		<p>૬. કર્મચારીની વયનિવૃત્તિ અંગેની કામગીરી.</p> <p>૭. ખાનગી અહેવાલની કામગીરી (સંસ્થાના તમામ કર્મચારી)</p> <p>૮. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહિવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</p>
૩૪	જુનીયર કલાર્ક	શ્રી અનિરુદ્ધસિંહ મોરી (પી. પી. યુનિટ)
	વહીવટી સત્તાઓ	
	નાણાંકીય	
	ફરજો	(પી. પી. યુનિટ- ની કામગીરી) <ol style="list-style-type: none"> <li>૧. પી. પી. યુનિટની વહિવટી તેમજ તમામ પ્રકારની કામગીરી.</li> <li>૨. પી. પી. યુનિટની નાણાંકીય તમામ બીલો બનાવવા.</li> <li>૩. પી. પી. યુનિટના માસિક રીપોર્ટ વડી કચેરીઓને મોકલવા.</li> <li>૪. ગાયનેક વિભાગના વડાશ્રી દ્વારા જે કામગીરી સોંપે તે કરવી.</li> <li>૫. પી. પી. યુનિટને લગતી કોઈ વિગેરને કામગીરી કરવી.</li> <li>૬. તબીબી અધિક્ષકશ્રીની કચેરી દ્વારા સુપ્રત કરેલ ડાયટ, ખરીદી તેમજ પરચુરણ કામગીરી વિગેર કરવાની રહેશે.</li> <li>૭. ડીનશ્રી, અધિક ડીનશ્રી, હિસાબી અધિકારી, વહિવટી અધિકારી તેમજ કચેરી અધિક્ષક સોંપે તે કામગીરી કરવી.</li> </ol>

## નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

૬.૧	જુદા જુદા મુદ્દાઓ અંગે
	જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે ગુજરાત સીવીલ રૂલ્સ, ગુજરાત ડ્રેજરી રૂલ્સ, પેન્શન અને રજા અંગેના નિયમો, તબીબી ભથ્થા તથા સારવાર અંગેના નિયમો તેમજ સરકારશીનાં ઠરાવ પરિપત્રો વિશે મુજબ સંદર્ભ ટાંકી નિર્ણય લેવામાં આવે છે
૬.૨	અગત્યની બાબતો માટે
	કચેરીની કાર્ય પદ્ધતિ મુજબ આ સંસ્થાના વડાને આપવામાં આવેલ ડેલીગેશન ઓફ પાવર્સ મુજબ તેમજ સરકારશીનાં ઠરાવેલા નિયમો મુજબ નિર્ણય લેવામાં આવે છે. તેમજ આ સંસ્થા ખાતે સ્ટોર પરચેઝ કમીટી તથા ક્વાર્ટર એલોટમેન્ટ કમીટીની રચના કરવામાં આવેલ છે. તેમ છતાં અગત્યની બાબતો માટે ખાસ નિર્ણય લેવા માટે વડી કચેરીને એટલે કે અધિક નિયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન, ગાંધીનગરનું માર્ગદર્શન માંગવામાં આવે છે.
૬.૩	નિર્ણયને જનતા સુધી
	નિર્ણયને જનતા સુધી પહોંચાડવા માટે નોટીસ બોર્ડ તેમજ માહિતી નિયામકશ્રી દ્વારા વર્તમાનપત્રોમાં જાહેર ખબર દ્વારા પહોંચાડવામાં આવે છે.
૬.૪	નિર્ણય લેવાની પ્રક્રિયામાં મંતવ્યો
	કમીટીના મેમ્બર તથા વડી કચેરી (અધિક નિયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન, ગાંધીનગર)
૬.૫	નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે
	સંસ્થાના વડાશી તથા અધિક નિયામકશ્રી તબીબી શિક્ષણ અને સંશોધન, ગાંધીનગર
૬.૬	જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેની માહિતી અલગ રીતે નીચેના નમુનામાં આપો.

( નિયત સંગ્રહ - ૪ )

નિયત કાર્યો કરવા માટે નક્કી કરેલા ધોરણો

૧૫.૧ વિવિધ પ્રવૃત્તિઓ / કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નક્કી કરેલ ધોરણોની વિગતો આપો.

➢ શૈક્ષણિક કાર્ય :-

- (અ) મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ધારા ધોરણ મુજબ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
- (બ) ભાવનગર યુનિ. દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ તથા પરીક્ષા પદ્ધતિ
- (ક) સરકારશીના વખતો વખતના આદેશો અને ઠરાવો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.

ક્રમ નંબર	
જેના પર નિર્ણય લેવાના છે તે વિષય	આ માટેની અગત્યની બાબતો પર અરજી મળ્યાની તારીખ અથવા તો નિયત સમયમર્યાદા હોય તો તેને અગ્રતા આપવામાં આવે છે.
માર્ગદર્શક સુચન/દિશાનિર્દેશ જો કોઈ હોય તો	સરકારી નિયમ સંગ્રહો ઠરાવો અને પરીપત્રો અને સરકારશીનું માર્ગદર્શન
અમલની પ્રક્રિયા	અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાગેલ અધિકારીઓનો હોક્કો	ડીનશ્રી, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર.
ઉપર જણાવેલ અધિકારીના સંપર્ક અંગેની માહિતી	ડીનશ્રી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ફોન નં- ૨૪૩૦૮૦૮ ઇ- મેઇલ એડ્રેસ- <a href="mailto:dean.health.bhavnagar@gmail.com">dean.health.bhavnagar@gmail.com</a>
જો નિર્ણયથી સંતોષ ન હોય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી ?	સરકારી જાહેર માહિતી અધિકારી કરતા હોક્કામાં પ્રવર હોય તેવા એપેલેટ અધિકારીને તેમને ચુકાદો મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં નમુના- ચ માં પ્રથમ અપીલ કરવાની રહે છે.

(નિયમસંગ્રહ -૫)

કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમસંગ્રહ અને દફતરો

- ૪.૧ જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપયોગ કરવાના નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયનમસંગ્રહ અને દફતરોની યાદી નીચેના નમુના મુજબ આપો. આ નમુનો દરેક પ્રકારના દસ્તાવેજ માટે ભરવાનો છે.

દસ્તાવેજનું નામ/મથાળું	દસ્તાવેનો પ્રકાર
૧. ગુજરાત સીવીલ સર્વીસીઝ રૂલ્સ	નિયમસંગ્રહ
૨. ગુજરાત નાણાકીય નિયમો	નિયમસંગ્રહ
૩. તબીબી ભથ્થા સારવારના નિયમો	નિયમસંગ્રહ
૪. પેન્શન અંગેના નિયમો	નિયમસંગ્રહ
૫. રજા અંગેના નિયમો	નિયમસંગ્રહ
૬; શીસ્ત અને અપીલનાં નિયમો	નિયમસંગ્રહ  નીચે આપેલા પ્રકારોમાંથી એક પસંદ કરો (નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ, દફતરો, અન્ય)
દસ્તાવેજ પરનું દ્રોષું લખાણ - જી. સી. એસ. આર. રૂલ્સ - જી. ટી. આર. રૂલ્સ - ડીસીપીલીનરી કન્ડક્ટ રૂલ્સ - જનરલ રૂલ્સ	નિયમો
વ્યક્તિત્વે નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની નકલ અહીંથી મળશે.  અને દફતરોની નકલ અહીંથી મળશે.	સરનામું :-  સરકારી મેડિકલ કોલેજ, જેલ રોડ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં, ભાવનગર. ટેલીફોન નંબર : - ૨૪૩૦૮૦૮/૨૫૧૧૫૧૧ ફેક્સ :-૨૪૨૨૦૧૧ ઈ-મેઇલ : <a href="mailto:dean.health.bhavnagar@gmail.com">dean.health.bhavnagar@gmail.com</a>
વિભાગ દ્વારા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની નકલ માટે લેવાની ફી (જો હોય તો)	રૂપિયા બે (૨) પાના દીઠ.  સી. ટી. ૫૦ રૂપિયા

( નિયમસંગ્રહ - ૬ )

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની  
કક્ષાઓ અંગેનું પત્રક

- ૬.૧ સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમુનાનો ઉપયોગ કરશો..  
જ્યાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા,  
નિયામકશ્રીની કચેરી કક્ષા, અન્યનો પણ ઉલ્લેખ કરવો. (" અન્યો " લખવાની  
જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરવો.)

અનું નં.	દસ્તાવેજની કક્ષા	દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે / તેના નિયંત્રણમાં છે.
૧	સરકારી કર્મચારીઓ ની સેવા વિષયક માહિતી	અંગત ફાઈલ તથા સર્વિસ બુક	આર.ટી.આઈના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમ સંગ્રહ - ૧૭ મુજબ મળી શકે.	વહીવટી અધિકારીશ્રી
૨	સરકારી અધિકારીઓની સેવા વિષયક માહિતી	અંગત ફાઈલ સર્વોસ બુક	આર.ટી.આઈના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમ સંગ્રહ - ૧૭ મુજબ મળી શકે.	વહીવટી અધિકારીશ્રી
૩	વિધાર્થીના અભ્યાસને લગતી માહિતી	(૧) એડમિશન (૨) પરીક્ષાઓ (૩) પરચુરણ		વહીવટી અધિકારીશ્રી
૪	નાણાંકીય બાબતો ને લગતી માહિતી	(૧) બજેટ (૨) ખર્ચ પત્રકો (૩) ખરીદીની પ્રક્રીયા (૪) ટ્રેજરી બીલ્સ		હિસાબી અધિકારીશ્રી

**( નિયમસંગ્રહ-૭ )**

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગતા

**નીતિ ઘડતર :-**

પ.૧ : શું નીતિઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ - પરામર્શ/સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો, નીચેના નમૂનામાં આવી નીતિની વિગતો આપો.

અનુ. નં	વિષય/મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે ? (હા/ના)	જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા

આનાથી નાગરિકને ક્યા આધારે નીતિ વિષયક બાબતોના ઘડતર અને અમલમાં જનતાની સહભાગિતા નક્કી કરાઈ છે તે સમજવામા મદદ થશે.

**નીતિનો અમલ :-**

પ.૨ : શું નીતિઓના અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય, તો આવી જોગવાઈઓની વિગતો નીચેના નમૂનામાં આપો.

અનું નં.	વિષય/મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે ? (હા/ના)	જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા
૧	ઇન્સ્ટીટ્યુશનલ એનિમલ એથીક્સ કમીટી	હા	પ્રાણીઓ પર થતા પ્રયોગોમાં ફૂરતા અટકાવવા માટે ભારત સરકારના CPCSEA નિયમ મુજબ સમિતીની રચના કરવામાં આવેલ છે.
૨	ઇન્સ્ટીટ્યુશનલ રીવ્યુ બોર્ડ (એથીક્સ કમીટી)	હા	દર્દીઓ પર જ્યારે નવી દવાઓ કે સારવારનો અભ્યાસ કરવાનો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલન માટે ICMR ની ગાઈડ લાઈન પ્રમાણે રચના કરવામાં આવી છે.
૩	મેડિકલ કોલેજ ડેવલપમેન્ટ સોસાયટી	હા	સમયાંતરે મીટિંગોમાં ચર્ચા કરી વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને દર્દીઓની સુખાકારીના કાર્યો કરવામાં આવે છે.

(નિયમ સંગ્રહ -૮)

તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

૭.૧ જાહેર તંત્રને લગતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળ અંગેની વિગત નીચેના નમૂનામાં આપો.

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)
	કોલેજ કાઉન્સીલ કમિટી
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ)
	આ કમિટીમા મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના નોર્મ્સ મુજબની સમીક્ષા તથા અમલીકરણ માટે તથા ટીચિંગ સ્ટાફ તથા વિધાર્થીઓના શૈક્ષણિક કાર્ય અંગેની સમીક્ષા તથા સંસ્થાની વહીવટી તેમજ સરકારશ્રીની સુચનાઓ તથા વિધાર્થીઓનો શૈક્ષણિક કોલેજ તથા યુનિ. અને કલીનિકલ વિભાગોની હોસ્પિટલ સાથેની પ્રજાલક્ષી લોકમત અંગેની કામગીરી વગેરે માટેની સમીતીની રચના કરવામાં આવેલી છે
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	સંચાલક
૫	માળખું અને સખ્ય બંધારણ
	દરેક વિભાગના વડા, મેડિકલ સુપ્રિન્ટેનન્ટ, ડીનશ્રી
૬	સંસ્થાના વડા
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	ઓછામાં ઓછી ચાર તેમજ જ્યારે જ્યારે આવશ્યકતા જણાય ત્યારે.
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનો જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમસંગ્રહ - ૧૭ મુજબ મળી શકે.

## ૨. પરચેઝ કમિટી

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)
	પરચેઝ કમિટી
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ)
	આ સંસ્થાના વિવિધ સાધનો લાઇસેન્સના પુસ્તકો તથા અન્ય ખરીદી વગેરે ના ટેન્ડરો/કોટેશનો દ્વારા મંગાવવામાં આવેલ ભાવોની ચકાસણી કરી જે તે વિભાગની માંગણી મુજબ છે કે નહીં તેની ચકાસણી કરી આઈટમોની પસંદગી કરી ખરીદી અંગે આખરી નિર્ણય લેવામાં આવે છે.
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની લુભિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	કાર્યકારી
૫	માળખું અને સભ્ય બંધારણ
	(૧) ડીનશ્રી (૨) અધિક ડીનશ્રી (૩,૪) પ્રાધ્યાપક/સહપ્રાધ્યાપક - કોઇ બે કલીનીક વિભાગ, (હાલ સાયકાદ્રી અને મેડિસીન) (૫,૬) પ્રાધ્યાપક/સહપ્રાધ્યાપક - કોઇ બે નોન કલીનીકલ વિભાગ (હાલ માઇકોબાયોલોજી અને એનાટોમી) (૭,૮) વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી
૬	સંસ્થાના વડા
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	જરૂરિયાત મુજબ
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્ય નોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમસંગ્રહ - ૧૭ મુજબ મળી શકે

### 3. કવાર્ટર કમિટી :-

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)
	કવાર્ટર કમિટી
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ)
	આ સંસ્થા હસ્તકના તમામ કવાર્ટસ વર્ગ-૧-૨ ના અધિકારીઓને તથા વર્ગ-૩-૪ ના કર્મચારીઓને તેમની માંગણી મુજબ ફાળવણી તથા ફેરબદલી તથા કવાર્ટરને સંલગ્ન બાબતોનો આખરી નિર્ણય લઈ કમિટીની સુચના માર્ગદર્શન મુજબ અંતિમ નિર્ણય લેવામાં આવે છે.
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	કાર્યકારી
૫	માળખું અને સભ્ય બંધારણ
	(૧) ડીનશ્રી - ચેરમેન (૨) પ્રાધ્યાપક અને વિભાગના વડા - ત્રણ, (સભ્ય) (૫) વહીવટી અધિકારી, - સભ્ય
૬	સંસ્થાના વડા
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	ઓછામાં ઓછી બે વાર ઉપરાંત જરૂરિયાત મુજબ
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમસંગ્રહ - ૧૭ મુજબ મળી શકે

#### ૪. ઇન્સ્ટીટ્યુશનલ રીવ્યુ બોર્ડ:-

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)
	ઇન્સ્ટીટ્યુશનલ રીવ્યુ બોર્ડ (હયુમન ઓફિસીયલ કમીટી)
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ)
	સંસ્થાના નિતીમતા સિધ્ધાંતો અને નૈતિકતા જળવાઈ રહે તે માટે સુચનો નિર્ણય અને આખરી નિર્ણય આ કમીટી દ્વારા લેવામાં આવે છે. દર્દીઓ પર નવી દવાઓ કે સારવારના અભ્યાસ વખતે આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલન માટે સમાજની પ્રતીષ્ઠીત વ્યક્તિઓની હાજરીમાં નિર્ણય લેવામાં આવે છે.
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની લુભિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	કાર્યકારી
૫	માળખું અને સભ્ય બંધૂરણ
	(૧) ચેરમેન (બહારના વૈજ્ઞાનિક) (૨) સ્ટેટીશીયન (૩) કિલનીશીયન (૪) ફીલોસોફર (૫) સંસ્થાના સાચન્નીસ્ટ - ૨ (૬). લીગલ એક્સપર્ટ અને સામાજિક કાર્યકર (૭). સ્વરાજ્ય સંસ્થાના સભ્ય- ૨ (૮) ફાર્માકોલોજિસ્ટ- કો-ઓર્ડિનેટર
૬	સંસ્થાના વડા
	બહારના વૈજ્ઞાનિક
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડિનશ્રીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	ઓછામાં ઓછી ૬ ઉપરાંત જરૂરિયાત મુજબ
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમસંગ્રહ - ૧૭ મુજબ મળી શકે

પ. એનીમલ એથીક્સ કમિટી :-

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો
	એનીમલ એથીક્સ કમિટી
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ
	આ સંસ્થાના વિભાગો કે જેમા એનીમલ પ્રાણીઓ પર પ્રયોગો, તબીબી શિક્ષણ કરવા માટે ફૂરતા અટકાવવા વિધાર્થીઓના અભ્યાસ ઉચ્ચ શિક્ષણ માટે સરકારશ્રીના પર્યાવરણ ખાતાના અધિનિયમ મુજબ જરૂરી મંજુરી મેળવવાની રહે છે તે માટે જરૂરી સુચનો માર્ગદર્શન અને નિર્ણય આ કમિટી દ્વારા લેવામાં આવે છે.
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની લુભિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	કાર્યકારી
૫	માણખું અને સભ્ય બંધારણ
	(૧) ડીનશ્રી, (૨) ઇન્યાર્જ પ્રોફેન્સ - એનીમલ હાઉસ, (૩) બાયોલોજીકલ સાયન્ટીસ્ટ (૪) - (૫) બે અન્ય વિભાગના વૈજ્ઞાનિકો (૬) સંસ્થા બહારના વૈજ્ઞાનિકો (૭) પ્રાણીશાસ્કના તબીબો (૮) વેટરનરી એમ. ઓ.
૬	સંસ્થાના વડા
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડીનશ્રીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	ઓછામાં ઓછી ૪ ઉપરાંત જરૂરિયાત મુજબ
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમ સંગ્રહ - ૧૭ મુજબ મળી શકે

## ૬. ડિસ્પ્લીનરી કમિટી :-

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો
	ડિસ્પ્લીનરી કમિટી
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ
	સંસ્થાના વિધાર્થીઓમાં જરૂરી શિસ્ત જળવાઈ રહે તે માટે જરૂરી હોય ત્યારે શિસ્ત અંગે જરૂરી પગલા લેવા તથા તેને સુચનો, માર્ગદર્શન અને નિર્ણય લેવા માટે આ કમિટીની રચના કરવામાં આવેલ છે.
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની લુભિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	સલાહકાર
૫	માળખું અને સહ્ય બંધારણ
	(૧) ડીનશ્રી, (૨) - (૩) - (૪) - (૫) યુ.જી/પી.જી. હોસ્ટેલના વોર્ડનશ્રી (૬) અન્ય સીનીયર પ્રાણ્યાપક
૬	સંસ્થાના વડા
	ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર.
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડીનશ્રીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	ઓછામાં ઓછી ૨ ઉપરાંત જરૂરિયાત મુજબ
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમસંગ્રહ - ૧૭ મુજબ મળી શકે

## ૭. મહિલા અત્યાચાર વિરોધી કમિટી

૧	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
	સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૨	માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો
	મહિલા અત્યાચાર વિરોધી કમિટી
૩	માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદેશ/મુખ્ય પ્રવૃત્તિઓ
	સંસ્થાની મહિલાઓ તથા વિધાયીનીઓ પર થતા અત્યાચાર સબબ જો કોઈ ફરીયાદો આવેલ હોય તો તે માટે કમિટી યોગ્ય નિર્ણય લઇને જરૂરી પગલા લેવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
૪	માન્યતા પ્રાપ્ત સંસ્થાની લુભિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)
	કાર્યકારી
૫	માળખું અને સહ્ય બંધારણ
	(૧) ચીફ વોર્ડન- ગલ્સ્ (૨) વોર્ડન-ગલ્સ્ (૩) આસી વોર્ડન-ગલ્સ્ (૪) કલીનીકલ વિભાગના પ્રાધ્યાપક (૫) નોન કલીનીકલ વિભાગના પ્રાધ્યાપક
૬	સંસ્થાના વડા
	ડીન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર.
૭	મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં
	ડીનશ્રીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ ભાવનગર.
૮	બેઠકોની સંખ્યા
	ઓછામાં ઓછી ૨ ઉપરાંત જરૂરિયાત મુજબ
૯	શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે?
	ના
૧૦	શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?
	હા
૧૧	બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.
	આર. ટી. આઈ. ના નિયમ મુજબ દસ્તાવેજ માંથી જરૂરી માહિતી નિયમસંગ્રહ - ૧૭ મુજબ મળી શકે

**સરકારી મેડિકલ કોલેજ ભાવનગર**  
**(૧)-લાઇબ્રેરી કમીટી(ધનવંતરી ગુંથાલય)**

ક્રમ	અધિકારીનું નામ	હોક્કો	કચેરીનો ટેલીફોન નંબર કોડ નં- ૦૨૭૮
૧	શ્રી ડૉ. હેમંત મહેતા	ડીન - ચેરમેન	૨૫૧૧૫૧૧ Ext- ૨૦૧
૨	ડૉ. કિઝા લાખાણી	પ્રોફેસર છન્યાર્જ લાયબ્રેરી - સહ પ્રાધ્યાપક મેડિસીન વિ.	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૦૭
૩	શ્રી ડૉ. નીતેશ પારેખ	પ્રાધ્યાપક - ઓફીસલોજુ વિ. ના વડા	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૦૭૬
૪	શ્રી ડૉ. બી. એન. પંચાલ	પ્રાધ્યાપક અને વિભાગના વડા સાયક્યાટ્રી વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૨
૫	શ્રીમતી ડૉ. હિતા મહેતા	પ્રાધ્યાપક-સ્કીન & વી. ડી.	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૬૬
૬	શ્રીમતી એન. એચ. મકવાણી	મદદનીશ ગુંથપાલ ધનવંતરી ગુંથાલય	૨૫૧૧૫૧૧ Ext- ૨૫૦

**Observership to prepare the 2<sup>nd</sup> Line of Library**

૧	શ્રી ડૉ. મેહુલ ગોસાઈ	સહ પ્રાધ્યાપક પીડીયાટ્રીક વિભાગ	૨૪૨૩ ૨૫૦ EXT-૧૧૫૪
૨	શ્રી ડૉ. રાજન સોમાણી	સહ પ્રાધ્યાપક સર્જરી વિભાગ	૨૪૨૩ ૨૫૦ EXT-૧૧૮૪

સરકારી મેડિકલ કોલેજ ભાવનગર

(૨) જાતિય સત્તામણી નિવારણ કમીટી.

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	ફોન નંબર
૧	ડૉ. જીજા દવે	પ્રાધ્યાપક - રેસ્પીરેટરી મેડિસીન	૯૮૨૫૦૯૯૨૮૮
૨	શ્રી ડૉ. અમિત પરમાર	પ્રાધ્યાપક - ફોરેન્સિક મેડિસીન વિ. ના વડા	૯૯૨૫૦૧૧૬૦૮
૩	ડૉ. એન. વી. પારેખ	પ્રાધ્યાપક - ઓફિચિલોજી	૯૪૨૮૪૦૮૭૮૮
૪	ડૉ. જીજા આર. પટેલ	મદદનીશ પ્રાધ્યાપક - ફીજુયોલોજી	૯૪૨૭૦૫૬૨૬૮
૫	ડૉ. કનકલતા ડી. નફુમ	સહ પ્રાધ્યાપક - ગાયનેક વિભાગ	૯૪૨૮૨૨૨૩૬૬
૬	શ્રીમતી લતાબેન શાહ	સામાજિક કાર્યકર	૯૪૨૮૬૪૯૭૩૦
૭	શ્રીમતી જીજાબેન જાની	એલ. એલ. બી	૯૪૨૬૬૪૮૪૩૮

## સરકારી મેડિકલ કોલેજ ભાવનગર

### (૩) એ.ડી.આર. મોનિટરીંગ સેલ (ફાર્માકોવીજુલન્સ સેલ)

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	કચેરીનો ટેલીફોન નંબર કોડ નં- ૦૨૭૮
૧	શ્રી ડૉ. એચ. બી. મહેતા	ચેરમેન - કોઓર્ડિનેટર- ડીન મે. કો. ભાવનગર	૨૫૧૧૫૧૧ Ext- ૨૦૧

#### સભ્યશ્રી

૨	શ્રી ડૉ. વિકાસ સિંહા	તબીબી અધિક્ષક અને પ્રાધ્યાપક ઓટોરીનોલોજી	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૪૬
૩	શ્રી ડૉ. મેહુલ ગોસાઈ	સહ પ્રાધ્યાપક - પીડીયાટ્રીક્સ વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૫૪
૪	શ્રી ડૉ. સમીર. એમ. શાહ	પ્રાધ્યાપક - સર્જરી વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૪
૫	શ્રી. ડૉ. જુજ્ઞાબેન દવે	પ્રાધ્યાપક ટી. બી. & ચેસ્ટ (પલ્બોનરી મેડિસીન) વિ.	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૬૫
૬	શ્રી ડૉ. ગુણવંત કડીકર	પ્રાધ્યાપક, ઓફ્સેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી વિ.	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૩૦
૭	શ્રી ડૉ. ભરત એન. પંચાલ	પ્રાધ્યાપક સાયક્યાટ્રી વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૨
૮	શ્રી ડૉ. હીતા મહેતા	પ્રાધ્યાપક ડી. વી. એલ. વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૦૫૬
૯	શ્રી હર્ષુખ ટી. દવે	પ્રિન્સીપાલ નર્સિંગ કોલેજ ભાવનગર.	૨૫૨૧૫૮૮
૧૦	શ્રી ડૉ. રાજન સોમાણી	એડીશનલ પ્રોફેસર - સર્જરી વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૪
૧૧	શ્રી ડૉ. વીરેન નાયક	સહ પ્રાધ્યાપક - ફાર્માકોલોજી વિભાગ	૨૫૧૧૫૧૧ Ext- ૨૫૪
૧૨	શ્રી ડૉ. વિશાલ વડગામા	મદદનીશ પ્રાધ્યાપક - ફાર્માકોલોજી વિભાગ	૨૫૧૬૫૧૬ Ext- ૨૫૪
૧૩	શ્રી ડૉ. મનિષ બરવાલિયા	મદદ. પ્રાધ્યાપક ફાર્માકોલોજી વિભાગ	૨૫૧૬૫૧૬ Ext- ૨૫૪
૧૪	નર્સિંગ સુપ્રીન્ટેન્ડન્ટ	સર ટી. જનરલ હોસ્પિટલ ભાવનગર	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૬૭
૧૫	શ્રી શોભાબેન પરમાર	ચીફ ફાર્માસીસ્ટ સર ટી. જનરલ હોસ્પિટલ ભાવનગર.	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૨૮૦
૧૬	શ્રી ભાવેશ ચાવડા	ફાર્માકોવીજુલન્સ એસોસીએટ એ.ડી.આર. મોનિટરીંગ સેન્ટર	
૧૭	શ્રી ડૉ. ભાર્ગવ પુરોહિત	સભ્ય સચિવ સહ પ્રાધ્યાપક ફાર્માકોલોજી વિભાગ	૨૫૧૬૫૧૬ Ext- ૨૧૭

**સરકારી મેડિકલ કોલેજ ભાવનગર**

**(૪) - મેડિકલ એઝ્યુકેશન ટેકનોલોજી સેલ**

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	કચેરીનો ટેલીફોન નંબર કોડ નં- ૦૨૭૮
૧	શ્રી ડૉ. એચ. બી. મહેતા	ચેરમેન - ડીન મે. કો. ભાવનગર	૨૫૧૧૫૧૧ Ext- ૨૦૧
૨	શ્રી ડૉ. ચિન્મય શાહ	કો- ઓર્ડિનેટર સહ પ્રાધ્યાપક ફિઝિયોલોજી વિભાગ	૨૫૧૧૫૧૧/૨૫૧૬૫૧૬ Ext- ૨૭૪
૩	શ્રી ડૉ. હીતાબેન મહેતા	પ્રાધ્યાપક, સ્કીન & વી.ડી. (ડીવીએલ) વિ.	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૦૬૬
૪	શ્રી ડૉ. સમીર. એમ. શાહ	પ્રાધ્યાપક - સર્જરી વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૪
૫	શ્રી. ડૉ. જુણાબેન દવે	પ્રાધ્યાપક ટી. બી. & ચેસ્ટ (રેસ્પીરેટરી મેડિસીન) વિ.	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૬૫
૬	શ્રી ડૉ. ગુણવંત કડીકર	પ્રાધ્યાપક - ગાયનેક વિભાગ	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૩૦
૭	શ્રી ડૉ. સુશીલ ઝા	પ્રાધ્યાપક- ઓટોરીનોલેરીનોલોજી	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૪૬
૮	શ્રી ડૉ. સીમા બક્ષી	અધિક પ્રાધ્યાપક-પેથોલોજી	૨૫૧૧૫૧૧ EXT- ૨૬૯
૯	શ્રી ડૉ. કેલેશ ડી. ભાલાણી	સહ પ્રાધ્યાપક- પી.એસ.એમ. વિભાગ	૨૫૧૧૫૧૧ EXT- ૨૪૬
૧૦	શ્રી ડૉ. મેહુલ ગોસાઈ	સહ પ્રાધ્યાપક- પીડીયાટ્રીક વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૫૪
૧૧	શ્રી ડૉ. લોપા ત્રિવેદી	સહ પ્રાધ્યાપક- એનેસ્થેશ્યોલોજી વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૦૩૬
૧૨	શ્રી ડૉ. અશોક યુ. વાળા	સહ પ્રાધ્યાપક- સાયક્યાટ્રીક વિભાગ	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૨
૧૩	શ્રી ડૉ. મનિષ બરવાલીયા	સહ પ્રાધ્યાપક- ફાર્માકોલોજી વિભાગ	૨૫૧૬૫૧૬ Ext- ૨૧૭
૧૪	શ્રી ડૉ. જલદિ પટેલ	ટ્યુટર - ડેન્ટિસ્ટ્રી વિભાગ	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૬૦
૧૫	શ્રી ડૉ. જતીન સરવૈયા	ટ્યુટર - માઇકોબાયોલોજી વિભાગ	૨૫૧૧૫૧૧ EXT- ૨૩૭

સરકારી મેડિકલ કોલેજ ભાવનગાર

(૫) - એન્ટી રેગ્િસ્ટ્રેશન કમીટી

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	ટેલીફોન નંબર
૧	શ્રી ડૉ. એચ. બી. મહેતા	ડીન મે. કો. ભાવનગાર- ચેરમેન	૯૪૨૬૫૦૩૧૪૪
૨	શ્રી જે. જે. રબારી	પી. આઇ. નીલમબાગ પોલીસ સ્ટેશન - સભ્ય	૨૫૨૧૨૫૦/૮૮૭૬૮૫૭૦૫૫
૩	શ્રી હર્ષ સંઘવી	પ્રેસ રિપોર્ટર (લોકલ ન્યુઝ પેપર) - સભ્ય	૮૮૨૫૨૦૪૮૨૦
૪	શ્રી મેહુલ વડોદરીયા	એન.જી.ઓ. - સભ્ય	૮૮૨૫૨૦૫૩૬
૫	શ્રી ડૉ. નીલેશ પારેખ	સભ્ય સચિવ પ્રાધ્યાપક - ઓપેલ્ભોલોજી વિ.	૯૪૨૮૪૦૮૭૮૮
૬	શ્રી એન. એન. સોલંકી	(કચેરી અધિક્ષક) હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ- સભ્ય	૮૦૮૧૧૭૧૭૬૬
૭	શ્રી વિજયાબેન પરમાર	સીટી મામલતદાર- ભાવનગાર - સભ્ય	૭૫૬૭૦૦૧૮૮૭
૮	શ્રી ડૉ. એસ. ઓ. દેથા	કેશર વિદ્યાર્થીના વાલી - સભ્ય	૮૮૮૮૪૧૩૫૬૫
૯	શ્રી યશ દવે	સ્કુલન્ટ- સભ્ય	૭૬૬૦૨૦૭૧૫૭

**સરકારી મેડિકલ કોલેજ ભાવનગાર**  
**( ૬ )- ઇન્સ્ટિટ્યુશનલ એનિમલ એથિક્સ કમિટી**

ક્રમ	અધિકારીનું નામ	હોક્કો	કચેરીનો ટેલીફોન નંબર
૧	શ્રી ડૉ. એચ. બી. મહેતા	ડીન મે. કો. ભાવનગાર -ચેરમેન	૯૪૨૮૫૦૩૧૪૪
૨	શ્રી ડૉ. રામશરણ ગુપ્તા	CPCSEA Nominee, રીસર્ચ સાયન્ટિસ્ટ, વેટરનરી કોલેજ, આણંદ	૯૮૭૯૮૦૭૭૧૮
૩	શ્રી ડૉ. વી. પી. વડોદરીયા	લીંક નોમીની, આણંદ	૯૪૨૬૦૪૭૪૬૩
૪	શ્રી હર્ષલ પરીખ	Non Scientific Socially Aware Person, Ahmedabad	૯૪૨૮૬૧૭૫૨૦
૫	શ્રી ડૉ. દિપક રોહતાણી	ઇન્સ્ટિટ્યુટ ઓફ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી - ગાંધીનગાર	૯૪૦૮૨૭૬૪૮૮
૬	શ્રી ડૉ. પી. આર. ગોળકીયા	વેટરનીટી ડોક્ટર સેન્ટ્રલ એનિમલ હાઉસ મે. કો. ભાવનગાર.	૯૯૭૯૪૩૪૧૦૧
૭	શ્રી ડૉ. મનિષ બર્વાલીયા	Scientist from the institute,	૯૭૨૫૦૨૪૯૭૮
૮	શ્રી ડૉ. ભાગ્યવ પુરોહીત	સહ- પ્રાધ્યાપક ફાર્માંકોલોજી વિભાગ	૯૭૨૫૦૨૪૯૭૮

સરકારી મેડિકલ કોલેજ ભાવનગાર

(૭)- ઇન્સ્ટીટ્યુશનલ રિવ્યુ બોર્ડ

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	કચેરીનો ટેલીફોન નંબર
૧	શ્રી ડૉ. એ. કુમાર	ચેરમેન - ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ- મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગાર	
<u>સભ્યશ્રી</u>			
૨	શ્રી ડૉ. અતુલ ત્રિવેદી	સહ પ્રાધ્યાપક પી.એસ.એમ. વિભાગ	૨૫૧૧૫૧૧ EXT- ૨૪૬
૩	શ્રી ડૉ. વિકાસ સિન્હા	મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ- સર ટી. હે. ભાવનગાર	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૪૯
૪	ડૉ. સુનિલ પંજવાણી	સહ પ્રા. મેડિસીન વિભાગ (ક્લિનીશીયન)	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૦૭
૫	શ્રી ડૉ. ભરત એન. પંચાલ	પ્રાધ્યાપક અને સાયક્લાસ્ટી વિભાગના વડા (ફીલોસોફી)	૨૪૨૩ ૨૫૦ Ext- ૧૧૮૨
૬	શ્રી ડૉ. એચ. બી. મહેતા	પ્રાધ્યાપક અને વિભાગના વડા ફિજુયોલોજી વિ. (Scientist from Instisution)	૨૫૧૧૫૧૧ Ext- ૨૭૬
૭	શ્રી ડૉ. સમીર શાહ	પ્રાધ્યાપક અને વિભાગના વડા સર્જરી વિ. (Scientist from Instisution)	૨૪૨૩ ૨૫૦ EXT-૧૧૮૪
૮	શ્રી નવીનભાઈ રાજ્યગુરુ	કાયદા તજશ અને સામાજિક કાર્યકર	
૯	શ્રી મેહુલ વડોદરીયા	ભૂતપૂર્વ મેયર મ્યુ. કોર્પો. ભાવનગાર	૮૮૨૪૩૦૪૬૩૯
૧૦	ડૉ. કનકલતા ડી. નકુમ	સહપ્રાધ્યાપક ઓ. & જી. ડિપાર્ટમેન્ટ	૨૪૨૩ ૨૫૦ EXT-૧૦૩૦
૧૧	શ્રી મનહરભાઈ મોરી	કોર્પોરિટર મ્યુ. કોર્પો. ભાવનગાર.	૦૨૭૮- ૨૪૨૪૮૦૧
૧૨	શ્રી ડૉ. ભાર્જવ પુરોહિત	સભ્ય સચિવ (ફાર્માકોલોજીસ્ટ) સહ પ્રાધ્યાપક અને વિભાગના વડા ફાર્માકોલોજી વિભાગ મે. કો. ભાવનગાર.	૨૫૧૧૫૧૧ Ext- ૨૦૭

(નિયમ સંગ્રહ- ૬)

સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર

અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી (ડિરેક્ટરી ) વર્ગ -૧ - ૨

સરનામું :- ડીનશ્રીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ, એસ. ટી. સ્ટેન્કની બાજુમાં, જેલ રોડ, ભાવનગર- ૩૬૪૦૦૨

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	કચેરી નો ફોન નંબર કોડ નં. - ૦૨૭૮
૧	૨	૩	૪
૧	ડૉ. એચ. બી. મહેતા	ઇન્યાર્જ ડીન	૨૪૩૦૮૦૮
૨	ડૉ. વિકાસ સિન્હા	તબીબી અધિક્ષક	૨૪૨૩ ૨૫૦
૩	ડૉ. એસ. વી. ગોસાઈ	મેડિકલ ઓફીસર	૨૪૨૩ ૨૫૦

પ્રાણ્યાપક અને વિભાગના વડા

૪	ડૉ. હરીઓમ શર્મા	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૭
૫	ડૉ. ભરત એન. પંચાલ	Psychiatry	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૮૨
૬	ડૉ. એન. વી. પારેમ	Ophthalmology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૭૬
૭	ડૉ. એસ. એમ.પટેલ	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૬
૮	ડૉ. કેરવી દેસાઈ	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૧
૯	ડૉ. સમીર. એમ. શાહ	Surgery	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૮૪
૧૦	ડૉ. જુઝા દવે	Respiratory Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૬૫
૧૧	ડૉ. અમિત પરમાર	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬
૧૨	ડૉ. જે. આર. ગોહિલ	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૧૩	ડૉ. શૈલા એન. શાહ	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૬
૧૪	ડૉ. હિતા મહેતા	Skin & V. D.	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૬૬
૧૫	ડૉ. સુશીલ આ	Otorhinolaryngology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૪૬
૧૬	ડૉ. તેજસ એન. મોદી	Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૧૪

સહ પ્રાણ્યાપક

૧૭	ડૉ અતુલ ત્રિવેદી	Preventive & Social Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૩૩૦
૧૮	ડૉ. વિક્રમ ગોહિલ	General Surgery	૨૫૧૧૫૧૧	EXT- ૩૨૦
૧૯	ડૉ. કે. ડી. નકુમ	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૩૦
૨૦	ડૉ. રજની એમ. પરીખ	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૨૦૩
૨૧	ડૉ. દિપ્તી સી. પરમાર	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૨૦૩
૨૨	ડૉ. ચિન્મય શાહ	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૪
૨૩	ડૉ. સુષ્ઠી રૂપારેલીયા	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૨૪	ડૉ. કે. ડી. ભાલાણી	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬

૨૫	ડૉ. રાજન સોમાણી	Surgery	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૮૪
૨૬	ડૉ. રવિન્દ્ર જીડેજા	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૯
૨૭	ડૉ. એચ. આર. ત્રિવેદી	Ophthalmology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૮૦
૨૮	ડૉ. સીમા બક્ષી	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૨૯	ડૉ. જી. કે. કડીકર	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૩૦
૩૦	ડૉ. પીનાકિન આઈ. વોરા	Orthopedic	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૮૪
૩૧	ડૉ. ભાર્ગવ એમ. પુરોહિત	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૭
૩૨	ડૉ. પ્રજ્ઞેશ એચ. શાહ	Pathology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૪૪
૩૩	ડૉ. એફ. એ. દેખૈયા	Surgery	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૨૩
૩૪	ડૉ. આદૃતી પરમાર	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૩૫	ડૉ. મંજુલા જામલીયા	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૩૬	ડૉ. દેવેન્દ્ર એન. પંચાલ	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬
૩૭	ડૉ. નુતન એન. ગોસ્વામી	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૩૮	ડૉ. જી. એસ. ચૌધરી	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૩૯	ડૉ. મયુરી ટાકર	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૪૦	ડૉ. જીતેન્દ્રકુમાર જી. ચાવડા	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૪૧	ડૉ. લોપા ત્રિવેદી	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	Ext- ૧૦૩૬
૪૨	ડૉ. નિલેષ ડી.પટેલ	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૯
૪૩	ડૉ. અલ્પેશ ગોસ્વામી	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૪૪	ડૉ. અશોક યુ. વાળા	Psychiatry	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૮૨
૪૫	ડૉ. મેહુલ ગોસાઈ	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૪૬	ડૉ. શિલ્પા દોશી	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૩૬
૪૭	ડૉ. અલ્પેશ વોરા	Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૧૪
૪૮	ડૉ. અલ્પા પારેખ	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૮૫
૪૯	ડૉ. ઇલા હડિયલ	Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૧૪
૫૦	ડૉ. કોમલ એસ. શાહ	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	Ext- ૧૦૩૬
૫૧	ડૉ. કિણ્ણા લાખાણી	Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૧૪
૫૨	ડૉ. પ્રતીક તરવાડી	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬

૫૩	ડૉ. નિતેશ બી. જોધી	Radiotherapy		
૫૪	ડૉ. કુનાલ જી. સોલંકી	Radiology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૩૦
૫૫	ડૉ. પલક ટી. હાપાણી	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૫૬	ડૉ. જી. બી. બોરીસાગાર	Respiratory Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૬૪
૫૭	ડૉ. પંકીલ શાહ	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૩૩૭

#### મદદનીશ પ્રાધ્યાપક

૫૮	ડૉ. ઘિરેન અમીન	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૫૯	ડૉ. રાજેન્ઝ કાબરીયા	Mch. MS Uro Surgen (ફિક્સ પે)	૨૪૨૩ ૨૫૦	
૬૦	ડૉ. શિરીષ એમ. પટેલ	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૬૧	ડૉ. સકલેનહૈદર એસ. મલેક	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૬૨	ડૉ. ભાવિન બી પઢારીયા	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૬૩	ડૉ. મિહિર રૂપાણી	PSM	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૦
૬૪	ડૉ. મનિષ બરવાલિયા	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૬૫	ડૉ. ચન્દ્રકા વલ્લભભાઈ ભૂત	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૦
૬૬	ડૉ. વિશાલ વડગામા	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૬૭	ડૉ. આશીષ અનોવાડીયા	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૬૮	ડૉ. ધનશ્યામ આહિર	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૬૯	ડૉ. અશ્વિન મેવાડા	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૭૦	ડૉ. ભારતી કોરીયા	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૭૧	ડૉ. ભારતી સાંસીયા	Pathology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૭૨
૭૨	ડૉ. નીપા આર ગોહિલ	Ophthalmology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૮૧
૭૩	ડૉ. ધારા એચ. પારેખ	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૭૪	ડૉ. તેજશ ધૂંટલા	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૭૫	ડૉ. પાર્થ આર. ગોસ્વામી	Pathology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૭૨
૭૬	ડૉ. મયુરી આર. ગોહિલ	Pathology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૭૨
૭૭	ડૉ. સમીર એચ. પરમાર	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૧
૭૮	ડૉ. ભગીરથ પરમાર	Otorhinolaryngology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૪૬
૭૯	ડૉ. મેધા કાનાણી	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૩૬

૮૦	ડૉ. જીજા આર. પટેલ	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૮૧	ડૉ. બાદલ જોતાણીયા	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૮૨	ડૉ. કમલેશ ટાંક	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૮૩	ડૉ. સ્વર્ણિલ પારલીકર	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૪
૮૪	ડૉ. સ્મિત મહેતા	Surgery	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૨૩
૮૫	ડૉ. અદિતી વિશ્વલ	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૩૬
૮૬	ડૉ. દિપીકા કોળી	Obstetrics & Gynecology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૩૬
૮૭	ડૉ. કિન્ચર એસ. દેસાઈ	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૮૮	ડૉ. જલધી એચ. પટેલ	Dentistry	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૬૦
૮૯	ડૉ. રવિકુમાર પરમાર	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૧
૯૦	ડૉ. પ્રણવ પુનાસનવાલા	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૯૧	ડૉ. હિતેષ એમ. ચૌહાણ	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૯૨	ડૉ. જયેશ ડી. સોલંકી	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૯૩	ડૉ. જલદિપ બી. પટેલ	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૧
૯૪	ડૉ. પુનિત જી. ટાંક	Orthopedic	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૬૪
૯૫	ડૉ. અનિલ આર. પાંડે	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬
૯૬	ડૉ. નીરવ એમ. રાણા	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬
૯૭	ડૉ. અનુપમ બેનજી	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૯૮	ડૉ. દિપીકા સથવારા	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૩૩૭
૯૯	ડૉ. ડી. એમ. રાઠોડ	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૧૦૦	ડૉ. ધારા કે. ગોસાઈ	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૧૦૧	ડૉ. દિપ્તિ એસ. શાહ	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૧૦૨	ડૉ. આરીફ એસ. વોહરા	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪
૧૦૩	ડૉ. દેવલ મહેતા	Respiratory Medicine	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૬૪
૧૦૪	ડૉ. વિલ્યા એ. તજીા	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૧૦૫	ડૉ. વિપુલ વી. સોલંકી	Radiology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૩૦
૧૦૬	ડૉ. સોનુ એલ. લાખાણી	Pediatrics	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૫૪

<u>ટ્યુટર</u>					
૧૦૭	ડૉ. લક્ષ્મી મેર	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬	
૧૦૮	ડૉ. ચૈતાલી શાહ	Anesthesiology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૮૧	
૧૦૯	ડૉ. સ્વાતી એન. મહેતા	Radiology	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૩૦	
૧૧૦	ડૉ. આનંદકુમાર. કે. સિંગ	Pathology	૨૫૧૧૫૧૧	EXT-૨૬૮	
૧૧૧	ડૉ.. હેમાંગોની આર. આચાર્ય	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪	
૧૧૨	ડૉ. હરદેવભાઈ એમ. વાધેલા	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬	
૧૧૩	ડૉ. મેહુલ વી. શનિશ્રા	Physiology	૨૫૧૧૫૧૧	EXT-૨૭૬	
૧૧૪	ડૉ. સમીર એસ. શાહ	Pathology	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮	
૧૧૫	ડૉ. જગૃતી ઘોણકીયા	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૭	
૧૧૬	ડૉ. વી. એ. રામાનુજ	P.S.M.	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬	
૧૧૭	ડૉ. સી. એસ. રાઓલ	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬	
૧૧૮	ડૉ. પુજા ઘોણકીયા	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭	
૧૧૯	ડૉ. નરેન્દ્ર પી. પાટીવાલ	Pharmacology	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪	
૧૨૦	ડૉ. સુયેશ નાગર	Dentistry	૨૪૨૩ ૨૫૦	EXT-૧૧૮૩	
૧૨૧	ડૉ. કોમલ એચ. કલાસવા	Physiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬	
૧૨૨	ડૉ. ફલ્ગુની વી. વોરા	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬	
૧૨૩	ડૉ. હેમાંગ જોખી	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦	
૧૨૪	ડૉ. અપુર્વી દરજી	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦	
૧૨૫	ડૉ. બી. ડી. માર્કુ	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪	
૧૨૬	ડૉ. મંજુ ટી. વાળા	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦	
૧૨૭	ડૉ. ચિરાગી બુમીયા	Anatomy	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૮૧	
૧૨૮	ડૉ. અરૂણ એસ. ચૌહાણ	Anatomy	૨૪૨૩ ૨૫૦	EXT-૧૦૮૧	
૧૨૯	ડૉ. બિના પી. જગદ	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭	
૧૩૦	ડૉ. હિન્દી બી. બારેયા	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૩૩૭	
૧૩૧	ડૉ. રિતેષ ભાભોર	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬	
૧૩૨	ડૉ. મેહુલ આર. પટેલ	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬	

૧૩૩	ડૉ. કીર્તિ એચ. ખરસદીયા	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૩૩૭
૧૩૪	ડૉ. પીયુષ એન. પંચાલ	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૧૩૫	ડૉ. મીના પી. પંચાલ	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬
૧૩૬	ડૉ. અમિત બી. વાકાણી	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૧૩૭	ડૉ. નિલેષ રામાનુજ	Dentistry	૨૪૨૩૨૫૦	EXT- ૧૧૮૩
૧૩૮	ડૉ. સીમા સોલંકી	Anatomy	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૧૩૯	ડૉ. રોનક બી. રામાનુજ	Anesthesiology	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૬૧
૧૪૦	ડૉ. રાજન બી. દેસાઈ	PSM	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૧૪૧	ડૉ. જતીન સરવૈયા	Microbiology	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૧૪૨	ડૉ. અનંત જોશી	Biochemistry	૨૫૧૧૫૧૧	EXT- ૩૩૭
૧૪૩	ડૉ. આર. ડી. વાઘેલા	Forensic Medicine	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬

## વર્ગ- ૩

સરનામું:- ડિનશ્રીની કચેરી સરકારી મેડિકલ કોલેજ, એસ. ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ  
ભાવનગર

૧૪૪	શ્રી જી. બી. કલીવડા	કચેરી અધિક્ષક	૨૫૧૧૫૧૧	EXT-૨૧૦
૧૪૫	શ્રીમતી એન. એ. ભટ્ટ	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૦૯
૧૪૬	શ્રી જી. ડી. ગોહેલ	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૫
૧૪૭	શ્રી નરેશ એન. સોલંકી	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૧૫
૧૪૮	શ્રી એસ. આર. વીરાણી	સીનિયર કલાર્ક	૨૫૧૧૫૧૧	EXT-૨૨૭
૧૪૯	કુ. ધારા એમ. બારૈયા	જુનિયર કલાર્ક	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૨
૧૫૦	કુ. અસ્મિતા આર. બારૈયા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૨
૧૫૧	શ્રી ડી. ડી. પંડ્યા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૦૯
૧૫૨	શ્રી મહાવીરસિંહ ગોહિલ	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૦૯
૧૫૩	શ્રી. ભરતકુમાર એસ. અસારી	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૫
૧૫૪	શ્રી બી. ડી. કોગતીયા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૦
૧૫૫	શ્રી એસ. બી. ગોસ્વામી	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૦
૧૫૬	કુ. દિપીકા એમ. ચાવડા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૭
૧૫૭	શ્રી અશ્રિન જી. ચાવડા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૦૯
૧૫૮	શ્રી નિખીલ એન. વાઘેલા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૦

૧૫૯	કોમલબા જી. વાઘેલા	જનિયર ક્લાર્ક	૨૫૧૧૫૧૧	EXT-૨૨૦
૧૬૦	શ્રી વી. પી. ચુડાસમા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૦૯
૧૬૧	શ્રી સંજય આર. જાની	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૪૪
૧૬૨	શ્રી જયદીપ એલ. ધાંધલ્યા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૧૫
૧૬૩	કુ. દર્શના કે. જાની	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૫૪
૧૬૪	કુ. રીધલ વી. છટાળીયા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૦
૧૬૫	કુ. રેખા બી. રામાણી	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૭
૧૬૬	શ્રી જયદીપ આર. પરમાર	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૩
૧૬૭	કુ. આશા જાની	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૨
૧૬૮	શ્રી અનિરુદ્ધભાઈ મોરી	-"-	૨૪૨૩૨૫૦	EXT-૧૨૦૩
૧૬૯	શ્રી અયુબભાઈ એચ. શેખ	ફાયવર	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૧
૧૭૦	શ્રી આર. બી. ભટ્ટી	ફાયવર	૨૫૧૧૫૧૧	EXT-૨૧૧
૧૭૧	શ્રી એચ. એન. મકવાણી	એસ. આઈ.	૨૫૧૧૫૧૧	EXT-૨૦૬
૧૭૨	શ્રી જી. બી. ઓઝા	લેબ-ટેકનિશિયન	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૧૭૩	શ્રી ડી. ઎ડ. ચુડાસમા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૭
૧૭૪	શ્રી કે. જી. વેગાડ	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૧૭૫	શ્રી બી. એ. જાડેજા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૮૦
૧૭૬	શ્રી રમેશ બી. બારૈયા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૧૬૧
૧૭૭	શ્રી હરેશ બી. હડિયા	-"-	૨૪૨૩૨૫૦	EXT-૧૧૬૨
૧૭૮	શ્રીમતી તૃપ્તિ બી. આસ્તિક	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૧૭૯	કુ. જાન્નિવીબેન જે. સીતાપરા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૭૨
૧૮૦	કુ. જલપાબેન એ. મકવાણી	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૧૮૧	કુ. અનિતા એમ જાવીયા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૧૬૨
૧૮૨	શ્રી મુકેશ. એન. દેવગણિયા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૩૫
૧૮૩	કુ. આરતી પી. રઠોડ	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૧૬૩
૧૮૪	શ્રી એમ. એમ. સેતા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૭૨
૧૮૫	શ્રી મુનિન્દ્ર પી. ઠાકર	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૭૨
૧૮૬	શ્રી લાલજી પી. મકવાણી	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૭૨
૧૮૭	કુ. રેશ્મા આર. ચેલાણી	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૭૨
૧૮૮	શ્રી પ્રકાશ આર. ટાડા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૮
૧૮૯	શ્રી રાજેશ આર. પંડ્યા	લેબ આસિસ્ટન્ટ	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૪૪
૧૯૦	શ્રીમતી પલ્લવી સી.રઠોડ	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૧૬૨
૧૯૧	કુ. દર્શના એ. રાજપુરા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૭૨
૧૯૨	શ્રીમતી હેમંતા એમ. પટેલ	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૬

૧૯૩	કુ. અદિતિ એસ. ચૌહાણ	લેબ આસિસ્ટન્ટ	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૭૨
૧૯૪	કુ. કિંજલ કે. ગોટી	-"-	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૭૨
૧૯૫	શ્રીમતી કે. કે. અન્ધારીયા	-"-	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૩૫
૧૯૬	કુ. પ્રીતિ એમ. માંડલીયા	-"-	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૭૨
૧૯૭	શ્રી. એચ. સી. પંડ્યા	પ્ર્યુઝિયમ ક્યુરેક્ટર	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૨૧
૧૯૮	શ્રીમતી રેખાબેન પંડ્યા	પી. એચ. એન ટ્યુટર	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૧૯૯	શ્રીમતી પી. આર. પરમાર	પી. એચ. એન ટ્યુટર	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૨૦૦	શ્રી મુકેશભાઈ એમ. કટારીયા	હેલ્થ એજ્યુકેટર	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૨૦૧	શ્રી અશફાલ બી. ચૌહાણ	હેલ્થ એજ્યુકેટર	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૨૦૨	શ્રીચેતન કે. જીણક્રા	ઇ.સી.જી. ટેક્નિશિયન	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૧૪
૨૦૩	શ્રીમતી એસ. એસ. ઝાંગરુકીયા	સ્ટાફ નર્સ -NICU	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૧૮૬
૨૦૪	કુ. કિણા એસ. જાની	સ્ટાફ નર્સ -સ્કીન ઓ.પી.ડી.	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૩
૨૦૫	શ્રી મેહુલ કે. ખોડીકાડ	સ્ટાફ નર્સ	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૧૮૬
૨૦૬	કુ. આશા આર. ઠંડ	સ્ટાફ નર્સ	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૧૮૬
૨૦૭	શ્રીમતી અરુણાબેન પી. કાલમા	ફીમેલ હેલ્થ વર્કર	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૨૦૩

## વર્ગ- ૪

૨૦૮	શ્રી એસ. બી. ગઢવી	પદ્ધતાળા	૨૫૧૧૫૧૧	EXT- ૨૦૬
૨૦૯	શ્રી વી. ડી. પડાયા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૨૪
૨૧૦	શ્રી પી. જે. મકવાણા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૨૨
૨૧૧	શ્રી એસ. એ. મીયાવા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૦
૨૧૨	શ્રી. જે. બી. મકવાણા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૫
૨૧૩	શ્રી. એ. એમ. શેખ	-"-	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૩૪
૨૧૪	શ્રી. એમ. શક્તિલ એમ. મન્સુરી	-"-	૨૪૨૪૫૦૦	
૨૧૫	શ્રી એસ. વી. તડવી	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૨૪
૨૧૬	શ્રી દિપક એમ સોલંકી	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૦
૨૧૭	શ્રી બી. ડેડ. વાધેલા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૧૦
૨૧૮	શ્રી આર. જે. ચાવડા	વર્ગ -૪	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૬
૨૧૯	શ્રી વી. બી. મકવાણા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૭
૨૨૦	શ્રી બી. એ. બોરીયા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૪૫
૨૨૧	શ્રી આઈ. ડી. દલ	-"-	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૬૧
૨૨૨	શ્રી એન. બી. ગોડલીયા	-"-	૨૪૨૩ ૨૫૦	EXT- ૧૦૧૪

૨૨૩	શ્રી એમ. ડી. પઠાણ	વર્ગ -૪	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૨૨૪	શ્રી આર. એમ. કારેલીયા	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૮૫
૨૨૫	શ્રી ફરીદભાઈ ઉસ્માનભાઈ ખલીઝા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૭
૨૨૬	શ્રી કે. ડી. પઢીયાર	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૪૫
૨૨૭	શ્રી. એચ. બી. વાળા	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૦૬
૨૨૮	શ્રી લક્ષ્મણભાઈ અસારી	-"-	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૪૬
૨૨૯	શ્રી નયન એલ. સોલંકી	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૭૪
૨૩૦	શ્રી બી. બી. વાઘેલા	સ્વીપર	૨૫૧૧૫૧૧	EXT-૨૨૨
૨૩૧	શ્રીમતી હણીઓબેન જી. શેખ	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૨૨
૨૩૨	શ્રી. પી. કે. ચૌહાણ	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૭૬
૨૩૩	શ્રી પી. વી. રેવર	લેબ. એટેક્નિકલ	૨૪૨૩૨૫૦	EXT- ૧૦૩૫
૨૩૪	શ્રી વાય. જી. શાહ	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૨૩૫	શ્રી બંકુલ બી. પરમાર	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૨૩૬	શ્રી તરુણ કે. રાવલ	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૦૬
૨૩૭	શ્રી સુરેશ એસ. નેયા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૫૪
૨૩૮	શ્રી હરેશ ડી. મકવાણા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૨૩૯	શ્રી ધનેશ એલ. બારડ	એનિમલ એટે.	૨૫૧૧૫૧૧	EXT- ૨૩૭
૨૪૦	શ્રી હરેશ જી. શુક્લ	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૭૬
૨૪૧	શ્રી રમેશ બી. દિહોરા	લેબ. એટેક્નિકલ	૨૫૧૧૫૧૧	EXT- ૨૦૬
૨૪૨	શ્રી મનસુખ બી. સોલંકી	લેબ. એટેક્નિકલ	૨૫૧૧૫૧૧	EXT- ૨૬૭
૨૪૩	શ્રી કે. આર. મંગલસિક્કા	ડીસે. હોલ આસી.	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૨૪૪	શ્રી આર. કે. જોગાઈયા	-"-	૨૫૧૧૫૧૧	EXT- ૨૮૦
૨૪૫	શ્રી મહેન્દ્રભાઈ બી. સોલંકી	-"-	૨૫૧૧૫૧૧	EXT-૨૫૫

## નિયમ સંગ્રહ-૧૦

વિનિમયોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પછતી સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતી  
માસિક મહેનતાણાની રકમ

ક્રમ	કર્મચારી/અધિકારીનું નામ	હોક્કો અને ડીગ્રી	માસિક મહેનતાણુ	વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણુ નક્કી કરવાની કાર્યપદ્ધતી
૧	ડૉ. એચ. બી. મહેતા	ડીન MD Physiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	સરકારશ્રીના નિયમોનુસાર
૨	ડૉ. વિકાસ સિન્હા	તબીબી અધિક્ષક MS. Otorhinolaryngology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૩	ડૉ. એસ. વી. ગોસાઇ	મેડિકલ ઓફીસર	Matrix Level- 12	

### પ્રાદ્યાપક

૪	ડૉ. હરીઓમ શર્મા	Ph.D. Biochemistry	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૫	ડૉ. ભરત એન. પંચાલ	MD Psychiatry	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૬	ડૉ. એન. વી. પારેખ	MS. Ophthalmology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૭	ડૉ. એસ. એમ.પટેલ	MD Anatomy	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૮	ડૉ. કેરવી દેસાઈ	MD Microbiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૯	ડૉ. સમીર. એમ. શાહ	MS. General Surgery	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૦	ડૉ. જીજા દવે	MD Respiratory Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૧	ડૉ. અમિત પરમાર	MD Forensic Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૨	ડૉ. એસ. એન. શાહ	MD Pathology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૩	ડૉ. જી. આર. ગોહિલ	MD Pediatrics	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૪	ડૉ. હિતા મહેતા	MD Skin & V. D.	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૫	ડૉ. સુશીલ આ	MS Otorhinolaryngology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-
૧૬	ડૉ. તેજસ એન. મોદી	MD Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૧૦૦૦૦)P.B.- 4	-"-

### સહ પ્રાદ્યાપક વર્ગ-૧

૧૭	ડૉ. અતુલ ત્રિવેદી	MD Preventive & Social Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૧૮	ડૉ. વિકાસ ગોહિલ	MS. General Surgery	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૧૯	ડૉ. કે. ડી. નક્કમ	MS. Obstetrics & Gynecology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૦	ડૉ. રજની એમ. પરીખ	MS. Obstetrics & Gynecology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-

૨૧	ડૉ. દિપ્તી સી. પરમાર	MS. Obstetrics & Gynecology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૨	ડૉ. રિન્મય શાહ	MD Physiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૩	ડૉ. એસ. રૂપારેલીયા	MD Anatomy	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૪	ડૉ. કે. ડી. ભાલાણી	MD PSM	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૫	ડૉ. રાજન સોમાણી	MS Surgery	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૬	ડૉ. રવિન્દ્ર જાડેજા	MD Microbiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૭	ડૉ. એચ. આર. ત્રિવેદી	MS Ophthalmology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૮	ડૉ. સીમા બક્ષી	MD Pathology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૨૯	ડૉ. જી. કે. કડીકર	MS. Obstetrics & Gynecology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૦	ડૉ. પીનાકીન આઇ. વોરા	MD Orthopedic	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૧	ડૉ. ભાર્ગવ એમ. પુરોહિત	MD Pharmacology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૨	ડૉ. પ્રજ્ઞેશ એચ. શાહ	MD Pathology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૩	ડૉ. એફ. એ. દેસ્કેયા	MD Surgery	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૪	ડૉ. આદૃતી પરમાર	MD Anatomy	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૫	ડૉ. મંજુલા જામલીયા	MD Physiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૬	ડૉ. દેવેન્દ્ર પંચાલ	MD Forensic Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૭	ડૉ. નુતન ગોસ્વામી	MD Pharmacology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૮	ડૉ. જી. એસ. ચૌધરી	MD Anatomy	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૩૯	ડૉ. મયુરી ટાકર	MD Pathology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૦	ડૉ. જીતેન્દ્રકુમાર જી. ચાવડા	MD Pathology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૧	ડૉ. લોપા ત્રિવેદી	MD Anesthesiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૨	ડૉ. નિતેષ ડી.પટેલ	MD Microbiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૩	ડૉ. અલ્પેશ ગોસ્વામી	MD Pathology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૪	ડૉ. અશોક યુ. વાળા	MD Psychiatry	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૫	ડૉ. મેહુલ ગોસાઈ	MD Pediatrics	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૬	ડૉ. શિલ્પા દોશી	MS. Obstetrics & Gynecology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૭	ડૉ. અલ્પેશ વોરા	MD Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૮	ડૉ. અલ્પા. પારેખ	MD Pediatrics	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૪૯	ડૉ. ઇલા હડિયલ	MD Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૫૦	ડૉ. કોમલ એસ. શાહ	MD Anesthesiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૫૧	ડૉ. કિંજા લાખાણી	MD Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૫૨	ડૉ. પ્રતીક તરવાડી	Forensic Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-
૫૩	ડૉ. નિતેષ બી. જોધી	MD Radiotherapy	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦)P.B.- 3	-"-

૫૪	ડૉ. કનાલ જી. સોલંકી	MD Radiology	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦) P.B.- 3	-"-
૫૫	ડૉ. પલક ટી. હાપાણી	MD Pediatrics	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦) P.B.- 3	-"-
૫૬	ડૉ. જી. બી. બોરીસાગર	MD Respiratory Medicine	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦) P.B.- 3	-"-
૫૭	ડૉ. પંકુલ શાહ	MD Biochemistry	૩૭૪૦૦-૬૭૦૦૦ (૬૦૦૦) P.B.- 3	-"-

મ. પ્રા.- વર્ગ-૧

૫૮	ડૉ. ઘિરેન અમીન	MD PSM	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૫૯	ડૉ. રાજેન્ડ્ર કાબરીયા	Mch. MS Uro Surgen	ફીક્સ પગાર ૪૦૦૦	-"-
૬૦	ડૉ. શિરીષ એમ. પટેલ	MD Microbiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૧	ડૉ. સકલેન હૈદર મલેક	MD Microbiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૨	ડૉ. ભાવિન બી. પઢારીયા	MD Pathology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૩	ડૉ. મિહિર રૂપાણી	MD PSM	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૪	ડૉ. મનિષ બરવાલિયા	MD Pharmacology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૫	ડૉ. ચન્દ્રિકા વલ્લભભાઈ ભૂત	MD Anesthesiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૬	ડૉ. વિશાળ વડગામા	MD Pharmacology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૭	ડૉ. આશીષ અનોવાડીયા	MD Pharmacology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૮	ડૉ. ધનશ્યામ આહિર	MD PSM	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૬૯	ડૉ. અશ્વિન મેવાડી	MD Pharmacology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૦	ડૉ. ભારતી કોરીયા	MD PSM	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૧	ડૉ. ભારતી સાંસીયા	MD Pathology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૨	ડૉ. નીપા આર ગોહિલ	MD Ophthalmology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૩	ડૉ. ધારા એચ. પારેખ	MD Anatomy	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૪	ડૉ. તેજશ ધુટલા	MD Physiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૫	ડૉ. પાર્થ આર. ગોસ્વામી	MD Pathology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૬	ડૉ. મયુરી આર. ગોહિલ	MD Pathology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૭	ડૉ. સમીર એચ. પરમાર	MD Anesthesiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૮	ડૉ. ભગીરથ પરમાર	MS Otorhinolaryngology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૭૯	ડૉ. મેધા કનાણી	MS Obstetrics & Gynecology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૦	ડૉ. જીજા આર. પટેલ	MD Physiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૧	ડૉ. બાદલ જોતાણીયા	MD Anatomy	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૨	ડૉ. કમલેશ ટાંક	MD Anatomy	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૩	ડૉ. સ્વર્ણિલ પારલીકર	MD Physiology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૪	ડૉ. સ્મિત મહેતા	MS Surgery	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૫	ડૉ. અદિતી વિઠુલ	MS Obstetrics & Gynecology	૧૫૬૦૦-૩૮૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-

૮૬	ડૉ. દિપીકા કોલ્ટી	MS Obstetrics & Gynecology	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૭	ડૉ. કિન્જર એસ. દેસાઈ	MS Anatomy	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૮	ડૉ. જલધી એચ. પટેલ	MDS Prosthetic Dentistry	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૮૯	ડૉ. રવિકુમાર પરમાર	MD Anesthesiology	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૦	ડૉ. પ્રણાવ પુનાસનવાલા	MD Pediatrics	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૧	ડૉ. હિતેષ એમ. ચૌહાણ	MD Anatomy	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૨	ડૉ. જયેશ ડી. સોલંકી	MD Physiology	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૩	ડૉ. જલદિપ બી. પટેલ	MD Anesthesiology	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૪	ડૉ. પુનિત જે. ટાંક	MS Orthopedic	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૫	ડૉ. અનિલ આર. પાંડે	MD Forensic Medicine	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૬	ડૉ. નીરવ એમ. રાણા	MD Forensic Medicine	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૭	ડૉ. અનુપમ બેનજી	MD PSM	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૮	ડૉ. દિપીકા સથવારા	MD Biochemistry	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૯૯	ડૉ. ડી. એમ. રાહોડ	PSM	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૦	ડૉ. ધારા કે. ગોસાઈ	MD Pediatrics	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૧	ડૉ. દિપ્તી એસ. શાહ	MD Pediatrics	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૨	ડૉ. આરીફ એસ. વોહરા	MD Pediatrics	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૩	ડૉ. દેવલ મહેતા	MD Respiratory Medicine	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૪	ડૉ. વિલ્પા એ. તજા	Ph.D.Msc. Statistics - PSM	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૫	ડૉ. વિપુલ વી. સોલંકી	MD Radiology	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-
૧૦૬	ડૉ. સોનુ એલ. અખંગાણી	MD Pediatrics	૧૫૬૦૦-૩૯૯૦૦ (૭૦૦૦) P.B.- 2	-"-

### ટ્યુટર- વર્ગ- ૨

૧૦૭	ડૉ. લક્ષ્મી મેર	MD Physiology	Matrix Level-9 (a)	-"-
૧૦૮	ડૉ. ચૈતાલી શાહ	MBBS, DA	Matrix Level-9 (a)	-"-
૧૦૯	ડૉ. સ્વાતી એન. મહેતા	MBBS, DMRD	Matrix Level-9 (a)	-"-
૧૧૦	ડૉ. આનંદકુમાર. કે. સિંગા	MBBS Pathology	Matrix Level-9 (a)	-"-
૧૧૧	ડૉ.. હેમાંગીની આર. આચાર્ય	MD Pharmacology	Matrix Level-9 (a)	-"-
૧૧૨	ડૉ. એચ. એમ. વાઘેલા	MD Physiology	Matrix Level-9 (a)	-"-
૧૧૩	ડૉ. મેહુલ વી. શનિશ્વરા	MD Physiology	Matrix Level-12	-"-
૧૧૪	ડૉ. સમીર એસ. શાહ	DCP Pathology	Matrix Level-9 (a)	-"-
૧૧૫	ડૉ. જાગૃતી ધોળકીયા	MD Biochemistry	Matrix Level-9 (a)	-"-
૧૧૬	ડૉ. વી. એ. રામાનુજ	MBBS P.S.M.	Matrix Level-9 (a)	-"-

૧૧૭	ડૉ. સી. એસ. રાઓલ	MBBS Forensic Medicine	Matrix Level-9 (a)	-"-
૧૧૮	ડૉ. પુજા ઘોળકીયા	MD Microbiology	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૧૯	ડૉ. નરેન્દ્ર પી. પાલીવાલ	MD Pharmacology	Matrix Level-9 (a)	-"-
૧૨૦	ડૉ. સુયેશ નાગર	BDS- Dentistry	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૧	ડૉ. કોમલ એચ. કલાસવા	MD Physiology	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૨	ડૉ. ફલગુની વી. વોરા	MBBS - PSM	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૩	ડૉ. હેમંગ જોશી	MD - Anatomy	Matrix Level-9 (a)	-"-
૧૨૪	ડૉ. અપુર્વા દરજી	MBBS Anatomy	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૫	ડૉ. બી. ડી. મારુ	MBBS Anatomy	Matrix Level-9 (a)	-"-
૧૨૬	ડૉ. મંજુ ટી. વાળા	MBBS Anatomy	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૭	ડૉ. રિરાંગી બુમીયા	MBBS Anatomy	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૮	ડૉ. અર્જુણ એસ. ચૌહાણ	MBBS Anatomy	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૨૯	ડૉ. બિના પી. જગડ	MD Microbiology	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૩૦	ડૉ. હિના બી. બારૈયા	Biochemistry	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૩૧	ડૉ. રિતેષ ભાભોર	Forensic Medicine	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૩૨	ડૉ. મેહુલ આર. પટેલ	PSM	એડહોક ₹૩૦૦-૩૪૮૦૦(૫૪૦૦)	-"-
૧૩૩	ડૉ. કીર્તિ એચ. ખરસદીયા	Biochemistry	Matrix Level-9 (a)	-"-
૧૩૪	ડૉ. પીયુષ એન. પંચાલ	Microbiology	Matrix Level-9 (a)	-"-
૧૩૫	ડૉ. મીના પી. પંચાલ	MD Forensic Medicine	Matrix Level-9 (a)	-"-
૧૩૬	ડૉ. અમિત બી. વાકાણી	MD PSM	Matrix Level-9 (a)	-"-
૧૩૭	ડૉ. નિલેષ રામાનુજ	BDS - Dentistry	Matrix Level-9 (a)	-"-
૧૩૮	ડૉ. સીમા સોલંકી	MS Anatomy	Matrix Level-9 (a)	-"-
૧૩૯	ડૉ. રોનક બી. રામાનુજ	MBBS Anesthesiology	Matrix Level-9 (a)	-"-
૧૪૦	ડૉ. રાજન બી. દેસાઈ	PSM	Matrix Level-11	-"-
૧૪૧	ડૉ. જતીન સરવૈયા	Microbiology	Matrix Level-9 (a)	-"-
૧૪૨	ડૉ. અનંત જોશી	Biochemistry	Matrix Level-11	-"-
૧૪૩	ડૉ. આર. ડી. વાધેલા	Forensic Medicine	Matrix Level-9 (a)	-"-

### વર્ગ-૩ વહીવટી સ્ટાફ

૧૪૪	શ્રી જી. બી. કલીવડા	કચેરી અધિક્ષક	Matrix Level-7	-"-
૧૪૫	શ્રીમતી એન. એ. ભણ્ડ	-"-	Matrix Level-7	-"-
૧૪૬	શ્રી જી. ડી. ગોહેલ	-"-	Matrix Level-7	-"-
૧૪૭	શ્રી નરેશ એન. સોલંકી	-"-	Matrix Level-7	-"-

૧૪૮	શ્રી એસ. આર. વીરાણી	સીનિયર કલાર્ક	Matrrix Level-4	-"-
૧૪૯	કુ. ધારા એમ. બારૈયા	જુનિયર કલાર્ક	Matrrix Level-2	-"-
૧૫૦	કુ. અસીતા આર. બારૈયા	-"-	Matrrix Level-2	-"-
૧૫૧	શ્રી ડી. ડી. પંડ્યા	-"-	Matrrix Level-2	-"-
૧૫૨	શ્રી મહાવીરસિંહ ગોહિલ	-"-	Matrrix Level-2	-"-
૧૫૩	શ્રી ભરતકુમાર એસ. અસારી	-"-	Matrrix Level-2	-"-
૧૫૪	શ્રી બી. ડી. કોગતીયા	-"-	Matrrix Level-2	-"-
૧૫૫	શ્રી એસ. બી. ગૌસ્વામી	-"-	Matrrix Level-2	-"-
૧૫૬	કુ. દિપીકા એમ. ચાવડા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૫૭	શ્રી અશ્વિન જી. ચાવડા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૫૮	શ્રી નિખીલ એન. વાઘેલા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૫૯	કોમલબા જી. વાઘેલા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૦	શ્રી વી. પી. ચુડાસમા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૧	શ્રી સંજય આર. જાની	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૨	શ્રી જયદીપ એલ. ધાંધલ્યા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૩	કુ. દર્શના કે. જાની	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૪	કુ. રીધલ વી. ઇટાળીયા	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૫	કુ. રેખા બી. રામાણી	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૬	શ્રી જયદીપ આર. પરમાર	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૭	કુ. આશા જાની	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૮	શ્રી અનિદુષ્ટભાઈ મોરી	-"-	૧૯૯૫૦/- ફિક્સ પગાર	-"-
૧૬૯	શ્રી અયુબભાઈ એચ. શેખ	-"-	Matrrix Level-2	-"-
૧૭૦	શ્રી આર. બી. ભટ્ટી	-"-	Matrrix Level-5	-"-
૧૭૧	શ્રી એચ. એન. મકવાણા	એસ. આઈ.	Matrrix Level-5	-"-
૧૭૨	શ્રી જી. બી. ઓઝા	લેબ-ટેકનિશિયન	Matrrix Level-5	-"-
૧૭૩	શ્રી ડી. ઝેડ. ચુડાસમા	-"-	Matrrix Level-5	-"-
૧૭૪	શ્રી કે. જી. વેગડ	-"-	Matrrix Level-5	-"-
૧૭૫	શ્રી બી. એ. જાડેજા	-"-	Matrrix Level-6	-"-
૧૭૬	શ્રી રમેશ બી. બારૈયા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૭૭	શ્રી હરેશ બી. હડિયા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૭૮	શ્રીમતી તૃપ્તિ બી. આસ્તિક	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૭૯	કુ. જાન્સીબેન જી. સીતાપરા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૦	કુ. જલપાબેન એ. મકવાણા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-

૧૮૧	કુ. અનિતા એમ. જાવીયા	લેબ-ટેકનિશિયન	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૨	શ્રી મુકેશ. એન. દેવગણિયા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૩	કુ. આરતી પી. રાહોડ	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૪	શ્રી એમ. એમ. સેંતા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૫	શ્રી મુનિન્દ્ર પી. ઠાકર	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૬	શ્રી લાલજી પી. મકવાણા	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૭	કુ. રેશ્મા આર. ચેલાણી	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૧૮૮	શ્રી પ્રકાશ આર. ટાઢા	-"-	Matrrix Level-5	-"-
૧૮૯	શ્રી રાજેશ આર. પંડ્યા	લેબ આસિસ્ટન્ટ	Matrrix Level-2	-"-
૧૯૦	શ્રીમતી પલ્લવી સી.રાહોડ	-"-	Matrrix Level-2	-"-
૧૯૧	કુ. દર્શના એ. રાજપુરા	-"-	ફિક્સ પગાર ૧૯૯૫૦/-	-"-
૧૯૨	શ્રીમતી હેમંતા એમ. પટેલ	-"-	ફિક્સ પગાર ૧૯૯૫૦/-	-"-
૧૯૩	કુ. અદિતિ એસ. ચૌહાણ	-"-	ફિક્સ પગાર ૧૯૯૫૦/-	-"-
૧૯૪	કુ. કિંજલ કે. ગોટી	-"-	ફિક્સ પગાર ૧૯૯૫૦/-	-"-
૧૯૫	શ્રીમતી કે. કે. અન્ધારીયા	-"-	Matrrix Level-2	-"-
૧૯૬	કુ. પ્રીતિ એમ. માંડલીયા	-"-	ફિક્સ પગાર ૧૯૯૫૦/-	-"-
૧૯૭	શ્રી એચ. સી. પંડ્યા	મ્યુઝિયમ ક્યુરેક્ટર	Matrrix Level-3	-"-
૧૯૮	શ્રીમતી રેખાબેન પંડ્યા	પી. એચ. એન ટ્યુટર	Matrrix Level-7	-"-
૧૯૯	શ્રીમતી પી. આર. પરમાર	પી. એચ. એન ટ્યુટર	Matrrix Level-7	-"-
૨૦૦	શ્રી મુકેશભાઈ એમ. કટારીયા	હેલ્થ એજ્યુકેટર	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૨૦૧	શ્રી અશાફક બી. ચૌહાણ	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૨૦૨	શ્રી ચેતન કે. જીણાંદ્રા	ઇ.સી.જી. ટેકનિશયન	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૨૦૩	શ્રીમતી એસ. એસ. ઝાંઝરકીયા	સ્ટાફ નર્સ	Matrrix Level-5	-"-
૨૦૪	કુ. કિંજા એસ. જાની	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૨૦૫	શ્રી મેહુલ કે. ખોડીફાડ	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૨૦૬	કુ. આશા આર. ઠંડ	-"-	ફિક્સ પગાર ૩૧૩૪૦/-	-"-
૨૦૭	શ્રીમતી અરુણા પી. કાલમા	ફિમેલ હેલ્થ વર્કર	Matrrix Level-5	-"-

### વર્ગ -૪

૨૦૮	શ્રી એસ. બી. ગઢવી	પદ્ધતિવાળા	Matrrix Level-IS-2	-"-
૨૦૯	શ્રી વી. ડી. પદાયા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૧૦	શ્રી પી. જી. મકવાણા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૧૧	શ્રી એસ. એ. મીયાવા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૧૨	શ્રી જી. બી. મકવાણા	-"-	Matrrix Level-IS-1	-"-
૨૧૩	શ્રી એ. એમ. શેખ	-"-	Matrrix Level-IS-1	-"-

૨૧૪	શ્રી એમ. શક્તિલ એમ. મન્સુરી	પદ્મવાળા	Matrrix Level-IS-1	-"-
૨૧૫	શ્રી એસ. વી. તઠડી	-"-	Matrrix Level-IS-1	-"-
૨૧૬	શ્રી દિપક એમ સોલંકી	-"-	Matrrix Level-IS-1	-"-
૨૧૭	શ્રી બી. ઝેડ. વાધેલા	-"-	Matrrix Level-IS-3	
૨૧૮	શ્રી આર. જે. ચાવડા	૧૦૮ -૪	Matrrix Level-IS-2	-"-
૨૧૯	શ્રી વી. બી. મકવાણા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૦	શ્રી બી. એ. બોરીચા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૧	શ્રી આઈ. ડી. દલ	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૨	શ્રી એન. બી. ગોડલીયા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૩	શ્રી એમ. ડી. પઠાણ	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૪	શ્રી આર. એમ. કારેલીયા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૫	શ્રી એફ. યુ. ખલીફા	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૬	શ્રી કે. ડી. પઢીયાર	-"-	Matrrix Level-IS-2	-"-
૨૨૭	શ્રી એચ. બી. વાળા	-"-	Matrrix Level-IS-1	-"-
૨૨૮	શ્રી લક્ષ્મણભાઈ અસારી	-"-	Matrrix Level-IS-1	-"-
૨૨૯	શ્રી નયન એલ. સોલંકી	-"-	Matrrix Level-IS-1	-"-
૨૩૦	શ્રી બી. બી. વાધેલા	સ્વીપર	Matrrix Level-IS-2	-"-
૨૩૧	શ્રીમતી હાફીજાબેન જે. શેખ	-"-	Matrrix Level-IS-1	-"-
૨૩૨	શ્રી. પી. કે. ચૌહાણ	-"-	Matrrix Level-IS-1	-"-
૨૩૩	શ્રી પી. વી. રેવર	લેબ.એટેક્ન્ટ	Matrrix Level-IS-3	-"-
૨૩૪	શ્રી વાય. જે. શાહ	-"-	Matrrix Level-IS-3	-"-
૨૩૫	શ્રી બુકુલ બી. પરમાર	-"-	Matrrix Level-IS-3	-"-
૨૩૬	શ્રી તરુણ કે. રાવલ	-"-	Matrrix Level-IS-1	-"-
૨૩૭	શ્રી સુરેશ એસ. નૈયા	-"-	Matrrix Level-IS-1	-"-
૨૩૮	શ્રી હરેશ ડી. મકવાણા	-"-	Matrrix Level-IS-1	-"-
૨૩૯	શ્રી ધનેશ એલ. બારડ	-"-	Matrrix Level-IS-1	-"-
૨૪૦	શ્રી હરેશ જે. શુક્લ	-"-	Matrrix Level-IS-1	
૨૪૧	શ્રી રમેશ બી. દિહોરા	-"-	Matrrix Level-IS-1	-"-
૨૪૨	શ્રી મનસુખ બી. સોલંકી	-"-	Matrrix Level-IS-1	-"-
૨૪૩	શ્રી કે. આર. મંગલસિક્કા	ડીસે. હોલ આસી.	Matrrix Level-1	-"-
૨૪૪	શ્રી આર. કે. જોગાડીયા	ડીસે. હોલ આસી.	Matrrix Level-1	-"-
૨૪૫	શ્રી મહેન્દ્રભાઈ બી. સોલંકી	ડીસે. હોલ આસી.	Matrrix Level-IS-3	-"-

પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો  
વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે

ભાવનગર મેડિકલ કોલેજ ૨૦૧૮-૧૯ ને ફાળવેલ અંદાજપત્ર.

ક્રમ	યોજનાનું નામ	પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ	પ્રવૃત્તિના અંતની અંદાજીલ તારીખ	ખર્ચ થયેલ રકમ	કરેલ રકમ (હપ્તાની રકમ)	કાર્યની ગુણવત્તા માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી
૧	૨	૩	૪	૫	૬	૭
		૨૬/૦૪/૧૯૯૫	૫			
૧	એચ.એલ.ટી.- ૧૫ ભાવનગર તબીબી કોલેજ અને હોસ્પિટલોનું વિસ્તરણ	(૧) મેડિકલને લગતું પ્રશિક્ષણ આપી તજ્જો તૈયાર કરવા.  (૨) દર્દીઓને સારી સારવાર આપવી.	૩૧/૦૩/૧૯	૫૮,૭૭,૦૩,૪૬૦	૪ (ચાર) હપ્તા	ડિનશ્રી સરકારી મેડિકલ કોલેજ ભાવનગર

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ લાગુ પડતું નથી  
નીચેના નમૂના મુજબ માહિતી આપો.

- કાર્યક્રમ / યોજનાનું નામ
- કાર્યક્રમ / યોજનાનો સમયગાળો
- કાર્યક્રમનો ઉદેશ
- કાર્યક્રમના ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકો (છેલ્લા વર્ષ માટે)
- લાભાર્થીની પાત્રતા
- લાભ અંગેની પૂર્વ જરૂરિયાતો
- કાર્યક્રમનો લાભ લેવાની પદ્ધતિ
- પાત્રતા નક્કી કરવા અંગેના માપદંડો
- કાર્યક્રમમાં આપેલ લાભની વિગતો (સહાયકીની રકમ અથવા આપવામાં આવેલ અન્ય મદદ પણ દર્શાવવી)
- સહાયકી વિતરણની કાર્યપદ્ધતિ
- અરજી ક્રાંત કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અરજી પત્રકનો નમુનો (લાગુ પડતું હોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શું શું દર્શાવવું તેનો ઉલ્લેખ કરો.)
- બિડાણોની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)
- બિડાણોનો નમુનો
- પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે ક્રાંત સંપર્ક કરવો
- ઉપલબ્ધ નિધિની વિગતો (જિલ્લા કક્ષા પ ટક કક્ષા વગેરે જેવાં વિવિધ સ્તરોએ)

## નીચેના નમુનામાં લાભાર્થીઓની યાદી

ક્રમ નં. કોડ	લાભાર્થીનું નામ	સહાયકીની રકમ	માતા-પિતા વાતી	પસંદગીનો માપદંડ	સરનામું
					જિલ્લો શહેર નગર/ગામ ધર નં
		લાગુ પડતું નથી.			

નીચેના નમુનામાં લાભાર્થીઓની યાદી

ક્રમ નં. કોડ	લાભાર્થીનું નામ	સહાયકીની રકમ	માતા-પિતા વાતી	પસંદગીનો માપદંડ	સરનામું
					જિલ્લો શહેર નગર/ગામ ધર નં
		લાગુ પડતું નથી.			

રાહત માટે નીચેની માહિતી પણ આપવી

આપેલ લાભની વિગત

લાભોનું વિતરણ

નોંધ :-

(૧). સ્કોલરશીપ :-

અત્રેની સંસ્થા સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે યુ. જી. માં અભ્યાસ કરતાં S.C./S.T. તથા S.E.B.C. ના વિદ્યાર્થીઓને સમાજ કલ્યાણ વિભાગ તરફથી નિયત કરવામાં આવેલ આવકના આધારે શિષ્યવૃત્તિની સહાય સમાજકલ્યાણ અધિકારી દ્વારા આપવામાં આવે છે.

(૨). કુડ બીલ :-

અત્રેની સંસ્થા સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે યુ. જી. માં અભ્યાસ કરતાં અને હોસ્પિટમાં રહીને અભ્યાસ કરતાં S.C./S.T. ના વિદ્યાર્થીઓને સમાજકલ્યાણ અધિકારી દ્વારા કુડ બીલની સહાય આપવામાં આવે છે.

તેણે આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો (લાગુ પડતી નથી) નીચેના નમુના મુજબ માહિતી આપો.

- કાર્યક્રમનું નામ
- પ્રકાર (રાહત/પરમિટ/અધિકૃતિ)
- ઉદેશ
- નક્કી કરેલ લક્ષ્યાંક (છેલ્લા વર્ષ માટે)
- પાત્રતા
- પાત્રતા માટેના માપદંડો
- પૂર્વ જરૂરીયાતો
- લાભ મેળવવાની પદ્ધતિ
- રાહત/પરમિટ/અધિકૃતની સમય મર્યાદા
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અરજીનો નમુનો (લાગુ પડતું હોય ત્યાં)
- બીડાણોની યાદી (પ્રમાણપત્રો/દસ્તાવેજો)
- બીડાણોનો નમુનો

( નિયમસંગ્રહ - ૧૪ )

### વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી

વીજાણુરૂપે ઉપલબ્ધ વિવિધ યોજનાઓની માહિતીની વિગતો આપો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર સંસ્થા વિશેની સંક્ષિપ્ત માહિતી ઉપલબ્ધ છે.

કોલેજ વિશેની માહિતી, [www.bvnmedicol.org](http://www.bvnmedicol.org) પરથી મળશે.

## ( નિયમસંગ્રહ - ૧૫ )

માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો.

૧૫.૧ લોકોને માહિતી મળો તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પદ્ધતિઓ અથવા સવલતો જેવી કે,

- કચેરી ગ્રંથાલય
- નોટીસ બોર્ડ
- કચેરીમાં રેકર્ડનું બિરીક્ષણ :- આ કચેરી ખાતે દરેક અધિકારીશ્રી / કર્મચારીઓની અંગત ફાઇલો નોકરીને લગતી સર્વિસ બુકો, પગાર બીલો, લોન અંગેની વિગતો વિગેરે દસ્તાવેજો નિયમિત જાળવવામાં આવે છે. અને જયારે જયારે જે તે અરજદારશ્રી / સરકારશ્રી દ્વારા માંગવામાં આવે ત્યારે આ પદ્ધતિથી પુરુ પાડવામાં આવે છે.
- દસ્તાવેજોની નકલો મેળવવાની પદ્ધતિ :-
- ઉપલબ્ધ મુદ્દીત નિયમસંગ્રહ :- જી.સી.એસ.આર/જી.ટી.આર. તથા અન્ય સરકારી નિયમ સંગ્રહો
- તંત્રની વેબસાઇટ :- [www.bvnmedicol.org](http://www.bvnmedicol.org)

સરકારી માહિતી અપિકારીઓના નામ, હોદ્ડી, અને અન્ય વિગતો જાહેર તંત્રના સરકારી માહિતી અપિકારીઓ, મદદનીશ સરકારી માહિતી અપિકારીઓ અને વિષાળી કાચદારીઓ (એપલેટ) અતા વિકારી વિશેની સંપર્ક માહિતી નીચેના નમુનામાં આપ્યે.

સરકારી તંત્રનું નામ :- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

મદદનીશ સરકારી માહિતી અપિકારીઓ : - ૦૧

અનુંન	નામ	હોદ્ડી	એસ.ટી.ડી. ક્રોડ	ફોન નંબર		ફેક્સ	ઇ-મેઈલ	સરનામું
				ક્રેટી	ધર			
૧	પ્રથમ અપીલ અપિકારી મહેતા	શ્રી દૉ. એચ. બી. અપીલેટ અપિકારી અને દીજા સરકારી મેડિકલ બોલેજ, ખાવનગર	૦૨૭૮ ૨૪૩૦૮૦૮	૨૪૩૦૮૦૮ -	-	૨૪૨૨૦૧૧	ઇમેઈલ : <a href="mailto:dean.health.bhavnagar@gmail.com">dean.health.bhavnagar@gmail.com</a>	ડીનશ્રીની ક્રેટી સરકારી મેડિકલ બોલેજ એસ. ટી. સેટેકની બાજુમા, જેલ રોડ, ખાવનગર-૩૬૪૦૦૨
૨	જાહેર માહિતી અપિકારી સરવૈચા	શ્રી દૉ. જટીન લ્યુટર માઇક્રોયોલોજ વિભાગ, સરકારી મેડિકલ બોલેજ, ખાવનગર	૦૨૭૮ ૨૫૧૧૫૧૧/ ૨૫૧૧૫૧૬	૨૪૩૦૮૦૮/ ૨૫૧૧૫૧૧/ ૨૫૧૧૫૧૬	-	૨૪૨૨૦૧૧	<a href="mailto:gmcb.rti2005@gmail.com">gmcb.rti2005@gmail.com</a>	ડીનશ્રીની ક્રેટી સરકારી મેડિકલ બોલેજ એસ. ટી. સેટેકની બાજુમા જેલ રોડ ખાવનગર-૩૬૪૦૦૨
૩	મદદનીશ જાહેર માહિતી અપિકારી કલીવડા	શ્રી ઝે. બી. ઇન્ડ્યાર્જ વહીવટી અપિકારી સરકારી મેડિકલ બોલેજ, ખાવનગર	૦૨૭૮ ૨૫૧૧૫૧૧ /Ext. -૨૧૦	૨૫૧૧૫૧૧ -	-	૨૪૨૨૦૧૧	<a href="mailto:gmcb.ao@gmail.com">gmcb.ao@gmail.com</a>	ડીનશ્રીની ક્રેટી સરકારી મેડિકલ બોલેજ એસ. ટી. સેટેકની બાજુમા જેલ રોડ ખાવનગર-૩૬૪૦૦૨

- : માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ :-

## સરકારી મ૆ડિકલ કોલેજ ભાવનગર ના જાહેર માહિતી અધિકારી/મદદનીશ જાહેર માહિતી અધિકારી એપ્લેટ

### ઓથ્રોરીની વિગત દર્શાવતું પત્રક

ક્રમ	પદ્ધતીક ઓથ્રોરી	જાહેર માહિતી અધિકારી (પી.આઇ.ଓ.) નામ/હોદ્દી (કેરેન્ન નામ/કોણ નંબર)	વિષય/કામગીરી નંબર/ફેક્સ નંબર/ઇ-મેઇલ એડ્રેસ)	સંબંધિત અધિકારી (એ.પી.આઇ.ଓ.) નો હોદ્દી (કોરેરીનું નામ/સરનામું/કોણ નંબર/ફેક્સ નંબર/ઇ-મેઇલ એડ્રેસ)	મદદનીશ જાહેર માહિતી અધિકારી (એ.પી.આઇ.ଓ.) નો હોદ્દી (કોરેરીનું નામ/સરનામું/કોણ નંબર/ઇ-મેઇલ એડ્રેસ)	એપ્લેટ ઓથ્રોરીનીનું નામ/હોદ્દી (કેરેરીનું સરનામું/કોણ નંબર/ફેક્સ નંબર/ઇ-મેઇલ એડ્રેસ)
૧	ડીનશ્રીની કેરેરી, સરકારી મ૆ડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં, જોલ રોડ, ભાવનગર ક્રીન નંબર- (૦૨૭૮) ૨૫૧૧૫૧૧, ૨૫૧૫૧૯	નામ:-શ્રી ડૉ. જલદીન સરવૈયા હોદ્દી:- ટ્યુટર, માઇકોબ્યોલોજ વિલાગ સરનામું:- સરકારી મ૆ડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં, જોલ રોડ, ભાવનગર ક્રીન નંબર- (૦૨૭૮) ૨૫૧૧૫૧૧, ૨૫૧૫૧૯ ઇન્ટર કોમ નં- ૨૧૫ ફેક્સ નં- (૦૨૭૮)૨૪૨૨૦૧૧ ઇ-મેઇલ એડ્રેસ:- <a href="mailto:gmcb.ao@gmail.com">gmcb.ao@gmail.com</a>	વિદ્યાશાળી અનુંચેલી માહિતી તેમજ તેમજ ટીચિંગ સ્ટાફના પ્રશ્નો તેમજ તેને લગતી સેવા વિષયક માહિતી ક્રીન નંબર- (૦૨૭૮) ૨૫૧૧૫૧૧, ૨૫૧૫૧૯ ઇન્ટર કોમ નં- ૨૧૫ ફેક્સ નં- (૦૨૭૮)૨૪૨૨૦૧૧ ઇ-મેઇલ એડ્રેસ:- <a href="mailto:gmcb.ao@gmail.com">gmcb.ao@gmail.com</a>	નામ:-શ્રી ડૉ. એચ. બી. મહેતા હોદ્દી:- ઇન્સ્યાઈ ડીન (પ્રાચ્યાપક અને ફીજીયોલોજ વિભાગના વડા) સરનામું:- સરકારી મ૆ડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં, જોલ રોડ, ભાવનગર (૦૨૭૮) ૨૪૩૦૮૦૮ ક્રીન નં- (૦૨૭૮)૨૪૨૨૦૧૧ ઇ-મેઇલ એડ્રેસ:- <a href="mailto:dean.health.bhavnagar@gmail.com">dean.health.bhavnagar@gmail.com</a>	નામ/હોદ્દી નામ/હોદ્દી નામ/હોદ્દી	

( નિયમસંગ્રહ -૧૭ )

અન્ય ઉપયોગી માહિતી

૧૭.૧	લોકો દ્વારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો	
૧૭.૨	માહિતી મેળવવા અંગે.	
	અરજુપત્રક (સંદર્ભ માટે ભરેલા અરજુ પત્રકની નકલ)	સામેલ છે. નમુનો (૫) પાન નં ૧૦૫
	ફી	ફી રૂપિયા ૨૦ (વીસ)
	માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તે અંતર્ગત નાગરિકનો અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી.	માહિતી મેળવવા માટે સહાયક માહિતી અધિકારીનો સંપર્ક સાધી, રજુઆત કરી અરજુ કરવી.
૧૭.૩	<p>તંત્ર દ્વારા લોકોને અપાતી તાલીમની બાબતમાં:-</p> <ul style="list-style-type: none"> <li>• તાલીમ કાર્યક્રમ/યોજનાની મુદ્દત</li> <li>• તાલીમનો ઉદ્દેશ</li> <li>• ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકો (છેલ્લુ વર્ષ)</li> <li>• તાલીમ માટેની પાત્રતા</li> <li>• તાલીમ માટેની પૂર્વ જરૂરીયાતો (જો કોઈ હોય તો)</li> <li>• નાણાકીય તેમજ અન્ય પ્રકારની સહાય (જો કોઈ હોય તો)</li> <li>• સહાયની વિગત (નાણાકીય સહાયની રકમ જો હોય તો જણાવો)</li> <li>• સહાય આપવાની પદ્ધતિ</li> <li>• અરજુ કરવા માટે સંપર્ક માહિતી</li> <li>• અરજુ ફી (લાગુ પડતું હોય ત્યાં)</li> <li>• અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)</li> <li>• અરજુ ફોર્મ (જો અરજુ સાદા કાગળ પર કરવામાં આવી હોય તો</li> </ul>	<p>(૧) એમ.બી.બી.એસ.</p> <p>એડમીશન બી.જે.મેડિકલ કોલેજ, એડમીશન સેલ અમદાવાદ.</p> <p>ધોરણ - ૧૨ સાયન્સ પાસ મેરીટના આધારે કરવામાં આવે છે.</p> <p>ફી રૂ:૨૫૦૦૦</p> <p>(૨) એમ.ડી</p> <p>એડમીશન સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર જે તે કોલેજમાં એમ. બી. બી. એસ થર્ડ ઇયર પાસ કરેલ, મેરીટના આધારે કરવામાં આવે છે.</p> <p>ફી તરીકે એક માસનું સ્ટાઇપેન્ડ જમા કરવાનું હોય છે. તથા ટ્યુશન ફી-૩૦,૦૦૦.</p> <p>(૩) ડી.એમ.એલ.ટી</p> <p>એડમીશન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર બી.એસ.સી. કેમેસ્ટ્રી.ફીજુયોલોજી, પાસ હોય તેવા મેરીટ ના આધારે કરવામાં આવે છે.</p> <p>કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.</p>

	<p>અરજદારે પૂરી પાડવાની વિગતો જણાવો)</p> <ul style="list-style-type: none"> <li>• બિડાણો/દસ્તાવેજોની યાદી</li> <li>• બિડાણો/દસ્તાવેજોનો નમુનો</li> <li>• અરજુ કરવાની કાર્યપદ્ધતિ</li> <li>• પસંદગીની કાર્યપદ્ધતિ</li> <li>• તાલીમ કાર્યક્રમનું સમયપત્રક (જો ઉપલબ્ધ હોય તો)</li> <li>• તાલીમના સમયપત્રક અંગે તાલીમાર્થાને જાણ કરવાની પદ્ધતિ</li> <li>• તાલીમ કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતા લાવવા માટે જાહેર તંત્રએ કરવાની વ્યવસ્થા</li> <li>• છુલ્લા કક્ષા, તાલુકા કક્ષા, એમ વિવિધ સ્તરે</li> <li>• તાલીમ કાર્યક્રમના હિતાધિકારીઓની યાદી</li> </ul>	
૧૭.૪	<p>નિયમસંગ્રહ- ૧૩ માં સમાવિષ્ટ ન કરાયેલ હોય તેવા, જાહેર તંત્રએ આપવાનાં પ્રમાણપત્રો, ના- વાંધા પ્રમાણપત્ર</p> <ul style="list-style-type: none"> <li>• પ્રમાણપત્ર અને ના-વાંધા પ્રમાણપત્રના નામ અને વિવરણ</li> <li>• અરજુ કરવા માટેની પાત્રતા</li> <li>• અરજુ કરવા માટેની સંપર્ક માહિતી</li> <li>• અરજુ ફી (લાગુ પડતું હોય ત્યા)</li> <li>• અન્ય ફી (લાગુ પડતું હોય ત્યા)</li> <li>• અરજુ ફોર્મ (જો અરજુ સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પૂરી પાડવાની વિગતો જણાવો)</li> <li>• બિડાણો/દસ્તાવેજોની યાદી</li> <li>• બિડાણો/દસ્તાવેજોના નમુના</li> <li>• અરજુ કરવાની પદ્ધતિ</li> <li>• અરજુ કર્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા</li> <li>• પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે</li> </ul>	લાગુ પડતું નથી.

	<p>લાગતો સમય</p> <ul style="list-style-type: none"> <li>પ્રમાણપત્રનો કાયદેસરનો સમયગાળો</li> <li>નવીનીકરણ માટેની પ્રક્રિયા (જો હોય તો)</li> </ul>	
૧૭.૫	<p>નોંધણી પ્રક્રિયા અંગે</p> <ul style="list-style-type: none"> <li>ઉદેશ</li> <li>નોંધણી માટેની પાત્રતા</li> <li>પુર્વ જરૂરિયાતો (જો હોય તો)</li> <li>અરજુ કરવા માટે સંપર્ક માહિતી</li> <li>અરજુ ફી (લાગુ પડતું હોય ત્યાં)</li> <li>અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)</li> <li>અરજુનો નમુનો (અરજુ સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો દર્શાવો)</li> <li>બિડાણ/દસ્તાવેજોની ચાદી</li> <li>બિડાણ/ દસ્તાવેજોનો નમુનો</li> <li>અરજુની પદ્ધતિ</li> <li>અરજુ કર્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા</li> <li>નોંધણીની કાયદેસરતાનો ગાળો (જો લાગુ પડતું હોય તો)</li> <li>નવીનીકરણની પ્રક્રિયા (જો હોય તો)</li> </ul>	નવીનીકરણની પ્રક્રિયા તથા નોંધણીની પ્રક્રિયા આ સંસ્થા ખાતે અસ્તિત્વમાં નથી.
૧૭.૬	<p>જાહેર તંત્રે કર ઉઘરાવવા અંગે (મ્યુનિસિપલ કોર્પોરેશન, વ્યવસાયવેરો, મનોરંજન વેરો વગેરે)</p> <ul style="list-style-type: none"> <li>વેરાનું નામ અને વિવરણ</li> <li>વેરો લેવાનો હેતુ</li> <li>કર નિર્ધારણ માટેની કાર્યવાહી અને માપદંડ</li> <li>મોટા કસુરદારોની ચાદી</li> </ul>	આ મુજબનો કોઈ કર આ સંસ્થા હસ્તક ઉઘરાવવામાં આવતો નથી.
૧૭.૭	<p>વીજળી/પાણીનાં હંગામી અને કાયમી જોડાણો આપવા અને કાપવા અંગે. (આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન/નગરપાલિકા/યુપીસીએલ ને લાગુ પડશે)</p>	

	<ul style="list-style-type: none"> <li>• જોડાણ માટેની પાત્રતા</li> <li>• પૂર્વ જરૂરીયાતો (જો હોય તો)</li> <li>• અરજુ માટેની સંપર્ક માહિતી</li> <li>• અરજુ ફી (લાગુ પડતુ હોય ત્યાં)</li> <li>• અન્ય ફી / શુલ્ક (લાગુ પડતુ હોય ત્યાં)</li> <li>• અરજુનો નમુનો (જો અરજુ સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પૂરી પાડવાની વિગતો જણાવો)</li> <li>• બિડાણો/દસ્તાવેજોનો નમુનો અરજુ કરવાની પદ્ધતિ</li> <li>• અરજુ કર્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા</li> <li>• બિલમાં વાપરેલ શબ્દ પ્રયોગોનું ટુંકું વિવરણ</li> <li>• બિલ અથવા સેવાની બાબતમાં મુશ્કેલી હોય તો સંપર્ક માહિતી</li> <li>• ટેરીફ અને અન્ય ખર્ચ</li> </ul>	
૧૭.૮	જાહેર તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત	લાગુ પડતુ નથી

નમુનો -ક

(જુઓ નિયમ ૩ (૧))

માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો  
આઈ. ડી. કમાંક.  
(કચેરીના ઉપયોગ માટે)

પ્રતિ,  
જાહેર માહિતી અધિકારી,  
સરકારી મેડિકલ કોલેજ  
એસ. ટી. સ્ટેન્ડની બાજુમા, જેલ રોડ,  
ભાવનગર.

હું, માહિતીનો અધિકાર અધિનિયમ- ૨૦૦૫ હેઠળ આપની પાસેથી નીચેની માહિતી મેળવવા માંગુ છું.  
તેની વિગતો નીચે મુજબ છે.

૧. અરજદારનું નામ : .....

૨. અરજદારનું પૂર્ક સરનામું : .....

૩. જરૂરી માહિતી ની વિગતો (દુંકમાં) : જરૂરી માહિતીનો ચોક્કસ સમય ગાળો  
(૧)

(૨)

(૩)

૪. \* (૧) મેં .....વિભાગ/કચેરીમાં તારીખ: .....ના રોજ પહોંચ કમાંક:..... થી  
કૃ: ..... શબ્દોમાં રૂપિયા.....ની અરજી ફી ચુકવેલ છે.

\* (૨) હું આ સાથે અરજી ફી પેટે કોસ કરેલ ડિમાન્ડ ડ્રાફ્ટ/પે-ઓર્ડર/ભારતીય પોસ્ટલ ઓર્ડરનું બિડાણ કરું છું.  
તેની વિગત નીચે મુજબ છે.

- ડિમાન્ડ ડ્રાફ્ટ/પે-ઓર્ડર/ભારતીય પોસ્ટલ ઓર્ડરનો નંબર .....તારીખ.....

- બેન્ક/પોસ્ટ ઓફિસનું નામ અને સ્થળ.....

- રકમ રૂપિયા.....

- કોની તરફેણમાં (૧) 'ગુજરાત સરકાર' અથવા (૨) ..... (સરકારી વિભાગ/  
કચેરી સિવાયના જાહેર સત્તામંડળનું નામ નિર્દિષ્ટ કરવું)

\* (૩) આ અરજી ઉપર કૃ:.....ની નોન જયુડીશિયલ સ્ટેમ્પ/કોર્ટ ફી સ્ટેમ્પ/  
રેવન્યુ સ્ટેમ્પ ચોટાડેલ છે.

\* (૪) મેં તારીખ ..... ના ચલણથી .....

(બેંક, શાખા, સ્થળનું નામ જણાવવું) ખાતે અરજી ફી ભરેલ છે, જે આ સાથે અસલમાં બીડેલ છે.

- \* (૫) મે ૩.૨૦/- ના નોન જ્યુડિશિયલ સેમ્પ પેપર પર અરજી કરી હોવાથી અલગાથી ફી ભરેલ નથી.
- \* (૬) હું, આથી જાહેર કરું છું કે તારીખ ..... ના રોજ ગરીબી રેખા હેઠળના કુટુંબનો છું અને મે આ સાથે ગરીબી રેખા હેઠળના કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ/ખરી નકલ અથવા ગરીબી રેખા હેઠળના કુટુંબના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ /ખરી નકલ બિડેલ છે. તેથી મેં અરજી ફી ભરી નથી.

૫. હું, આથી જાહેર કરું છું કે હું ભારતનો નાગરિક છું.

૬. હું, આથી જણાવું છું કે માંગવામા આવેલી માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, ૨૦૦૫ ની ૮ અથવા ૯ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપના વિભાગ/કચેરીને લગતી છે.

સ્થળ :

તારીખ :

અરજદારની સહી:-

ઈ-મેઇલ એડ્રેસ, જો હોય તો :

ટેલીફોન નં. (કચેરી):

તા.ક. : ગરીબી રેખા હેઠળની વ્યક્તિએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેશે નહીં.

\* લાગુ પડતું ન હોય તે ચેકી નાંખવું.

નમુનો - ચ  
(જુઓ નિયમ ૬ (૧))  
પ્રથમ અપીલનો નમુનો  
(કચેરીના ઉપયોગ માટે)

પ્રતિ,  
પ્રથમ અપીલ સત્તાધિકારી અને ડીન,  
સરકારી મેડિકલ કોલેજ એસ. ટી. સ્ટેન્ડની બાજુમા,  
જૈલ રોડ, ભાવનગર.

શ્રીમાન,

મને કોઇ નિર્ણય મળ્યો ન હોવાથી / હું જહેર માહિતી અધિકારીના તારીખ ..... ના નિર્ણયથી નારાજ  
હોવાથી, માહિતીનો અધિકાર અધિનિયમ- ૨૦૦૫ ની કલમ- ૧૮ (૧) હેઠળ હુંથી, આ પ્રથમ અપીલ દાખલ કરું છું. મારી  
અપીલથની વિગતો નીચે મુજબ છે.

૧. અપીલ કરનારનું નામ : .....
  ૨. અરજદાર બી.પી.એલ. વર્ગમાં આવે છે કે કેમ ? હા/ના .....
  ૩. અપીલ કરનારનું પ્રેરણ સરનામું : .....
  ૪. (ક) જહેર માહિતી અધિકારીનું નામ .....  
(ખ) જહેર સત્તામંડળ/વિભાગ/કચેરીનું નામ અને સરનામું : .....  
.....  
(ગ) જ નિર્ણયની સામે અપીલ કરી હોય તે નિર્ણયના કમાંક અને તારીખ સહિત  
એવા નિર્ણયની વિગતો .....  
.....
  ૫. જહેર માહિતી અધિકારીને માહિતી માંગતી અરજી કર્યાની તારીખ: .....
  ૬. માહિતીની વિગત  
(૧). માંગવામાં આવેલી માહિતીની વિગત :- .....  
(૨). માંગવામાં આવેલી માહિતીનો સમયગાળો :- .....
  ૭. જહેર માહિતી અધિકારીને અરજી રજૂ કર્યા પછી ત્રીસ દિવસ પૂરા થતા હોય તે તારીખ: .....
  ૮. અપીલ માટેના કારણો: .....  
(ક) જહેર માહિતી અધિકારીને અરજી રજૂ કર્યાના ત્રીસ દિવસની અંદર કોઇ નિર્ણય મળેલ નથી (.....)  
(ખ) જહેર માહિતી અધિકારીના તા. ..... ના નિર્ણયથી નારાજ હોવાથી .....  
(ગ) .....  
.....
  ૯. અપીલ માટેનું કારણ :- .....
  ૧૦. અપીલ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ :- .....
  ૧૧. દરાવેલી સમય મર્યાદા પછી અપીલ દાખલ કરવામાં વિલંબ થયેલ હોય તો તે માટેના કારણો દર્શાવવા:-  
.....
  ૧૨. જેના માટે વિનંતી કરી હોય/દાદ માંગવામાં આવી હોય તે :- .....  
ખરાઇ:- હું આથી જણાવું છું કે ઉપર આપેલી માહિતી અને વિગતો મારી જાણ અને માનવા મુજબ સાચી છે.
- સ્થળ: ..... અપીલ કરનારની સહી: .....  
તારીખ: ..... સરનામું: .....  
મોબાઇલ નંબર: - .....

# Gujarat State RTI Annual Return Information System(RTI 2005 Act )

## Annual Return Form Year : 2006-2007

**Public Authority: Health & Family Welfare**

**Year : 2006-2007**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2006-2007					
	Opening Balance as on 01/04/06	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	1	NIL	NIL	1
First Appeals	NIL	NIL	NIL	NIL	NIL

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
0			NIL				Levied Total	Collected NIL						

# Gujarat State RTI Annual Return Information System(RTI 2005 Act )

## Annual Return Form Year : 2007-2008

**Public Authority: Health & Family Welfare**

**Year : 2007-2008**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2007-2008					
	Opening Balance as on 01/04/07	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	53	NIL	NIL	53
First Appeals	NIL	NIL	NIL	NIL	NIL

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOS designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
80			NIL				Levied Total	Collected NIL						

# Gujarat State RTI Annual Return Information System(RTI 2005 Act )

## Annual Return Form Year : 2008-2009

**Public Authority: Health & Family Welfare**

**Year : 2008-2009**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2008-2009					
	Opening Balance as on 01/04/08	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	18	NIL	NIL	18
First Appeals	NIL	1	NIL	NIL	1

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOS designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
NIL			NIL				Levied	Total	Collected					
									NIL					

# Gujarat State RTI Annual Return Information System(RTI 2005 Act )

## Annual Return Form Year : 2009-2010

**Public Authority: Health & Family Welfare**

**Year : 2009-2010**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2009-2010					
	Opening Balance as on 01/04/09	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	65	NIL	NIL	65
First Appeals	NIL	1	NIL	NIL	1

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOS designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)												Sections		
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
1215			NIL				Levied Total	Collected NIL						

# Gujarat State RTI Annual Return Information System(RTI 2005 Act )

## Annual Return Form Year : 2010-2011

**Public Authority: Health & Family Welfare**

**Year : 2010-2011**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2010-2011					
	Opening Balance as on 01/04/10	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	52	NIL	NIL	52
First Appeals	NIL	04	NIL	NIL	04

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOS designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
1244			38				Levied Total      Collected 1282							

**Gujarat State RTI Annual Return Information System (RTI 2005 Act )**  
**Annual Return Form Year : 2011-2012**

**Public Authority: Health & Family Welfare**

**Year : 2011-2012**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2011-2012					
	Opening Balance as on 01/04/11	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	46	NIL	NIL	46
First Appeals	NIL	26	NIL	NIL	26

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
300			560				Levied Total      Collected 860							

**Gujarat State RTI Annual Return Information System (RTI 2005 Act )**  
**Annual Return Form Year : 2012-2013**

**Public Authority: Health & Family Welfare**

**Year : 2012-2013**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2012-2013					
	Opening Balance as on 01/04/12	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	53	NIL	NIL	53
First Appeals	NIL	08	NIL	NIL	08

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOS designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
600							Levied Total	Collected 1412						

**Gujarat State RTI Annual Return Information System (RTI 2005 Act )**  
**Annual Return Form Year : 2013-2014**

**Public Authority: Health & Family Welfare**

**Year : 2013-2014**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

<b>Progress in 2013-2014</b>					
	<b>Opening Balance as on April 1st</b>	<b>Received duration period (including transferred to other Public Authority)</b>	<b>No. of cases transferred</b>	<b>Decisions where requests/appeals rejected</b>	<b>Decisions where requests/appeals accepted</b>
<b>Requests</b>	NIL	63	NIL	NIL	63
<b>First Appeals</b>	NIL	07	NIL	NIL	07

<b>No. of cases where disciplinary action taken against any officer</b>	NIL
---	-----

<b>No. of APIOs designated</b>	<b>No. of PIOS designated</b>	<b>No. of AAs designated</b>
1	1	1

<b>No. of times various provisions were invoked while rejecting requests</b>														
<b>Relevant sections of RTI Act 2005</b>														
<b>Section 8 (1)</b>										<b>Sections</b>				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
<b>Amount of Charges Collected (in Rs.)</b>														
<b>Registration Fee Amount</b>			<b>Addition Fee &amp; Any other charges</b>				<b>Penalties Amount</b>							
440			828				Levied - Total -							

**Gujarat State RTI Annual Return Information System (RTI 2005 Act )**  
**Annual Return Form Year : 2014-2015**

**Public Authority: Health & Family Welfare**

**Year : 2014-2015**

**Medical College Bhavnagar**

**Insert Mode(New Return)**

Progress in 2014-2015					
	Opening Balance as on April 1st	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted
Requests	NIL	72	NIL	NIL	72
First Appeals	NIL	16	NIL	NIL	16

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
150			521				Levied - Total - Collected -							

**Gujarat State RTI Annual Return Information System (2005-2007)**  
**Annual Return Form Year : 2015-2016**

**Public Authority: Office of the Dean, Govt. Medical College, Bhavnagar**  
**Year : 2015-2016**

**Insert Mode (New Return)**

Progress in 2015-2016					
	Opening Balance as on April 1st	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted *Including partially rejected cases
Requests	NIL	68	01	02	65
First Appeals	NIL	14	NIL	NIL	14

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
1	1	1

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	02	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
60			786				Levied - Total - Collected -							

**Gujarat State RTI Annual Return Information System (2005-2007)**  
**Annual Return Form Year : 2016-2017**

**Public Authority: Office of the Dean, Govt. Medical College, Bhavnagar**  
**Year : 2016-2017**

**Insert Mode (New Return)**

Progress in 2016-2017					
	Opening Balance as on April 1st	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted *Including partially rejected cases
Requests	00	45	04	01	40
First Appeals	00	07	NIL	NIL	07

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
01	01	01

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	01	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
90			662				Levied - Total - Collected -							

**Gujarat State RTI Annual Return Information System (2005-2007)**  
**Annual Return Form Year : 2017-2018**

**Public Authority: Office of the Dean, Govt. Medical College, Bhavnagar**  
**Year : 2017-2018**

**Insert Mode (New Return)**

Progress in 2017-2018					
	Opening Balance as on April 1st	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted *Including partially rejected cases
Requests	00	59	04	00	55
First Appeals	00	12	NIL	NIL	12

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
01	01	01

No. of times various provisions were invoked while rejecting requests														
Relevant sections of RTI Act 2005														
Section 8 (1)										Sections				
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other	
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	
Amount of Charges Collected (in Rs.)														
Registration Fee Amount			Addition Fee & Any other charges				Penalties Amount							
140			824				Levied - Total - Collected -							

# Gujarat State RTI Annual Return Information System (2005-2007)

## Annual Return Form Year : 2018-2019

Public Authority: Office of the Dean, Govt. Medical College, Bhavnagar

Year : 2018-2019

Insert Mode (New Return)

Progress in 2018-2019					
	Opening Balance as on April 1st	Received duration period (including transferred to other Public Authority)	No. of cases transferred	Decisions where requests/appeals rejected	Decisions where requests/appeals accepted <small>*Including partially rejected cases</small>
Requests	00	20	01	00	20
First Appeals	00	04	NIL	NIL	04

No. of cases where disciplinary action taken against any officer	NIL
--	-----

No. of APIOs designated	No. of PIOs designated	No. of AAs designated
0 1	01	01

No. of times various provisions were invoked while rejecting requests													
Relevant sections of RTI Act 2005													
Section 8 (1)										Sections			
a	b	c	d	e	f	g	h	i	j	9	11	24	other
NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Amount of Charges Collected (in Rs.)													
Registration Fee Amount		Addition Fee & Any other charges				Penalties Amount							
60		682				Levied - Total -							